

# WHY USA WITH URVI TOURS?

21 NIGHTS / 22 DAYS

## અમારા ટુરની વિશેષતાઓ

- ૨૨ દિવસની ટુરમાં ૨૦ દિવસ માણો આપણું Indian Breakfast.
- ૨૧ રાત્રીમાં થી ૧૯ રાત ૪ સ્ટાર હોટેલમાં મુકામ.
- Orlando માં ૩ Theme પાર્ક ટુર કોસ્ટમાં સામેલ.
- ૨ રાત Utah માં મુકામ Antelope Canyon સાથે.
- Las Vegas માં ૪ રાત્રિનો મુકામ.
- ૩ National Park ની મુલાકાત ફક્ત Urvi Luxury Destination સાથે.
- ૨ ઇન્ટરનલ ફ્લાઈટ ટુર કોસ્ટમાં સામેલ.
- આપણા મહારાજ દ્વારા બનાવેલ સ્વાદિષ્ટ ભોજનની મજા માણો Urvi Luxury Destination સાથે.



**SAN FRANCISCO | LOS ANGELES | UTAH | LAS VEGAS | NIAGARA | WASHINGTON D.C | NEW YORK | ORLANDO**

### 2 NIGHTS SAN FRANCISCO



- Guided City Tour
- Lombard Street
- Twin Peaks
- Golden Gate Bridge Recreation Area Etc.
- Golden Gate Bay Cruise
- 17 Miles Drive.

### 3 NIGHTS LOS ANGELES



- Guided City Tour
- Kodak Theatre
- Chinese Theatre
- Hollywood Walk Of Fame Etc.
- Santa Monica Beach
- Universal Studio

### 4 NIGHTS LAS VEGAS



- The Sphere
- David Copperfield Magic Show
- Helicopter Ride
- Limousine Ride
- Fremont Street
- Outlet Mall.

### 2 NIGHTS UTAH





- Horseshoe Bend
- Bryce Canyon
- Antelope Canyon
- Zion National Park.

### 2 NIGHTS NIAGARA FALLS



- Maid of the Mist
- Cave of the Winds
- Scenic Trolley

### 1 NIGHT WASHINGTON



- Hershey's Chocolate Factory
- Guided City Tour of Washington D.C

### 3 NIGHTS NEW YORK



- Statue Of Liberty
- Guided City Tour
- The Edge
- Summit One Vanderbilt
- Beast Boat Ride

### 4 NIGHTS ORLANDO



- Magic Kingdom
- Islands Of Adventure
- Epcot Center



## DEPARTURES OF 2025 :

APR : 19 | MAY : 3, 17 ( SOLD OUT ) , 31 | JUNE : 14, 28

 **JITEN DHAROD** | **NAYAN SONI** | **HARDIK PAREKH** | **SOHIL SHAH**  
 +91 98191 33199 | +91 97570 25247 | +91 99677 72530 | +91 98701 53149  
 1/A, PALM VIEW, L.N. ROAD, NEAR SWAMINARAYAN MANDIR, OPP. VIDYALANKAR CLASSES, DADAR EAST, MUMBAI - 14.  
 CONTACT US : +91 98927 20353 | info@uldestination.com | www.uldestination.com

## હાઈ કોર્ટમાં ગુજરાતીને સત્તાવાર ભાષા બનાવવાની માગ બુલંદ: ૨૧મી ફેબ્રુ.એ કાર્યક્રમો યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં રૂટિન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષા પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે છેલ્લા ઘણાં વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન મારો ન્યાય મારી ભાષામાંના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા હતા. આ અંગે સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ઉચ્ચ ન્યાયાલય ભાષા સમિતિની રચના કરશે. આ સમિતિમાં વિવિધ જિલ્લાના

એક-એક પ્રતિનિધિનો સમાવેશ કરીને ગુજરાતી ભાષાને વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે સ્વીકૃતી મળે તે માટેની નીતિ ઘડાશે અને ૨૧મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસે અને પછી ગુજરાત સ્થાપના દિન પહેલી મેના રોજ એ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયું છે.

અસીમ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાની સ્વીકૃતિ મેળવવા વડા પ્રધાન, કાયદામંત્રી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય પ્રધાનને આ મુદ્દા બાબતે વિગતવાર રજૂઆત કરાશે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત

વિદ્યાપીઠ, તાબાની અદાલતનાં વકીલ મંડળો વગેરે સંસ્થાઓને આ ઝુંબેશમાં જોડીને તેમનું સમર્થન આપતાં કરાવો મેળવશે. અગાઉ સને ૧૯૭૭ અને ૧૯૮૧માં સરકાર દ્વારા રચાયેલી અને પછી ગુજરાત સમાજ સમિતિએ પણ રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટમાં માતૃભાષા ગુજરાતી ભાષાનો ઉપયોગ તબક્કાવાર વધારવાની રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવવા અંગે સ્પષ્ટ ભલામણ કરી હતી. સમિતિની આ ભલામણ વર્ષ ૨૦૧૨માં રાજ્ય સરકારે સ્વીકારી હતી. જો કે, વર્ષ ૨૦૧૬માં સુપ્રીમકોર્ટે હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારવાની ભાષા લાગુ

કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. આ જ પ્રકારે તા.૮-૯-૨૦૨૨ના રોજ પુદ્ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખે પણ હાઈ કોર્ટમાં ગુજરાતી ભાષાની સત્તાવાર અમલવારી માટે રાજ્યપાલને પત્ર લખ્યો હતો.

બંધારણીય જોગવાઈ મુજબ, ભાષાના ઉપયોગ મુદ્દે સુપ્રીમકોર્ટ કે હાઈકોર્ટની કોઈ ભૂમિકા જ નથી. પુદ ગુજરાત બાર કોલેજિયેટ પણ આ વાતને ટેકો આપ્યો હતો. જો કે હવે ફરી એક વખત હાઈકોર્ટમાં માતૃભાષા ગુજરાતીને અધિકૃત રીતે અમલી બનાવવાની માગ બુલંદ બની છે.

## વિધાનસભાનું બજેટ સત્ર ૧૯ ફેબ્રુ.થી શરૂ: ૨૦મીએ નાણાપ્રધાન બજેટ રજૂ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ૧૯ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું અંદાજપત્ર રજૂ કરશે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તા.૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. પંદરમી વિધાનસભાનું બજેટ સત્ર ૨૮મી માર્ચ સુધી ચાલશે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફૂલ ગુલાબી બજેટ આવે તેવી સંભાવના છે. આ સાથે જ સરકાર

લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે. ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચા છે. આ સમયગાળામાં ગુજરાત સરકાર દ્વારા ફૂલ સાત વિવેચકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરનાર છે.

આ ઉપરાંત નવી રચાયેલી મહાનગરપાલિકા માટે માળખાકીય સુવિધા અને નાણાકીય ભંડોળની ફાળવણી કરવામાં આવશે.

સપ્ટેમ્બર ૨૦૨૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે

પુરાંતવાનું રહેવાની શક્યતા છે. સંવિવાલમાં નવા બજેટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને હાલ તમામ વિભાગોએ સંબંધિત પક્ષકારો સાથે બેઠકો કરી પોતાના અંદાજો નાણાં વિભાગને મોકલી આપ્યા છે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિભાગોની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.

દરેક વિભાગોએ મોકલેલી નવી યોજનાઓ તેમજ વર્તમાન યોજનાઓની ફાળવણીમાં વધારા સહિતના મુદ્દે આવકના અંદાજોને સુસંગત રહી યોજનાકીય ફાળવણી માટે ચર્ચા કરવામાં આવી રહી છે.

## મોંઘવારીથી મદ્યમ વર્ગ બેઠાહા અમદાવાદમાં ૫૫૦૫ બાળકોએ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: દેશમાં વધતી જતી મોંઘવારીના કારણે મધ્યમવર્ગીય લોકોને બે ઊંચા ભેગા કરવા ફાંકા પડી રહ્યા છે. વધતી જતી મોંઘવારી સામે આવકમાં વધારો થઈ રહ્યો નથી જેના લીધે ઘર પરિવારનું ગુજરાત ચલાવવું એક મોટો પડકાર બની ગયો છે. રાજ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ મોંઘીદાટ બની ગઈ છે. ત્યારે વાલીઓનો ખાનગી શાળા પ્રત્યેનો મોહભંગ થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને ૫૫,૬૦૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વિવિધ વોર્ડમાં આવેલી ૧૨૯ જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં મ્યુનિસિપલ

કોર્પોરેશન દ્વારા ૨૪ નવી શાળા બનાવવામાં આવશે. વર્ષ ૨૦૨૫-૨૬ના રૂપિયા ૧૧૪૩ કરોડના ડ્રાફ્ટ બજેટ શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ માત્ર રૂપિયા ૭૭.૫૦ કરોડ જ ખર્ચ કરાશે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું રૂપિયા ૧૧૪૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડોક્ટર લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જો કે રૂપિયા ૧૦૪૨.૫ કરોડ તો માત્ર પગાર અને પેન્શનની ચુકવણી પાછળ જ ખર્ચ કરવામાં આવશે. શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ રૂપિયા ૭૭.૫૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજ્ય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૂપિયા ૮૦૮ કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા ૧૩૧ કરોડ આપશે. ૨૦૨૫ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શતાબ્દી વર્ષ છે.

અમદાવાદ: સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે પ્રાથમિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. પ્રાથમિક ક્વિટિબિલિટી ચકાસવા માટે કોચી વોટર મેટ્રોના એક્સપર્ટની ટીમે થોડા સમય અગાઉ સુરતની મુલાકાત લીધી હતી. જેમાં બજેટની જાહેરાતના ૧૦ મહિના પછી કવાયત, રિપોર્ટ પોઝિટિવ આવશે તો એન્જિનિયરિંગ ડેટા, સ્ટ્રી રિપોર્ટ અને છેલ્લે ફાઇનલ ક્વિટિબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે. પરંતુ હવે સરકાર દ્વારા અમદાવાદની સાબરમતી નદીમાં પણ વોટર મેટ્રો શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદમાં હાલ એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન પબ્લિક ટ્રાન્સપોર્ટ રૂંદે અમલમાં છે. આમ છતાં હવે, આગામી સમયમાં કનેક્ટિવિટીને વધારવા માટે કોલકાતાની ટ્રામ સર્વિસની જેમ હાઈટ રેલ ટ્રાન્સિટ અને સાબરમતી નદીમાં વોટર મેટ્રો જેવા પરિવહનના નવા વિકલ્પોની દિશામાં પણ વિચારણા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ભારત સરકાર હસ્તક રહે તેવું માનવામાં

## અમદાવાદની સાબરમતી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવા સરકારે કવાયત શરૂ કરી

આવે છે. અમદાવાદમાં પણ લાઇટ રેલ ટ્રાન્સિટ સિસ્ટમ દાખલ કરાય તેવી શક્યતા નક્કી શકાતી નથી. લાઇટ રેલ ટ્રાન્સિટને પહોળા રસ્તાવાળા જટિલ ટ્રાફિક ઝોનને જોડવાની ગણતરી રાખવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૦૨૫ના બજેટમાં સામેલ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત કોચી વોટર મેટ્રોની સફળતાથી પ્રેરિત થઈને આ મોડેલને ગુજરાતના અમદાવાદ-સુરત સહિતના દેશમાં ૧૮ શહેરોમાં લાગુ કરવાની દિશામાં ભારત સરકારે કાર્યવાહી આગળ વધારી હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે તાજેતરમાં કોચી મેટ્રો રેલ લિમિટેડને દેશના વિવિધ રાજ્યોમાં કોટી જેવી વોટર મેટ્રો સિસ્ટમની સંભાવનાનું મૂલ્યાંકન કરવા માટે શક્યતા અભ્યાસ હાથ ધરવાનું કાર્ય સોંપ્યું હતું. તેના ડિરેક્ટર બોર્ડ દ્વારા કન્સલ્ટન્સી વિંગની રચના કરવાની મંજૂરી મળતાં, કોચી મેટ્રો રેલ લિમિટેડ પ્રારંભિક કાર્ય શરૂ કરવા માટે એક ઇન-હાઉસ સમિતિની રચના પણ કરી છે.

## અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી-ઉદયપુર વચ્ચે ચોથી વંદેભારત ટ્રેનની સેવા શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: ગુજરાતમાં પણ અમદાવાદથી મુંબઈ વચ્ચે ૨ તેમજ સાબરમતીથી જોધપુર વચ્ચે ૧ મળીને કુલ ૩ વંદેભારત ટ્રેન દોડી રહી છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના અસારવા રેલવે સ્ટેશનથી-ઉદયપુર વચ્ચે ચોથી વંદેભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે. આ વંદેભારત ટ્રેન સેવા શરૂ થતાં જ અમદાવાદથી ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ એક સુવિધા મળશે. આ ટ્રેન અસારવાથી ઊપડીને હિંમતનગર ખાતે માત્ર એક સ્ટોપેજ કરીને ૪ કલાકમાં ઉદયપુર પહોંચશે. અસારવાથી ઉદયપુર વચ્ચેની આ વંદેભારત ટ્રેનમાં ૮ કોચ રહેશે. તેમજ આ વંદેભારત ટ્રેન ઉદયપુરથી સવારે ૬.૧૦ કલાકે ઊપડીને

હિંમતનગર ૯.૧૦ મિનિટે પહોંચશે, અને હિંમતનગર ૨ મિનિટ ઊભી રહ્યા બાદ ૯.૧૨ મિનિટે ઊપડીને સવારે ૧૦.૨૫ કલાકે અસારવા સ્ટેશને પહોંચશે. તેમજ આ ટ્રેન અસારવાથી સાંજે ૫.૪૫ કલાકે ઊપડીને ૬.૫૮ કલાકે હિંમતનગર પહોંચશે અને ૭.૦૦ કલાકે ઊપડીને સવારે ૧૦.૦૦ કલાકે ઉદયપુર પહોંચશે તેમજ મંગળવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ ટ્રેન દોડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ-અસારવા-ઉદયપુર લાઈનનું સ્ટોપેજ કરીને ૪ કલાકમાં ઉદયપુર પહોંચશે. અસારવાથી ઉદયપુર વચ્ચેની આ વંદેભારત ટ્રેનમાં ૮ કોચ રહેશે. તેમજ આ વંદેભારત ટ્રેન ઉદયપુરથી સવારે ૬.૧૦ કલાકે ઊપડીને

## વડોદરા ટ્રાફિક પોલીસે ૨૦ દિવસમાં ૯૦થી વધુ મોટા વાહનો અને ૧૮થી વધુ બાઈક કબજે કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ભારદારી સહિતના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસે અભૂતપૂર્વ કાર્યવાહી કરતા છેલ્લા ૨૦ દિવસમાં ૯૦થી વધુ ભારદારી વાહનો અને ૧૮થી વધુ મોટીફાઇઝ અને ઘોંઘાટ કરતા બાઈકો સામે કાર્યવાહી કરી હતી.

કે,ભારદારી વાહનોને આપણે ડિટેન પણ કરીએ છીએ અને સમજ પણ આપીએ છીએ અને ૨૦૨૫ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અનુસંધાને ભારદારી વાહનો ડિટેન કરવાના હોય છે તો અમે તારીખ ૧ થી આજ દિન સુધી લગભગ ૯૪ જેટલા વાહનો ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અન્ય કાર્યવાહીમાં આરટીઓનો મેમો આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવી પોતાનું વાહન પાછું લઈ જાય છે. જાહેરનામા મુજબ રાત્રે

૯:૦૦ થી સવારના ૦૭:૦૦ વાગ્યા સુધી આવી શકે અને દિવસે બપોરે ૧ થી ૪:૦૦ વાગ્યા સુધી આવી શકે છે. પરંતુ તેમની સ્વયં મર્યાદા છે. સિટીમાં પ્રવેશવાની એ દરમિયાનમાં પણ જો એ લોકો સ્પીડથી વાહન ચલાવે, ઓડેયડ પાર્ક કરે તો ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ. એમની જે જોવાઈ મુજબ આરટીઓ પાસે વધુ ડેટા હોય છે પણ એ ગાર્ડી ફરીવાર પકડાઈ તો એને અમે જે દંડ છે એ બહોળો અને બમણો પણ થઈ શકે તે આરટીઓ લેવલથી વચૂલ કરવામાં આવે છે.

## ગુજરાતમાં ૬૪ ટકા બાળકોને મોબાઈલનું વળગણ: સરકાર સ્કૂલો માટે એક એડવાઈઝરી તૈયાર કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: આજના આધુનિક સમયમાં મોબાઈલ ફોન વગરની જિંદગીની કલ્પના જ અશક્ય છે, જો કે આ મોબાઈલ ફોન બાળકો પાસેથી તેમનું બાળપણ છીનવી રહ્યો છે. મોબાઈલ ફોનથી આવતી નિરાશાના કારણે આપઘાત, આપઘાતના પ્રયાસના બનાવો વધ્યા છે. વિતેલા એક જ વર્ષમાં ગુજરાતમાં ૧૨ થી ૧૭ વર્ષના બાળકોએ મોબાઈલ ફોન ન મળવાથી કે મોબાઈલ ફોન ઉપર કોઈ ગેમ કે

અન્ય વળગણથી આપઘાત કર્યાના ચાર બનાવ બની ચૂક્યાં છે. બાળકોના હિંસાત્મક બનાવોના પગલે સરકારે સ્માર્ટ ફોનના વળગણ સામે સ્કૂલો માટે એડવાઈઝરી બનાવવા નિર્ણય કર્યો હતો. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ, રાજ્યના ૬૪ ટકા બાળકોને મુઘતા-ઓછા અંશે મોબાઈલ ફોનની લત છે. સર્વે ચૈકીના ૭૬ ટકા ગ્રામ્ય બાળકો મોબાઈલ ઉપર ગેમ રમે છે, ૬૩ ટકાને કોઈપણ ભોગે મોબાઈલ જોઈએ છે, ૮૧ ટકા બાળકોને

મોબાઈલ ફોન જોતાં-જોતાં જ ખાવાની આદત છે, ૮૫ ટકા બાળકો શારીરિક ગેમ કરતાં મોબાઈલ ગેમ પસંદ કરે છે. તો ૬૬ ટકા માતા-પિતા થોડો સમય મુક્તિ મેળવવા બાળકને મોબાઈલ પકડાવી દે છે. બાળકોમાં સ્માર્ટફોનનું અને સોશિયલ મીડિયાનું એડિક્શન-વળગણ ખૂબ જ વધ્યું છે, ત્યારે રાજ્ય સરકાર સ્કૂલો માટે એક એડવાઈઝરી તૈયાર કરશે. શિક્ષણ ક્ષેત્રના તમામ અધિકારીઓથી માંડી ચિદ્દન

યુનિવર્સિટી પાસેથી આ માટે સરકારે સૂચનો મંગાવ્યા છે. રાજ્યમાં હાલ સ્કૂલોમાં ધો.૧થી ૧૨નાં બાળકોને મોબાઈલ ફોન જવા પર પ્રતિબંધ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ જઈ શકે છે, પરંતુ કલાસરૂમમાં વિદ્યાર્થીઓને ફોન ચાલુ રાખવા પર મંજૂરી નથી. પરંતુ કોરોનામાં ઓનલાઈન શિક્ષણ સ્કૂલોમાં થતા બાળકોમાં સ્માર્ટફોનનું એડિક્શન ખૂબ જ વધી ગયું છે અને ગ્રી પ્રાથમરીથી લઈને ધો.૮ સુધીનાં બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિક્શન જોવા મળી રહ્યું છે.

## ગુજરાતમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો: ૨૦૨૪માં ૧.૨૭ લાખ ફરિયાદો નોંધાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સાયબર સેફ્ટી અંગે અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. તે છતાંય ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને છે. એમ પોલીસ તરફથી મળેલા આંકડાઓમાં જાણવા મળ્યું હતું. સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ લોકોને ઠગવા માટે ૩૪ પ્રકારના ઉપાયો અજમાવે છે. પરંતુ ચાર પ્રકારો મોટા ભાગની ઘટનાઓ માટે જવાબદાર છે. જેમાં ઠગાઈની લિંક, ન્યૂઝ લીડિયો કોલ, શેરબજારમાં રોકાણનું કૌભાંડ અને એપ બેઝ ફ્રોડનો સમાવેશ થાય છે. આજના ટેકનોલોજીના સમયમાં

સાયબર ફ્રોડ પરંપરાગત ગુનાઓનું સ્થાન લઈ રહ્યો છે. રોજિંદા જીવનમાં ટેકનોલોજીની નિર્ભરતા સાથે સાયબર આરોપીઓ સરળતાથી કમજોર લોકોની ઓળખ કરે છે અને તેમને પોતાની જાળમાં ફસાવે છે. આરોપીઓ સામાન્ય રીતે લાલચ, ડર અને પ્રલોભનોનો ઉપયોગ કરીને મેસેજ અને કોલ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવે છે. જ્યારે કોઈ તેમનો શિકાર બની જાય તો આરોપીઓ માટે ગુનાને અંજામ આપવો સરળ થઈ જાય છે. આ પ્રકારના ગુનાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક સાયબર હેલ્પલાઈન

(૧૯૩૦) લોચન કરવામાં આવી હતી. આ હેલ્પલાઈનને ગુજરાતમાંથી રેકોર્ડબ્રેક ફરિયાદો મળી હતી. ૨૦૨૪ના વર્ષમાં રાજ્યમાંથી ૧.૨૭ લાખ ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે ૨૦૨૩ના જાન્યુઆરીમાં ૨૬૮૫ કોલ મળ્યા હતાં. જ્યારે સ્કેમસની મોડસઓપરેન્ડી સતત વિકસી રહી છે. વિઝા સ્કેમ, વીજળી બીલ ફ્રોડ અને બેલકમિંગ જેવા ઠગાઈના કેસમાં ૨૦૨૪માં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સરકારી યોજનાઓ, મેટ્રિમોનિઅલ સાઈટ્સ અને કુરિયર સર્વિસ સેવાઓ સાથે જોડાયેલા સ્કેમમાં પણ તાજેતરમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

## અમદાવાદના લાલ દરવાજા પાસેથી એટીએસ દ્વારા ૨૭ લાખના એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલી ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટે પોલીસ સહિતની એસ-સીઓ સંક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં લાલ દરવાજા પાસેથી એટીએસ દ્વારા ૨૭ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ રેડેટમાં વધુ આરોપીઓ હોવાની શક્યતાના આધારે તપાસ શરૂ કરી હતી. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં હનુમાન ગલી ખાતે રહેતો ફરહાન નામનો યુવક એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે એટીએસની ટીમે દરોડા પાડીને ફરહાન નામના યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૫૫ ગ્રામ જેટલો સફેદ પાઉચર મળી આવતાં તે એમડી

ડ્રગ્સ હોવાની ફરહાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. એટીએસની કચેરીમાં પૂછપરછ થતા ફરહાને તે કોની પાસેથી ડ્રગ્સ લાવે છે તેની મહિતી મળતા એટીએસે ડ્રગ્સ માફિયાને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કર્યાં હતા. ફરહાન પહેલા ચરસનો ધંધો કરતો હતો જેમાં તે દસ વર્ષ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહીને આવ્યો હતો. ફરહાનને પકડવા માટે અમદાવાદ કાઇમ બ્રાંચ, એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ લોકલ કાઇમ બ્રાંચ પણ અસફળ રહી હતી. ફરહાનની ધરપકડ બાદ કોર્ટ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા મોટાં માથાનાં નામ સામે આવે તેવી શક્યતાઓ છે. પોલીસે ડ્રગ્સ માફિયાઓ સહિત હવે નશો કરનારને પકડવા માટે અભિયાન શરૂ કર્યું છે.

## હાઈ કોર્ટમાં બાર એસોસિએશનના પ્રમુખની શાબ્દિક ટપાટપી મુદ્દે સિનિયર વકીલો ચીફ જસ્ટીસને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)  
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટમાં બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા અનાદર મુદ્દે નારાજગી વ્યક્ત કર્યા બાદ સિનિયર વકીલોએ ચીફ જસ્ટીસ સુનિલા અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કોર્ટની ગરીબા અને શિષ્ટાચાર જાળવી રાખવા બાબતે ભાર મૂક્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ અને બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી વચ્ચે ગત શુક્રવારે થયેલી શાબ્દિક ટપાટપી અને ત્યારબાદ ચીફ જસ્ટીસ દ્વારા એક આદેશ પસાર કરીને ત્રિવેદી બાર એસોસિએશનના પ્રમુખ જ નહિ પરંતુ રાજ્યની વડી અદાલતના વકીલ બનવાને પણ લાયક નથી તેવી નોંધ કર્યા બાદ ગુજરાત હાઈ કોર્ટના સિનિયર વકીલો સોમવારે કોર્ટ શરૂ થતા જ ચીફ જસ્ટીસની કોર્ટમાં દોડી આવ્યા હતા અને આવી ઘટના બીજી વખત ના બનવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, બાર અને બેન્ચ વચ્ચે પરસ્પર સહયોગી વાતાવરણ, આદર અને સંકલન હોવું જોઈએ. આ મહાન સંસ્થાની ગરિમા અને શિષ્ટાચાર કોઈપણ કિંમતે જાળવી રાખવો જોઈએ. બીજું, મને નિષ્ઠાપૂર્વક લાગે છે કે કદાચ બધા મારી સાથે સંમત થાય. ન્યાયનું સંચાલન બદનામ થવાથી બચાવવું જોઈએ. ત્રીજું, મને લાગે છે કે બાર અને બેન્ચ વચ્ચે પરસ્પર સહયોગી વાતાવરણ, આદર અને સંકલન હોવું જોઈએ. મને નિષ્ઠાપૂર્વક લાગે છે કે વકીલોને કોર્ટ સાથે કે કોર્ટને વકીલ સાથે કોઈ બિનજરૂરી ટકરાવ હોવો જોઈએ નહીં. કદાચ આપણે એ વાતનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરીએ કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. આ મહાન સંસ્થાનો ઇતિહાસ ૬૦ વર્ષથી વધુ છે. ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, તેમ જે વાત કહી છે તે મારા માટે યથાર્થ છે. સંસ્થામાં ન્યાયાધીશોની જેટલી ભૂમિકા છે તેટલી જ ભૂમિકા વિરિષ્ટ વકીલોની કોર્ટના એક અધિકારી તરીકેની ભૂમિકા છે. એક ચિફ જસ્ટીસ તરીકે તેઓ તમામ અસુવિધાના ઈસ્તમામાં વકીલો અને ન્યાયાધીશો વચ્ચે ચર્ચા-વિચારણામાં દૃઢપણે વિશ્વાસ રાખે છે.

## ગુજરાત યુનિવર્સિટીમાં ૪.૦૯ કરોડની ઉંચાપતના કેસમાં ક્ષાઈમ બ્રાંચ ૬૦ નોલેજ પાર્ટનરની તપાસ કરશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગના પ્રોફેસર કમલજીત લખતરિયા વિરુદ્ધ ૪.૦૯ કરોડની ઉંચાપત મુદ્દે કાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં નોલેજ પાર્ટનરને કુલ આવકમાંથી ૭૦ ટકા રકમ આપવાની હતી પણ તપાસમાં તેનાથી વધુ રકમ આપાઈ હોવાનું કલિત થતાં હવે કાઈમ બ્રાંચ દ્વારા ૬૦ નોલેજ પાર્ટનરની તપાસ થશે અને જો વધુ પૈસા મેળવ્યા હશે તો તેમને શારીરી બનાવશે. કમલજી લખતરિયાએ તપાસ દરમિયાન સ્વીકાર કર્યો હતો કે, અરોહી પૈસા ટ

**મારી યોજના**  
મારી બધી યોજનાઓ, એક જ પોર્ટલ પર

**કેન્દ્ર-રાજ્ય સરકારની તમામ યોજના-સેવાઓની માહિતી**

હવે, એક જ ક્લિક પર

**વિકસિત ભારત**  
**વિકસિત ગુજરાત**

મારી બધી યોજના, એક જ પોર્ટલ પર એક જ ક્લિક પર ઉપલબ્ધ  
<https://mariyोजना.gujarat.gov.in>

# ટ્રમ્પ પ્રમુખ બનતા બિટકોઈનનો ભાવ સાતમા આસમાને

**સ્વાદ માટે અખેડ**  
જુની, જાણીતી અને સર્વેની માનીતી

**લક્ષ્મી**  
SINCE 1900

સંયુક્ત હિંગ  
આર. એમ. કાનાણી એન્ડ કું. - વડોદરા.  
Mob: 9167662203 | rmkfoods.com  
@shinglaxmi | laxmi hing

ન્યૂ યોર્ક: અમેરિકાના ૪૭મા પ્રમુખપદે ૭૮ વર્ષીય ડોનલ્ડ ટ્રમ્પે વીસ જાન્યુઆરી, સોમવારે શપથ લેતા જ બિટકોઈનનો ભાવ ઊછળીને ૧,૦૮,૨૪૧ ડોલર થઇ ગયો હતો અને તેને લીધે વિશ્વની સૌથી વધુ લોકપ્રિય આ ક્રિપ્ટોકરન્સીમાં સોદા કરનારા લોકોમાં ખુશીની લહેર ફેલાઇ હતી.

આમ છતાં, અમેરિકાના પ્રમુખપદે બીજી મુદત માટે ચૂંટાયેલા ટ્રમ્પ ગેરકાયદે વસાહતીઓનો દેશનિકાલ કરવાની બાબત પર ભાર આપતા હોવાથી ગેરકાયદે વસાહતીઓમાં

ફફડાટ ફેલાયો હતો.

ટ્રમ્પ અમેરિકાને 'ક્રિપ્ટોકરન્સીનું કેન્દ્ર' બનાવવા અવારનવાર ભાર દઇ રહ્યા હોવાથી બિટકોઈનના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું કહેવાય છે.

અમેરિકાના ઉપપ્રમુખપદે જે. ડી. વેન્સ આવ્યા છે. અહીં યોજાયેલા ભવ્ય શપથવિધિ કાર્યક્રમમાં ઇલોન મસ્ક સહિત અનેક અબજોપતિ હાજર રહ્યા હતા. દરમિયાન, વિદાય લેનારા પ્રમુખ જો બાઇડેને આક્ષેપ કર્યો હતો કે અમેરિકામાં હવે સત્તા (જુઓ પાનું ૨) >>

**ક્રિપ્ટો કરન્સીનું મૂલ્ય ૧,૦૮,૨૪૧ ડોલર થયું: ગેરકાયદે વસાહતીઓમાં ફફડાટ**



**ANTARA**  
GOLD & DIAMONDS  
DADAR | BORIVALI

**TODAY'S GOLD RATE**  
₹ 72,180/-

PER 10 GRAMS OF 22KT BIS HALLMARKED JEWELLERY

DIAMOND JEWELLERY  
VVS-VS F-G QUALITY  
CERTIFIED NATURAL DIAMONDS

DADAR 022 4041 5565 | BORIVALI 022 6811 5565  
OPEN ON ALL DAYS

## મહાકુંભમાં સતત બીજા દિવસે આગ

પ્રયાગરાજ : મહાકુંભ મેળામાં સેક્ટર ૧૬માં કિન્નર અખાડા કેમ્પમાં સોમવારે આગ લાગી હતી, એવી માહિતી અધિકારીઓએ આપી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આના એક દિવસ પહેલાં રવિવારે અહીં મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોટી આગ લાગી હતી. આગમાં સેક્ટર ૧૯માં ૧૮ તંબુ સળગીને ખાખ થઇ ગયા હતા.

ફાયર ડિપાર્ટમેન્ટ અધિકારીએ માહિતી આપી હતી કે સવારે સાડાનવ વાગ્યે અન્ન ક્ષેત્ર ફાયર સ્ટેશન હેઠળના ટાવરના તેનાત માણસોએ કિન્નર અખાડા કેમ્પમાંથી ધુમાડો નીકળતો જોયો હતો.

આ માણસોએ તરત જ કંટ્રોલ ડમને જાણ કરી હતી. ફાયર ડિપાર્ટમેન્ટના વાહનો અને વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા કર્મચારીઓને સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જોકે તેઓ ઘટનાસ્થળે પહોંચે પહેલાં જ લોકોએ પાણી અને રેતી નાખીને આગ બુઝાવી દીધી હતી.

અધિકારીઓએ માહિતી આપી હતી કે નિરિક્ષણ કર્યા બાદ માલૂમ પડ્યું હતું કે શ્રી હરિ દિવ્ય સાધના પીઠ કેમ્પમાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રવિવારે ગીતા પ્રેસ અને અખિલ ભારતીય ધર્મ સંઘે કલ્પવાસીઓ (જુઓ પાનું ૨) >>

## તેલંગાણાના વિદ્યાર્થીની અમેરિકામાં ગોળી મારીને હત્યા

હેડરાબાદ: તેલંગાણાના ૨૬ વર્ષીય વિદ્યાર્થીની અમેરિકામાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું તેના પરિવારના સભ્યોએ સોમવારે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, કે રવિ તેજા, ૨૦૨૨ માં અમેરિકા ગયો હતો અને આઠ મહિના પહેલાં એમએસનો કોર્સ પૂર્ણ કર્યા પછી નોકરી શોધી રહ્યો હતો.

તેમણે સરકારને વિનંતી કરી હતી કે રવિના પાર્થિવ શરીરને શક્ય તેટલી વહેલી તકે અહીં પાછા લાવવામાં મદદ કરે.

રવિના શોકગ્રસ્ત પિતાએ પત્રકારોને જણાવ્યું "મને ખબર પડી છે કે મારા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સરકારને મારી અપીલ છે કે (જુઓ પાનું ૨) >>

**MAHABALESHWAR HOTEL**  
**Rajesh**  
Pure Veg.  
stay@hotelrajesh.com  
A/c Rooms with Swimming Pool  
Gujarati Thali & Indian, Chinese Restaurant  
Ph: 9769894565 / 8104294880  
www.hotelrajesh.com

## ગડકરી ગોવામાં દેશના પ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કરશે

પણજી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મંગળવારે વળાંક પર બનેલા ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કરશે, એવી વાત ગોવા સરકારના એક અધિકારીએ જણાવી હતી.

આ સાથે ગડકરી ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ચાર હાઇવે વિસ્તરણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

"કેબલ-સ્ટેડ બ્રિજ સદાને વરુણપુરી અને ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને જોડે છે. ૧૮૦ ડિગ્રીના અનોખા વક્ર બ્રિજ સાથે તે ભારતમાં આ પ્રકારનું પ્રથમ માળખું છે,"

એવી માહિતી અધિકારીએ સોમવારે આપી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી જે ચાર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે તેમાં પોંડાથી ભોમા સેકશન (એનએચ-૭૪૮), સુઆરીથી મારગાઓ બાયપાસ (એનએચ-૬૬), નાવેલિમથી કુનકોલિમ સેકશન (એનએચ-૬૬) અને બેન્ગરેરેમથી કણાટિક સરહદ (એનએચ-૬૬)નો સમાવેશ થાય છે, જેની કિંમત ૧૩૭૬.૧૨ કરોડ રૂપિયા છે, અધિકારીએ એવી માહિતી આપી હતી. પોંડાથી ભોમા સેકશન પોંડા, બાંદોરા, પ્રિયોલ, (જુઓ પાનું ૨) >>

## અમિત શાહ વિરોધી ટિપ્પણીનો કેસ રાહુલ સામેની બદનક્ષીની કાર્યવાહી રોકતી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કરેલી બદનક્ષીપૂર્ણ ટિપ્પણીને મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસને મામલે ટ્રાયલ કોર્ટમાં હાથ ધરવામાં આવનારી બદનક્ષીના કેસની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો.

અમિત શાહ વિરુદ્ધ કરેલી બદનક્ષીપૂર્ણ ટિપ્પણીને મામલે

ભાજપના કાર્યકર્તા નવિન ઝાએ વર્ષ ૨૦૧૯માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ ચાઈબાસા ખાતે એક સભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ અમિત શાહનો ઉલ્લેખ 'હત્યારા' તરીકે કર્યો હતો.

ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ (જુઓ પાનું ૨) >>

## ડૉક્ટર પરના બળાત્કાર, હત્યા કેસ સંજય રોયને જનમટીપ

કોલકાતા: સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ ખાતે ફરજ પરની ડૉક્ટરનાં બળાત્કાર અને હત્યાને મામલે દોષી કરેલા સંજય રોયને કોલકાતા કોર્ટે સોમવારે જનમટીપની સજા ફટકારી હતી.

ગયા વર્ષની નવમી ઓગસ્ટે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડૉક્ટર પર કરવામાં આવેલા બળાત્કાર અને હત્યાને મામલે સિલકાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ અનિર્બાન દાસે શનિવારે સંજય રોયને દોષી જાહેર કર્યો હતો.

દાસે કહ્યું હતું કે આ ગુનો 'રેરેસ્ટ રેર' શ્રેણીનો ન હોવાને કારણે દોષીને મૃત્યુદંડ ન આપવાના નિર્ણયને ન્યાયી ઠેરવે છે.

કોલકાતા પોલીસના ભૂતપૂર્વ સિવિક વોલન્ટિયર રોયને ભારતીય ન્યાય સંહિતા (બીએનેસ)ની કલમ ૬૪ (બળાત્કાર), ૬૬ (જુઓ પાનું ૨) >>

## દેશની એકતામાં જ ખરી તાકાત છે : મોહન ભાગવત

કોચી : મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારતની તાકાત એકતાના સત્યમાં સમાયેલી છે જે સફળ અને વિજયી છે.

વડાધામડી ખાતે આરએસએસની બેઠકને સંબોધિત કરતાં ભાગવતે કહ્યું હતું કે હિન્દુઓની જીવનશૈલીમાં બધા પ્રશ્નોના ઉકેલ છે અને વિશ્વમાં પરમ શાંતિ લાવે છે. ભાગવતે કહ્યું હતું કે સંઘ હિન્દુ સમાજને એક કરે છે અને ધર્મ જાળવીને વિશ્વમાં (જુઓ પાનું ૨) >>

## કાશ્મીરમાં એક સૈનિક શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં રાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયો હતો, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.

સોપોર પોલીસ જિલ્લાના ઝાલુરા ગુજરપતિ ખાતે એક છૂપા સ્થળે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક સૈનિક ઘાયલ થયો હતો અને ગોળીબારના સ્થળેથી તેને બહાર કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

રવિવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓનાં છૂપાં ઠેકાણાંને તોડી પાડતી વખતે આગ જોઈ ત્યારે તેમણે ઘેરાબંધી કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણે (જુઓ પાનું ૨) >>

## એનસીસીના કેડેટ્સ દેશની કીમતી જાણસ : રાજનાથ

નવી દિલ્હી : ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એનસીસીના કેડેટ્સને કહ્યું હતું કે તમે દેશની કીમતી જાણસ છો અને તમે રાષ્ટ્ર ઘટતર અને સમૃદ્ધિ લાવવામાં યોગદાન આપશો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનસીસીના ભૂતપૂર્વ કેડેટ હતા અને તેમણે વિકસિત ભારતનું વિઝન આપ્યું છે એવી નોંધ લઈને રાજનાથ સિંહે સોમવારે કેડેટ્સને સલાહ આપી હતી કે તેઓ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત દેશ બનાવવાના મોદીનાં સપનાને (જુઓ પાનું ૨) >>

## યુદ્ધવિરામ કરાર: ઇઝરાયલે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા

રામલલાહ: ઇઝરાયલે હમાસ સાથેના યુદ્ધવિરામ કરારના ભાગરૂપે સોમવારે વહેલી સવારે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યાં હતા. આ મુક્તિના થોડા કલાકો પહેલા જ હમાસે ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યાં હતા, જે ઇઝરાયલ પહોંચી ગયા છે.

ઇઝરાયલના ઓફર જેલના દરવાજામાંથી ડઝનબંધ કેદીઓને લઈને એક મોટી બસ નીકળી હતી. જેમાં તમામ મહિલાઓ અને સગીરો હતા. પેલેસ્ટિનિયન ઓથોરિટીના કેદી બાબતોના આયોગ દ્વારા (જુઓ પાનું ૨) >>

**SOUTH AFRICA**

CAPE TOWN - GARDEN ROUTE - PORT ELIZABETH - PILANESBERG - SUNTICITY - JOHANNESBURG

13 DAYS

DEP DATES	04 <sup>th</sup> MAY	11 <sup>th</sup> MAY	17 <sup>th</sup> MAY	25 <sup>th</sup> MAY	30 <sup>th</sup> MAY	07 <sup>th</sup> JUN	20 <sup>th</sup> JUN
-----------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

**Package Inclusions :**

- Helicopter Ride, Hop On Hop Off Bus, Walk with Lion, Catamaran Ride, Safari Game Drive અને Hermanus નો અદભુત અનુભવ.
- વર્લ્ડ ક્લાસ એરલાઈન દ્વારા પ્રવાસ.
- રાજસ્થાની મહારાજ - શુદ્ધ શાકાહારી / જૈન જમણ.
- ગુજરાતી, હિન્દી અને ઈંગલિશ જાણતા ટૂર મેનેજર ની સેવા.
- વીઝા, એન્ટ્રન્સ ફી સહિત તમામ ખર્ચ ટૂર કોસ્ટ માં જ સામેલ.

**SHAH SHAH HOLIDAYS**

203, Man Excellenza, 2<sup>nd</sup> Floor, Opp. Pawan Hans, S. V. Road, Vile Parle (W), Mum-56.  
 07506679945, 09004994449, 09324064281 (022) 26103073, 74

# એક્સ્ટ્રા અરેર

ભરત ભારદ્વાજ  
feedback@bombaysamachar.com

## ટ્રમ્પ ભારતને નુકસાન ના કરે એવી આશા રાખીએ

અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની ૨૦ જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ લીધા અને ચાર વર્ષના ગાળા પછી ફરી દુનિયામાં સૌથી શક્તિશાળી શાસક બની ગયા. ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સાથે અમેરિકામાં ફરી એક જૂની પરંપરા પણ સ્થાપિત થઈ.

અમેરિકામાં વિદાય લઈ રહેલા પ્રમુખ નવા પ્રમુખ માટે લક્ષરી પ્લેનની વ્યવસ્થા કરે છે કે જેથી શપથવિધિ માટે રાજધાની વોશિંગ્ટન ડીસી આવી શકાય. અમેરિકામાં વરસોથી સત્તાથી બહાર જઈ રહેલા પ્રેસિડેન્ટ માટે આ પ્રકારનું સૌજન્ય બતાવે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ સૌજન્ય ચૂકી ગયા હતા. ટ્રમ્પ તો સત્તા છોડવા જ તૈયાર નહોતા તેથી ૨૦૨૧માં બાઈડન માટે લક્ષરી પ્લેન નહોતું મોકલ્યું. આ કારણે બાઈડને ખાનગી વિમાન દ્વારા વોશિંગ્ટન આવવું પડ્યું હતું.

જો બાઈડને જેવા સાથે તેવા થવાના બદલે જૂની પરંપરાને ફરી જીવિત કરવાનું મુનાસિબ સમજ્યું અને ભૂતપૂર્વ પ્રમુખોએ બતાવેલા સૌજન્યની પરંપરાને ફરી સ્થાપિત કરીને ટ્રમ્પને લેવા માટે એરફોર્સના સી-૩૨ લક્ષરી વિમાનને મોકલ્યું. ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ માટે શનિવારે બપોરે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચથી એરફોર્સના આ સી-૩૨ લક્ષરી વિમાનમાં બેસીને પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન ટ્રમ્પ સાથે વોશિંગ્ટન પહોંચી ગયા હતા. આ ફ્લાઈટને સ્પેશિયલ એર મિશન ૪૭ નામ આપવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ હશે તેથી મિશન ૪૭ નામ અપા્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી શું કરે છે તેના પર સૌની નજર છે. ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બહુ બધાં વચનો આપેલાં અને પોતે સત્તામાં આવતાં જ તેનું પાલન કરશે એવી ખાતરી પણ આપી હતી. અમેરિકામાં પ્રમુખ પાસે અમર્યાદિત સત્તાઓ છે. અમેરિકામાં પ્રમુખ એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડી શકે છે. પ્રમુખ દ્વારા એકપક્ષીય રીતે જાહેર કરવામાં આવતા એક્ઝિક્યુટિવ ઓર્ડર માટે અમેરિકાની સંસદ એટલે કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી હોતી. કોંગ્રેસ એક્ઝિક્યુટિવ

ઓર્ડરને બદલી ના શકે તેથી આ ઓર્ડર તરત અમલી બનતા હોય છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે, પણ તેમાં બહુ સમય જાય છે તેથી એક્ઝિક્યુટિવ ઓર્ડરને પ્રમુખનું ખાસ હથિયાર માનવામાં આવે છે.

ટ્રમ્પની ટીમે કરેલી જાહેરાત પ્રમાણે સોમવારે શપથ લીધાં પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી કરશે ત્યારે ૧૦૦થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરશે. ટ્રમ્પની ટીમે ટ્રમ્પ પ્રમુખ તરીકે બીજી ઈનિંગની શરૂઆત કરે એ પહેલાં આ ઓર્ડર તૈયાર કરી દીધા હતા અને ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પ્રમુખ બેસે એ પહેલાં ઓવલ ઓફિસમાં ટ્રમ્પના ટેબલ પર તમામ એક્ઝિક્યુટિવ ઓર્ડર મૂકી દેવાયા હોવાનો દાવો પણ ટ્રમ્પની ટીમે કર્યો હતો. ટ્રમ્પનાં ચૂંટણી વચનો પૂર્ણ કરવાના ઉદ્દેશથી આ એક્ઝિક્યુટિવ ઓર્ડર તૈયાર કરવામાં આવ્યા હોવાનું એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું.

ટ્રમ્પે કહેલું કે, પોતે પ્રમુખપદની બીજી ઈનિંગમાં પહેલા દિવસે રેકોર્ડ સંખ્યામાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરવાના છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મેક્સિકોની સરહદ સીલ કરવી, ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સને દેશનિકાલ કરવા અને ટ્રાન્સજેન્ડર્સને મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ સહિતના એક્ઝિક્યુટિવ ઓર્ડર તૈયાર છે. આ લેખ વાંચતા હશે ત્યારે આ પૈકી કેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ટ્રમ્પે સહી કરી દીધી તેની ખબર પડી ગઈ હશે તેથી તેના વિશે ચર્ચા પછી કરીશું, પણ ટ્રમ્પ અમેરિકાને એક નવા યુગમાં લઈ જશે એ સ્પષ્ટ છે. આ યુગ સારો હશે કે ખરાબ હશે એ ખબર નથી, પણ ટ્રમ્પે ઘણું બધું નવું કરશે તેમાં કોઈ શંકા નથી.

અમેરિકાની પ્રજા માટે અને અમેરિકાના ભવિષ્ય માટે આ બધા એક્ઝિક્યુટિવ ઓર્ડર મહત્વના છે તેથી અમેરિકામાં તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પણ ભારત માટે વધારે મહત્વની બાબત ટ્રમ્પની આર્થિક અને વિદેશ નીતિઓ છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતથી આવતા માલ-સામાન પર ૧૦૦ ટકા ટેક્સ લાદવાથી માંડીને ભારતીયોના અમેરિકામાં પ્રવેશ સહિતના મુદ્દે આકર્ષ્ય વલણ અપનાવવાની ધમકીઓ આપેલી. આ પૈકી ટ્રમ્પ કેટલી ધમકીઓનો અમલ

કરે છે અને ક્યારે કરે છે તેના પર ભારતની નજર છે.

ભારતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના ભક્તોએ મોદી અને ટ્રમ્પની દોસ્તીની વાતો બહુ ચલાવી છે. મોદી સાથેની દોસ્તીના કારણે ટ્રમ્પ ભારતનાં હિતોને કોઈ નુકસાન નહીં પહોંચાડે એવા દાવા પણ મોદીના સમર્થકો દ્વારા કરાતા હતા, પણ ટ્રમ્પનું અત્યાર સુધીનું વલણ મોદી તેમના દોસ્ત હોય એવું નથી ને દોસ્ત હોય તોપણ આ દોસ્તીને ખાતર ટ્રમ્પ ભારતનાં હિતોને નુકસાન નહીં કરે એવું તો જરાય નથી.

ટ્રમ્પે સૌથી પહેલાં તો પ્રમુખપદે ચૂંટાયા પછી મોદીની સાવ ઉપેક્ષા કરી છે. ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાયા પછી મોદી સૌથી પહેલાં ફોન કરનારા નેતાઓમાં એક હતા ને ટ્રમ્પે જેમના ફોન લીધા એવા સૌથી પહેલા ત્રણ નેતાઓમાં મોદી એક હતા એવું આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતે કહ્યું છે તેથી તેના વિશે શંકા ના કરી શકાય, પણ એ પછી ટ્રમ્પે મોદી તરફ કોઈ ઉષ્મા કે સૌજન્ય નથી બતાવ્યાં એ પણ હકીકત છે.

ટ્રમ્પે મોદીને પછી ફોન કરવાનું પણ ટાળ્યું અને વ્યક્તિગત રીતે શપથવિધિમાં હાજર રહેવા માટેનું નિમંત્રણ પણ ના આપ્યું. તેનો અર્થ સ્પષ્ટ છે કે, મોદીના સમર્થકો કહે છે એવી કોઈ દોસ્તી ટ્રમ્પ અને મોદી વચ્ચે નથી. ભારતના લોકોને તેનાથી કોઈ ફરક પડતો નથી કેમ કે ભારત માટે પોતાનાં હિતો મહત્વનાં છે, આ હિતો જળવણી કે નહીં એ મહત્વનું છે કેમ કે ભારત માટે હાલનાં કાળ બહુ કપરો છે.

ભારતનું અર્થતંત્ર જબરદસ્ત વિકાસ કરી રહ્યું છે એવું ફૂલગુલાબી ચિત્ર ઊભું કરાવ્યું છે, પણ વાર્તાવિક્રતા અલગ જ છે તેનો અહેસાસ સૌને થઈ જ ગયો છે. મોદી સરકાર રૂપિયાનું પતન રોકી શકતી નથી, નિકાસ વધારી શકી નથી કે ભારતની બીજા દેશો પરની નિર્ભરતા પણ ઓછી કરી નથી શકી. આ સંજોગોમાં ટ્રમ્પ ચાલી ટાઈટ કરે તો ભારત માટે પડતા પર પાટું જેવી હાલત થાય. ટ્રમ્પનાં પગલાંને કારણે ભારતની નિકાસ ઓછી થાય એ આપણને કોઈ કાળે પરવડે તેમ નથી તેથી આશા રાખીએ કે ટ્રમ્પ એવું કશું ના કરે.

### આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા  
(સૌર હેમંતશુક્રવતી પ્રારંભ),  
મંગળવાર, તા. ૨૧-૧-૨૦૨૫, શ્રી રામાનંદાચાર્ય જયંતી, કાલાષ્ટમી

- ભારતીય હિંદાંક ૧, માંહે માઘ, શકે ૧૯૪૬
- વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, પૌષ વદ - ૭
- જૈન વીર સંવત ૨૫૫૧, માંહે પૌષ, તિથિ વદ-૭
- પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માંહે ૬ઠ્ઠો શહેરવર, સને ૧૩૯૪
- પારસી કદમી રોજ ૧૦મો આવા, માંહે ૭મો મેહેર, સને ૧૩૯૪
- પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માંહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
- મુસ્લિમ રોજ ૨૦મો, માંહે ૭મો રજજબ, સને ૧૪૪૬
- મીસરી રોજ ૨૨મો, માંહે ૭મો રજજબ, સને ૧૪૪૬
- નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૩-૩૬ સુદી, પછી સ્વાતિ.
- ચંદ્ર કન્યામાં સપારે ક. ૧૦-૦૨ સુદી, પછી તુલામાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: કન્યા (૫, ૬, ૭), તુલા (૨, ૩)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૮, સ્ટા. ટા.
- મુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ • ભરતી: સાંજે ક. ૧૭-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૩૬ (તા. ૨૨) • ઓટ: સપારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૨-૩૦
- વ્રત પર્વાઈ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોદી’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ - સપ્તમી. શ્રી રામાનંદાચાર્ય જયંતી, કાલાષ્ટમી, ભારતીય માઘ માર્ગાર્ભ, બુધ પૂર્વમાં અસ્ત થાય છે. મંગળ મિથુનમાં વક્રી થાય છે.
- શુભાશુભ દિવસ: શુભ દિવસ. • મુદ્દત્ વિશેષ: લગ્ન. મંગળ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મંગળ શાંતિ, બીલીનું વૃક્ષ વાવવું, બીલીના વૃક્ષનું પૂજન, શિવજીને બીલીના પાન અર્પણ કરવા. શિવપરિવાર પૂજા, ચંડીપાઠ, હવન, વિદ્યારંભ, નવાં વસો, આભૂષણ, મહેલી લગાવવી, ભિત્ય થતાં પશુ લે-વંચ, દસ્તાવેજ, હુકાન-વેપાર, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા.
- આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ ખટપટીયો સ્વભાવ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ નોકરીમાં પુરુષાર્થ. • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૨૨). ચંદ્ર ચિત્રાના તારા સાથે યુતિ કરે છે. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે. બુધનો પૂર્વમાં અસ્ત થાય છે.
- ગ્રહગોચર: સૂર્ય-મકર. વક્રી મંગળ-કર્ક/મિથુન, બુધ-દ્યુન, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, વક્રી હર્ષલ-મેષ. માર્ગ નેષ્ટ્યુન-મીન, માર્ગ પ્લુટો-મકર.

## સર્બિયામાં વૃદ્ધાશ્રમમાં આગ ફાટી નીકળતા આઠનાં મોત

બેલગ્રેડ: સર્બિયાની રાજધાની બેલગ્રેડના સીમાડાના વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં સોમવારે સવારે આગ ફાટી નીકળતા આઠ લોકોનાં મોત થયા હતા. આ માહિતી સર્બિયાના સરકારી ટેલિવિઝન આરટીએસના અહેવાલમાં બહાર આવી હતી. પોલીસના

જણાવ્યા અનુસાર બેલગ્રેડના દક્ષિણ છેડાના વિસ્તારમાં આવેલા બારાજેવો નગરપાલિકામાં સવારે ૩-૩૦ વાગ્યાની આસપાસ ફાટી નીકળેલી આગમાં સાત લોકો ઘાયલ થયા હતા. આ અંગે પોલીસે તાત્કાલિક કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

## મણિપુરમાં હથિયાર-દારૂગોળો જપ્ત

ઇમ્ફાલ: મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળે છે. આ જાણકારી પોલીસે સોમવારે આપી હતી. ન્યૂ કીથેલમાનબી પોલીસ સ્ટેશન વિસ્તારના હુમ્પોજોંગ રિજમાંથી હથિયાર અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે જપ્ત કરાયેલાં હથિયારોમાં એક ૭.૬૨ એમએમ સ્નાઇપર રાઇફલ, મેગેઝિન સાથે પાંચ ૯ એમએમ પિસ્તોલ, બે એસબીબીએલ બંદૂક, બે ૩૬ ગ્રેનેડ, અનેક રાઉન્ડ દારૂગોળો, બે સ્ટન શેલ અને એક ટીચર ગેસ શેલનો સમાવેશ થાય છે.

## તિરુપતિ મંદિરમાં ₹ ૯ કરોડનું દાન આપતો શ્રદ્ધાળુ

તિરુપતિ: ચેન્નાઈ સ્થિત શ્રદ્ધાળુએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં (ટીટીડી)ને રૂપિયા ૯ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, એવી માહિતી સત્તાવાળાઓએ આપી હતી. વર્ધમાન જેને શ્રી વેંકટેશ્વર ભક્તિ ચેનલ (એસવીબીસી)ને પાંચ કરોડ રૂપિયાનું અને શ્રી વેંકટેશ્વર ગૌસંસ્કૃષ્ટ દ્રસ્તને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ટીટીડીએ રવિવારે રાત્રે અખબારી યાદીમાં કહ્યું હતું કે જેને તિરુમાલા મંદિરમાં રંગનાચકુલા મંડપમમાં પાંચ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ એસવીબીસી અને એક કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ગૌસંસ્કૃષ્ટ દ્રસ્તને આપ્યો હતો. એસવીબીસી એ ટીટીડીની ટેલિવિઝન ચેનલ છે જે આધ્યાત્મિક પ્રવૃત્તિ અને કાર્યક્રમોનું પ્રસારણ કરીને હિન્દુ ધર્મનો પ્રસાર કરે છે અને એને આગળ વધારે છે. જ્યારે ગૌસંસ્કૃષ્ટ દ્રસ્ત ગાયનું રક્ષણ કરવા પર અને એના ધાર્મિક મહત્વ સમજાવવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. (એનસી) ■

પહેલા પાનાનું ચાલુ	ટ્રમ્પ પ્રમુખ	ગડકરી ગોવામાં	મહાકુંભમાં	તેલંગાણાના	સંજય રોયને
અતિ શ્રીમંત લોકોના હાથમાં આવી છે. ટ્રમ્પ કેનેડાને અમેરિકામાં ભેળવીને તેને ૫૧મું રાજ્ય બનાવવાની, ગ્રીનલેન્ડ અને પનામા નહેર અમેરિકાના કબજામાં લેવા હિલચાલ કરી રહ્યા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોવાનો ભાર સંભાળે તેનાં ગણતરીના કલાકો અગાઉ જ બિટકોઈનનો ભાવ વધીને ૧,૦૯,૨૪૧ ડોલર થઈ ગયો હતો. ક્રિપ્ટોકરન્સી ઈન્વેસ્ટમેન્ટ્સ માન્યું છે કે ટ્રમ્પ સત્તા પર આવતાની સાથે જ પગલાં લેશે. બિટકોઈન વિશ્વનું સૌથી લોકપ્રિય ચલણ છે અને બેંક કે સરકારનો તેનાં પર કોઈ રીતે અંકુશ ન હોય એવા ચલણ તરીકે વર્ષ ૨૦૦૯માં તેની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ બિટકોઈન જેવી અનેક નવી ક્રિપ્ટોકરન્સી ચલણમાં આવી ગઈ છે. થોડા વર્ષ અગાઉ બિટકોઈન શંકાસ્પદ અને સ્કેમ ગણાતા હતા. ચૂંટણીપ્રચારના આરંભ તબક્કામાં ટ્રમ્પે સત્તા પર આવવાના ૧૦૦ દિવસની અંદર નવી ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવાની, અમેરિકાને ક્રિપ્ટોની રાજધાની બનાવવાની અને ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ માટે મિત્રતાપૂર્ણ નિયમો ધરાવતી જાહેરાત કરી હતી. ગયા વરસે બિટકોઈન ફોન્ડરસમાં ટ્રમ્પે કહ્યું હતું કે ક્રિપ્ટોધારકો મારી સાથે ખૂબ મુશ્કેલી રહેશે. અતિ પ્રવાહીતા, ગુનેગારો, કૌભાંડીઓ, બદમાશ રાષ્ટ્રો દ્વારા ક્રિપ્ટોકરન્સીના કરવામાં આવતા ઉપયોગને લીધે તેનાં અર્થાતિ ઉપયોગે ડિજિટલ કરન્સી અનેક ટીકાકારોની ટીકાનો ભોગ બની છે. આમ છતાં ક્રિપ્ટોકરન્સીએ ટૂંકગાળામાં અનેક ચઢાવણીતર વચ્ચે ટીકાકારોને ખોટા પાડ્યા છે અને બાઈડન વહીવટીતંત્ર દ્વારા અચોચ રીતે નિશાન બનાવવામાં આવેલા ક્રિપ્ટો ઉદ્યોગના માલેતુઓએ ગયા વર્ષના નવેમ્બરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને વિજયી બનાવવા ખૂબ મદદ કરી હતી. ટ્રમ્પના વિજયને પગલે બિટકોઈનના ભાવમાં અસાધારણ વધારો જોવા મળ્યો હતો. હજુ માત્ર બે વર્ષ અગાઉ જ બિટકોઈનનો ભાવ ૨૦,૦૦૦	ડોલર હતો જે હવે વધીને ૧,૦૯,૨૪૧ ડોલર પહોંચી ગયો છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેઓએ અમેરિકન ગણતરીના કલાકો અગાઉ જ સેલિબ્રિટીઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ટ્રમ્પના વિશેષ અતિથિ તરીકે સમારોહનું આમંત્રણ મળ્યું હતું. મુકેશ અંબાણી શનિવારે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. તેમણે ટ્રમ્પ સાથે કેન્ડલલાઈટ ડિનરમાં પણ હાજરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ સાથે કેન્ડલ લાઈટ ડિનરમાં ભાગ લેનાર તે એકમાત્ર ભારતીય હતા. આ દરમિયાન તેઓ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા વેન્સને પણ મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી દંપતીએ ટ્રમ્પ પરિવારના અંગત આમંત્રિતો તરીકે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારના ટ્રમ્પ પરિવાર સાથે સારા સંબંધો છે. ૨૦૧૭માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ ઓબામા એન્ટરપ્રેન્યોરશિપ સમિટ માટે હૈદરાબાદ આવી હતી ત્યારે અંબાણી ત્યાં હાજર હતા. જ્યારે ઈવાન્કા ટ્રમ્પની સલાહકાર હતી. ફેબ્રુઆરી ૨૦૨૦માં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ભારત આવ્યા ત્યારે અંબાણી પણ હાજર હતા. વર્તમાન જો બાઈડન અને તેમના પત્ની જીલ બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને તેમના પતિ જેન્ડલમેન ડગ એમહોફ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ઍબ્યુ બુશ અને બિલ ક્લિન્ટન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ટેક ઉદ્યોગસાહસિક ઇલોન મસ્ક, અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, એપલના ચીફ એક્ઝિક્યુટિવ્સ ટિમ કૂક અને માર્ક ઝકરબર્ગ, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ સુંદર પિચાઈ હાજર રહ્યા હતા. તેમની કંપનીઓએ શપથ ગ્રહણ સમારોહ માટે દસ લાખ યુએસ ડોલરનું દાન આપ્યું છે. (એનસી) ■	કુન્કોલિયમ, કુંઝાઈમ, ભોમા, કોર્લિમ, ઓલ્ડ ગોવા અને પણજી વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરશે, જ્યારે યુઆરથી માર્ગવા બાયમાસ ઔદ્યોગિક વસાહતોમાંથી પસાર થશે અને ડાબોલિમ એરપોર્ટ, મોમ્બાઈઓ બંદર અને પોંડા શહેરને જોડશે, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે, નાવેલિમથી કુન્કોલિયમ સેક્શન પણજી, માર્ગાવો, ડાબોલિમ એરપોર્ટ, મોમ્બાઈઓ બંદર અને દક્ષિણ ગોવા તેમજ કર્ણાટકના કેટલાક અન્ય વિસ્તારોને જોડશે. રાજ્ય સરકારના પ્રસ્તારોએ જણાવ્યું હતું કે આ પરિવર્તનશીલ માળખાકીય પ્રોજેક્ટ્સ છે જે રાજ્યના બે એરપોર્ટ અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતના સ્વપનદ્રષ્ટા નેતૃત્વ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘‘આ પ્રોજેક્ટ્સ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા અને ગોવાના આર્થિક વિકાસ તેમજ પ્રાદેશિક વિકાસ માટે ઉત્તરેક તરીકે સેવા આપવાનો હેતુ ધરાવે છે.’’	માટે સથાપેલા કેમ્પમાં વિકરાળ આગ લાગી હતી. આગ ઝડપથી પ્રસરી હતી અને ૧૮ તંબુ બળીને ખાખ થયા હતા. આગને લીધે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અખાડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભાર્કર મિશ્રાએ કહ્યું હતું કે સેક્ટર ૧૮માં બે ગેસ સિલિન્ડર ફાટ્યાં હતાં. આને લીધે કેમ્પમાં વ્યાપક આગ લાગી હતી. પંદર જેટલા ફાયર ટેન્ડર આગ ઓલવવાના કામે લગાડાયા હતા. યુપી ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ માહિતી આપી હતી કે સિલિન્ડર બ્લાસ્ટને લીધે મહાકુંભમાં મોટી આગ લાગી હતી. આગને લીધે ૧૮ તંબુ બળીને ખાખ થયા હતા. ઓપરેશન ચાલુ કર્યું હતું. અમે દરેકની સુરક્ષા માટે મા ગંગાને પ્રાર્થના કરીએ છીએ. હેન્ડલ એક ક્લિપ શેર કરી હતી જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં કાળો ધુમાડો નીકળતો દેખાતો હતો. મહાકુંભ ૨૦૨૫ના સત્તાવાર હેન્ડલમાં પોસ્ટ મુકાઈ હતી કે અતિશય ખેંદજનક! મહાકુંભમાં આગના બનાવે બધાને ચોકાવી દીધા છે. વહીવટીતંત્રે તત્કાળ બચાવ અને રાહત અહીંના તુલસી માર્ગ પર સેક્ટર ૧૯ રેલવે ક્રિજની નીચે વિવેકાનંદ સેવા સમિતિ, વારાણસીના તંબુઓ આગમાં સળગી ગયા હતા. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ ૨૭ જાન્યુઆરીએ મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરવા આવવાના છે. અહીં દરરોજ લાખો શ્રદ્ધાળુ ઉપરાંત મહાનુભાવો આવી રહ્યા હોવાથી કડક સલામતી વ્યવસ્થા કરાઈ છે. મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીના શિવરાત્રિ સુધી ચાલવાનો છે અને એમાં દેશવિદેશથી ૪૫ કરોડ લોકો આવવાની આશા છે.	શક્ય તેટલી વહેલી તકે તેનું પાર્થિવ શરીર પરત મોકલવામાં આવે. ત્યાર સુધી હું જીવતો રહીશ કે નહીં (શરીર આવે ત્યાં સુધી), હું બીજું કંઈ કહી શકતો નથી.’’ રવિએ તેના પિતાને કહ્યું હતું કે તે નોકરી મેળવીને ઘરે પાછો આવશે. અગાઉ નવેમ્બર ૨૦૨૪ માં, તેલંગાણાના ખમ્મમ જિલ્લાના ૨૨ વર્ષીય યુવાનની અમેરિકામાં એક ગેસ સ્ટેશન પર બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યાં તે કામ કરતો હતો, એમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. તાજેતરમાં અમેરિકાના ઉત્તર કેરોલિનાના રાજ્યમાં એક કિશોરવયના છોકરાએ એક કન્વીનિયન્સ સ્ટોર લૂંટી લીધા બાદ ૩૬ વર્ષીય ગુજરાતી મૈનાંક પટેલની ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. ગોળીબાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટોબેકો હાઉસ સ્ટોરના માલિક મૈનાંક પટેલનું મૃત્યુ થયું હતું, તેનું સેલિસબરી પોસ્ટે અહેવાલ આપ્યો હતો. રોવાન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા મુજબ, કિશોરની સાંજે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેના વિશે કોઈ વધારાની વિગતો જાહેર કરવામાં આવી નથી. પટેલ તેમની પાછળ સાડા સાત મહિનાની ગર્ભવતી પત્ની અમી અને તેમની પાંચ વર્ષની પુત્રીને છોડી ગયા છે. ગ્રાહકો અને કામદારોનાં જણાવ્યાં અનુસાર બધા તેને ‘માઈક’ કહેતા. પટેલ કોઈપણ માટે કંઈપણ કામ કરવા તત્પર રહેતા હતા અને ભારતીય સમુદાય તેમના મૃત્યુ પર શોકમાં છે. તેના સ્ટોર, ટોબેકો હાઉસની બહારનાં તમામ ફૂલો અને કાડૂસ દ્વારા સ્પષ્ટ થાય છે કે લોકોને તેના પ્રત્યે પ્રેમ હતો.	(વ્યક્તિનું મૃત્યુનું કારણ બનવા બદલ સજા) અને ૧૦૩ (૧) (હત્યા) અંતર્ગત રોય દોષી પુરવાર થયો હતો. જજે કહ્યું હતું કે કલમ ૬૪ અંતર્ગત દોષીને જનમટીપની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરે તેવા સંજોગોમાં દોષીને ૧૦૫ પાંચ મહિના જેલની સજા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કલમ ૧૦૩ (૧) અંતર્ગત રોયને રૂ. ૫૦,૦૦૦નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. વધુમાં કલમ ૬૬ અંતર્ગત રોયને મૃત્યુ ન પામે ત્યાં સુધી જેલની સજા આપવામાં આવી હતી. સીબીઆઈએ રોયને મૃત્યુદંડ આપવાની માગણી કરી હતી. આ કેસ ‘રિરેસ્ટ રેર’ શ્રેણીનો ન હોવાને કારણે બચાવપક્ષના વકીલે રોયને મૃત્યુદંડને બદલે જનમટીપની સજા કરવાની વિનંતી કરી હતી. મૃતક ડોક્ટરનાં પરિવારજનોને રૂ. ૧૭ લાખ વળતરપેટે આપવાનો કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. ઘટનાનો ભોગ બનેલી મહિલા પોક્ટર ફરજ પર હતી તે સમયે મૃત્યુ પામી હોવાને કારણે ૧૦૬ટરનાં પરિવારજનોને મૃત્યુ બદલ રૂ. ૧૦ લાખ અને બળાકાર બદલ રૂ. સાત લાખ એમ કુલ રૂ. ૧૭ લાખનું વળતર આપવાની જવાબદારી રાજ્ય સરકારની હોવાનું કોર્ટે કહ્યું હતું. જોકે રાયને ન્યાયાધીશે જણાવ્યું હતું કે કોર્ટના આ યુકાદાને તે કોલકાતા હાઈ કોર્ટમાં પડકારી શકશે અને તે માટે જરૂરી કાયદાકીય સહાય તેને પૂરી પાડવામાં આવશે. રોય, તેના પરિવારજનો અને વકીલના અંતિમ નિવેદનો સાંભળ્યા બાદ ન્યાયાધીશે રોયને સજાનો યુકાદો સંભળાવ્યો હતો. (એનસી) ■
				કાશ્મીરમાં	યુદ્ધ વિરામ કરાર
				સાકાર કરવામાં યોગદાન આપે. રાજનાથે દિલ્હી કેન્વેન	



### સંસ્થા સમાચાર

#### ગાદીના ગોંડલ ગામે તરૂબાઈ મ.સ.ની સંયમ સુવર્ણજયંતીની ઉજવણી એકબીજાએ સહન કરવું, એક બીજાને અનુકૂળ થવું. એ પણ ભાવ સંયમ છે: ધીરગુરુદેવ



શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ, પુંજાણી પૌષ્પશાળા, સ્ટેશન પ્લોટના આંગણે સાધનાદેવી લલિતાબાઈ મ.સ.ના શિષ્યરત્ન તરૂબાઈ મ.સ.ની સંયમ સુવર્ણજયંતી પ્રસંગે વિવિધ ધર્માનુષ્ઠાન યોજાયેલ. તા. ૧૯ ને રવિવારે શ્રી ધીરગુરુદેવ પધારના પંથકમુનિ મ.સા., મીનાજી મ.સ., જયશ્રીજી મ.સ. આદિનું મિલન થયેલ. ધીરગુરુદેવે કહેલ કે - ક્યાંય પણ જમો પરંતુ એક ન મૂકવું તેવો સંકલ્પ કરો. સંસારીનો સંયમ એટલે એકબીજાએ સહન કરવું અને એકબીજાને અનુકૂળ થવું. સંયમજમણના દાતા નીલેશ આઈ. ઢેડી તથા ભાયાણી પરિવાર, મહાવીર મહિલા મંડળ વગેરેનું સન્માન કરાયું હતું.

### મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડે

#### એસએસસીનું પ્રવેશ કાર્ડ જાહેર કર્યું

મુંબઈ: મહારાષ્ટ્ર બોર્ડની એસએસસીની પરીક્ષાની તારીખો જાહેર થઈ ચુકી છે. આ પરીક્ષાએ ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ ૨૦૨૫ રૂઝમિથાન લેવામાં આવશે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન, પુણેએ સોમવાર, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ એસએસસીનું પ્રવેશ કાર્ડ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ તેમની શાળા દ્વારા પ્રવેશ કાર્ડ મેળવી શકશે. શાળા વહીવટીતંત્રે સત્તાવાર વેબસાઇટ mahahssboard.in પર લોગ-ઈન પાસવર્ડ દ્વારા પ્રવેશ કાર્ડ ઓનલાઇન કરવાનું રહેશે. ત્યાર બાદ, પ્રવેશ કાર્ડ ઓનલાઇન કરવાની શાળા પાસેથી તેમનાં પ્રવેશ કાર્ડ મેળવવામાં રહેશે. શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈ વધારાની ફી વસૂલવાની મંજૂરી નથી. એકબીજા પ્રવેશ કાર્ડ ડાઉનલોડ થઈ જાય પછી, શાળાઓએ તેની પ્રિન્ટ કરી અને તેના પર મુખ્ય શિક્ષક અથવા ટ્રિનિસપલનાં

સહી અને સ્ટેમ્પ કરવામાં રહેશે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે 'જો વિદ્યાર્થીઓ તેમના પ્રવેશ કાર્ડમાં નામ, માતાનું નામ, જન્મ તારીખ અથવા જન્મ સ્થળ જેવી કોઈ પણ માહિતીમાં ફેરફાર કરવા માગતા હોય તો તેઓ ઓનલાઇન 'રેક્રેશન એડમિશન કાર્ડ' લિંક પર જઈને કરી શકે છે. જે વિભાગીય બોર્ડ દ્વારા મંજૂર થયા બાદ, તેઓને સુધારેલા પ્રવેશ કાર્ડ મળશે. તદ્દુપરાંત, શાળાઓએ વિષય અથવા માધ્યમમાં કોઈ પણ ફેરફાર માટે સીધા જ વિભાગીય બોર્ડનો સંપર્ક કરવો પડશે. આ પ્રક્રિયા માટે ફી લેવામાં આવશે. પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સવારના ભાગમાં ૧૧ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી, જ્યારે બપોરના ભાગમાં ૩ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી લેવામાં આવશે. જોકે કેટલાક વિષયોની પરીક્ષા સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી લેવામાં આવશે.

### હત્યાના પ્રયાસના કેસમાં થાણે

#### કોર્ટે બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા

થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક આદાલતે અપૂરતા પુરાવાને કારણે નવ વર્ષ પહેલાં એક વ્યક્તિ પર હુમલો કરીને ઘાયલ કરનાર બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ સેશન્સ જજ અમિત એમ. શેટેએ ૨૦૧૫માં હત્યાના પ્રયાસના કેસમાં ઈમરાન આબ્તર સૈયદ અને અનંત જયરામ ભગતને નિર્દોષ છોડી મૂક્યા હતા. ૧૩ જાન્યુઆરીના આદેશની નકલ સોમવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેસની વિગતો મુજબ, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ કલવામાં પીડિત સંદીપ ગાડેકર પર પુરુષોના એક જુએ હથિયારો વડે હુમલો કર્યો હતો. તેને માથા, ગરદન અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કલવા પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ ૧૪૩ (ગેરકાયદેસર સભા), ૧૪૭ (હુલ્લાસ), ૧૪૮ (ઘાતક હથિયારોથી સજ્જ રમખાણો), ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને ૪૫૨ (હુમલો કરવા માટે ઘર પર દબાણ) હેઠળ કેસ નોંધ્યો હતો. કોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે પીડિતની જુબાનીમાં ગંભીર ભૂલો છે, જે પોલીસને આપેલાં તેના અગાઉનાં નિવેદનોથી એક દમ વિપરીત છે. કોર્ટે પીડિત અને તેના પરિવારની ગુનાહિત પૂછબૂમની પણ નોંધ લીધી હતી. પીડિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે તેને તરીકાર કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશ શેટેએ ચુકાદો આપ્યો હતો કે આરોપી સામેના પુરાવા અપરાધ સાબિત કરવા માટે અપૂરતા છે અને બાકીના ફારાર આરોપીઓને પકડવા અને અલગ ચાર્જશિટ દાખલ કરવા પોલીસને નિર્દેશ આપ્યો હતો.

### છત્રપતિ સંભાજીનગરમાં ગેરકાયદેસર

#### બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે સર્વે હાથ ધરાશે

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે સોમવારે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે જિલ્લા, નાગરિક સત્તાવાળાઓ અને પોલીસની મદદથી એક સર્વે હાથ ધરવામાં આવશે. અહીં પત્રકારો સાથે વાત કરતા જિલ્લાના પાલક મંત્રી શિરસાટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ, મતદાર આઈડી અને અન્ય દસ્તાવેજો મેળવનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢશે અને તેમની સામે કાયદાકી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવતા અઠવાડિયે પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજવામાં આવશે અને આવા (બાંગ્લાદેશી) નાગરિકોને શોધવા માટે એક સર્વે હાથ ધરવામાં આવશે.

### વીકએન્ડમાં 'ધાંધિયા': પશ્ચિમ રેલવેમાં

#### માહિમ-બાંદ્રા વચ્ચે 'મેજર નાઈટ બ્લોક' ૨૫૦થી વધુ લોકલ રટ રહેશે, મુંબઈ-ગુજરાતની ટ્રેનસેવાને પણ અસર થશે

મુંબઈ: આ અઠવાડિયાના અંતમાં પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોકને કારણે લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થશે. પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રા સ્ટેશનના પુલ નંબર ૨૦ એબેટમેન્ટના કારણે મેજર બ્લોકને લોકલ ટ્રેનો સહિત લાંબા અંતરની અમુક ટ્રેનો રટ રાખવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે બ્રિજના મહત્વના કામકાજને ધ્યાનમાં રાખીને ૨૪/૨૫ જાન્યુઆરી ૨૦૨૫ રાતના ૧૧.૦૦ વાગ્યાથી સવારના ૮.૩૦ વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈન તથા રાતના ૧૨.૩૦ વાગ્યાથી સવારના ૬.૩૦ વાગ્યા સુધી ડાઉન ફાસ્ટ લાઈનમાં બ્લોક રહેશે. આ ઉપરાંત, અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં શનિવારના રાતના ૧૧.૦૦ વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં તથા ફાસ્ટ લાઈનમાં રાતના અગિયાર વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યા સુધી બ્લોક રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવનારા બ્લોકને કારણે ૨૫૦થી વધુ ટ્રેન રટ રહેશે, જ્યારે ૧૫૦થી વધુ

લોકલ આંશિક રીતે રટ રહેવાથી વીકએન્ડમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે મુશ્કેલ બની શકે છે. બ્લોકને કારણે પ્રવાસીઓ નિયત શેડ્યુલને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવાનું ફાયદાકારક બની શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સર્બર્નમાં નાઈટ બ્લોકને કારણે ૨૫૦થી વધુ લોકલ રટ રહેશે - શુક્રવારે રાતના ચર્ચગેટથી વિરાર જતારી લાઈટ લોકલ રાતના ૧૧.૫૮ વાગ્યાની રહેશે - શુક્રવારે રાતના અગિયાર વાગ્યા પછી ચર્ચગેટથી રાતના ધનારી તમામ સ્લો ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને સાંતાક્રુઝ વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જેથી મહાલક્ષ્મી, લોઅર પરેલ, માટુંગા રોડ અને ખાર સ્ટેશન પર હોસ્ટ રહેશે નહીં. - એ જ રીતે શુક્રવારે રાતના અગિયાર વાગ્યા પછી વિરાર, ભાર્યદેર અને બોરીવલીથી ચર્ચગેટની ટ્રેનોને સ્લો કોરિડોરમાં સાંતાક્રુઝ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જેથી ખાર રોડ, માહિમ, માટુંગા રોડ, પ્રભાદેવી, લોઅર પરેલ અને મહાલક્ષ્મી સ્ટેશનમાં હોસ્ટ મળશે નહીં. - બ્લોક વખતે ગોરેગાંવ અને બાંદ્રાથી મધ્ય રેલવેમાં હાઈવે લાઈનની ટ્રેનોની સર્વિસ ઉપલબ્ધ રહેશે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ધર્મભાઈ નિવાસી હાલ ઘટકોપર સ્વ. નવીનચંદ્ર ધીરજલાલ શાહના ધર્મપત્ની સરોજબેન શાહ (ઉં. વ. ૮૯) ગુરુવાર તા. ૧૬-૧-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કેતનભાઈ, સ્મિતાબેન, અમિતાબેન અને અર્પિતાબેનના માતૃશ્રી. સ્વતાબેન શાહ, દિગ્ગમભાઈ શાહ, સ્વ. ઇગ્નલાલ લીલાધર દોશી અને સ્વ. કાન્ટાબેન ઇગ્નલાલ દોશીના સુપુત્રી. યવતી, માહીના દાદી. વિશ્વત, અદિતિ, માનિની, અર્જુન, કુશ, હર્ષલાલ નાની. મંગળવાર, તા. ૨૧-૧-૨૦૨૫ના સવારે ૧૦થી ૧૧.૩૦. જાપ સાધના રાખેલ છે. ડે. ત્રિધા હાલ, ઘટકોપર -પૂર્વ.

દશા શ્રીમાળી સ્થા. જૈન ગઢગા નિવાસી હાલ કોઈવલી વિનોદભાઈ ભાયાણી (ઉં. વ. ૭૭) તા. ૧૯-૧-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રંભાબેન નારણદાસ ભાયાણીના પુત્ર. સ્વ. વસંતબેન અમૃતલાલ મહેતાના જમાઈ. ભાવાબેનના પતિ. તે સ્વ. જયંતીભાઈ, સ્વ. મહાસુભાઈ, સ્વ. વસંતબેન ભા. સ્વ. સવિતાબેન અને લીલાબેનના ભા. સ્વ. વિરલભાઈ અને તુષારભાઈના પિતા. કેતકીબેનના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૩-૧-૨૦૨૫ના બપોરના ૩થી ૫.૩૦. ૩જે માળે, સ્થાનકવાસી જૈન મોટો ઉપાચાર, એસ. વી. રોડ, પારેખ ગલ્લીની બાજુમાં, કોઈવલી (વેસ્ટ). પાટણ જૈન ફોકલીયાવાગે વખતજીની શેરી હાલ મુંબઈ સ્વ. સુભદ્રાબેન નેમચંદ શાહના સુપુત્ર વિનોદભાઈ (ઉં. વ. ૮૨) તા. ૨૦-૧-૨૦૨૫ના અવસાન થયેલું છે. તે રેખાબેન (સ્ત્રી)ના પતિ. પ્રેમિલા સતીપભાઈના ભાઈ. સ્વ. કુસુમબેન ચીમનલાલ શાહના જમાઈ. મેઘના-જિનેશભાઈ ચોકસી તથા ચિરાગ-ચૈતાલીના મામા. તેજશીબેન, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ભદ્રકાંબેન, બિપિનભાઈના ભાઈ. લોકિક વ્યવહાર બંધ છે. કેકાણું ૫૦૪, દિવ્યલોક, એલ.ડી. રૂપારેલ મુંબઈ, મુંબઈ-૬.

દશા શ્રીમાળી સ્થા. જૈન ગોપાલરામ દસા નિવાસી હાલ મુલક સ્વ. નર્મલબેન ન્યાલચંદ ઝાટકીયાના પુત્ર સુરભીભાઈ (ઉં. વ. ૮૪) તે કૈલાશબેનના પતિ. મીનલ જયેશ દેવીલા, ક્રેમલ બિદેશ પેલાભાઈના પિતા. સ્વ. અસાબેન ચંદ્રકાંતભાઈ સંવરજીજી, સ્વ. અરૂબેન કનકભાઈ દેસાઈ, ઈન્સ્પેક્શન કર્યું હતું અને ૨,૧૪૮ કિલોગ્રામ પ્લાસ્ટિક જાત કર્યું હતું અને ૪૧.૭૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. પહેલી જાન્યુઆરીથી ૬૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ૫,૭૮૩ દુકાનોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ૧૬૭ કિલો પ્લાસ્ટિક જાત કરવામાં આવ્યું હતું અને ૬.૧૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર પ્લાસ્ટિક અને થર્મોકોલ નિયમ, ૨૦૧૮ હેઠળ મુખ્યત્વે સિંગલ યૂઝ પ્લાસ્ટિક વસ્તુ ઉત્પાદન, ઉપયોગ, વેચાણ, સ્ટોક કરવા પર પ્રતિબંધ છે. તો મુંબઈ મહાનગરપાલિકાના નિયમ હેઠળ ઉત્પાદકો, સ્ટોલિસ્ટ, સપ્લાયર દ્વારા પોલિસીનું ઉલ્લંઘન કરવા પર પોલીસે વળત ગુના માટે ૫,૦૦૦ રૂપિયાથી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને વારંવાર ગુનો કરનારને કેદની સજા થઈ શકે છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન મોરબી/મુંબઈ નિવાસી હાલ ચેરઈ અ.સૌ. રંજનબેન (ઉં. વ. ૮૮) તે સ્વ. કાન્ટાબેન શંકરભાઈ મહેતાના પુત્રવધૂ વિનોદભાઈના ધર્મપત્ની. ડો.શીતલ, નેહલાના માતૃશ્રી. સ્વ. ડો.સુરેશના સાસુ, ડો.સિદ્ધાર્થ અને વિ.અરવીના નાની. વિચરપક્ષે જૂનાગઢ નિવાસી સ્વ.શારદાબેન જયંતીલાલ શાહની સુપુત્રી. ૧૯-૦૧-૨૦૨૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાધનપુર દેરાસાલી જૈન રાધનપુર નિવાસી હાલ મુંબઈ સતીપભાઈ બસુભાઈ પાટી (ઉં. વ. ૭૬) રવિવાર તા. ૧૯-૧-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે શીતલબેનના પતિ, રીકો, સાહિલાના પિતૃશ્રી. કપિલ, કિશોરના સસરા, પાર્વના દાદા, સ્વ. પ્રદિપભાઈ, સ્વ. ઉંદરીબેન નવીનચંદ શાહ, ભારતીબેન નાનુભાઈ શાહ, મીનાશીબેન રમેશચંદ્ર ગાંધી, સ્વ. પદ્મવતીબેન શૈલેશભાઈ માસાલીયાના ભાઈ. ન્હાનદાસ જૈનસાહેબ દોશીના જમાઈ, પ્રાર્થનાસભા ત્યા લોકિક વ્યવહાર બંધ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન ગુંદલાના ભાણભાઈ રવજી પાસુ દેવીયાના સુપુત્રી તેજશાહ (શીકો) મગનલાલ પોપટ (ઉં. વ. ૮૨) તા. ૧૯-૧-૨૦૨૫ના અવસાન પામેલ છે. મગનલાલના ધર્મપત્ની. જૂનાગઢના મણીબેન મથુરાદાસ પોપટના પુત્રવધૂ. મયુરી, જેસીકાના માતૃશ્રી. ગુંદલાના પ્રેમજી, હીરજી, જગશી, સમાધોદાના રતનબેન રામજી, લાખાપુરના રેવંતીબેન દામજી, મોટા આસંબીયાના લીલાવંતી ધીરજીબેનના પ્રાર્થના સભા રાખેલ નથી. કોન સંપર્ક રૂબરૂ તુલ્ય. ડે. કીશોરભાઈ દાવડા, સી/૦૨૮, દિવ્ય સુષ્ટી, ગૌરવ ગાંડન કોમ્પ્લેક્સ, બંદર કોમ્પ્લેક્સ, કાંદીવલી (વે.)

કયાપાના મેઘજી ઉમરશી મામણીયા (ઉં. વ. ૮૬) તા. ૧૪-૧-૨૦૨૫ના દેશમાં અરિહંત શરણ પામેલ છે. માતૃશ્રી સોનબાઈ, ઉમરશી લખશીરના પુત્ર. ભારતીના પતિ. સરલાના પિતા. ભાણભાઈ લખશીર, શાંતીલાલ, સં.પ.પૂ. નવિન મુનિના ભાઈ. લાખાપુર વેલભાઈ લણુભાઈના જમાઈ. શ્રી. શ્રી. વ.સ્થા. જૈન શ્રા. સં.ક્રમ્સન લઘુ નિસર હાલ, દાદર. ૨ થી ૩.૩૦. ભાભૃતી મામણીયા, એ-૧૦૪, પહેલે માળે, હરકૃષ્ણ સો., માનપાડા રોડ, ડોંબીવલી (ઉં. ૪૨) ૨૦૨૧ બિદગાની શ્રી મુલચંદ ગડા (ઉં. વ. ૮૨) તા. ૧૯-૧-૨૦૨૫ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન નાથલાલના સુપુત્ર. જયંતીના પતિ. મનીષ, દીપકના પિતા. નવીનચંદ, અરવિંદના ભાઈ. મણીબેન લલકશીલા જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ની. દીપક ગડા, બ્લોક નં. ૪, નિશાંત ભવન, પ્લોટ નં. ૧૫૦, ગરીડીયા સ્કુલની બાજુમાં, ઘટકોપર (ઈ), મું. ૭૭. ગ્રામપંચાયત વિભાગેને વસનજી સાવલા (ઉં. વ. ૮૬) તા. ૧૯-૧-૨૦૨૫ના દુકી માંદગીથી અવસાન પામેલ છે. લાહભાઈ મેઘજી વજપારના પુત્રવધૂ. વસનજીના ધર્મપત્ની. કયાધા ભયીભાઈ વસનજી શીવજી છંડાના સુપુત્રી. મંગલ, દુર્ગાબાઈ, નેમજી, મહેન્દ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ની. ચંચળબેન હરીલાલ સાવલા. ૫, સુંદરભુવન (અજીતભાગ), લક્ષ્મીનારાયણ લેન, કાંદીવલી (વેસ્ટ).

ગોધરાના મુલચંતી મુલચંદ છંડા (ઉં. વ. ૭૮) તા. ૧૯-૧-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે. વિજયાબેન પ્રેમજીના પુત્રવધૂ. મુલચંદના પત્ની. નૈલેશ, દીપકો, પ્રીતિ, નિખીલાના માતા. કોડાયાના મહાંબોડ પીમજી મેઘજી સાવલાના પુત્રી. મુલચંદ, જયંતી, ભજપુર મધુ શીવજી, કોડાવ સ્ત્રીક પ્રેમચંદ, બિદગા વિમાળા વિશનજીના બેન. પા. યોગી સંદામણુ દાદર (સે.રે.). ટા. ૩.૩૦ થી ૫. નિ.નિખીલ છંડા. ૨૫/૧/૦૧, ૧૧, ચંધા નિશા, રોડ નં. ૧૯, વડાલા (વે), ચશુદાન અને વ્યાજદાન કરેલ છે.

ગોધરાના મુલચંતી મુલચંદ છંડા (ઉં. વ. ૭૮) તા. ૧૯-૧-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે. વિજયાબેન પ્રેમજીના પુત્રવધૂ. મુલચંદના પત્ની. નૈલેશ, દીપકો, પ્રીતિ, નિખીલાના માતા. કોડાયાના મહાંબોડ પીમજી મેઘજી સાવલાના પુત્રી. મુલચંદ, જયંતી, ભજપુર મધુ શીવજી, કોડાવ સ્ત્રીક પ્રેમચંદ, બિદગા વિમાળા વિશનજીના બેન. પા. યોગી સંદામણુ દાદર (સે.રે.). ટા. ૩.૩૦ થી ૫. નિ.નિખીલ છંડા. ૨૫/૧/૦૧, ૧૧, ચંધા નિશા, રોડ નં. ૧૯, વડાલા (વે), ચશુદાન અને વ્યાજદાન કરેલ છે.

ગોધરાના મુલચંતી મુલચંદ છંડા (ઉં. વ. ૭૮) તા. ૧૯-૧-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે. વિજયાબેન પ્રેમજીના પુત્રવધૂ. મુલચંદના પત્ની. નૈલેશ, દીપકો, પ્રીતિ, નિખીલાના માતા. કોડાયાના મહાંબોડ પીમજી મેઘજી સાવલાના પુત્રી. મુલચંદ, જયંતી, ભજપુર મધુ શીવજી, કોડાવ સ્ત્રીક પ્રેમચંદ, બિદગા વિમાળા વિશનજીના બેન. પા. યોગી સંદામણુ દાદર (સે.રે.). ટા. ૩.૩૦ થી ૫. નિ.નિખીલ છંડા. ૨૫/૧/૦૧, ૧૧, ચંધા નિશા, રોડ નં. ૧૯, વડાલા (વે), ચશુદાન અને વ્યાજદાન કરેલ છે.

### દાવોસમાં બાળકે મરાઠી ગૌરવ ગીત

#### ગાઈને ફડણવીસનું કર્યું સ્વાગત

દાવોસ: દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સ્વિત્ઝરલેન્ડની મુલાકાતે છે. આ પ્રસંગે ફડણવીસે મહારાષ્ટ્ર મંડળના એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એક નાના બાળકે 'હું ફરી આવીશ, હું ફરી આવીશ, એમ તમે કહ્યું હતું અને તમે ખરેખર ફરી આવ્યા, મને ખૂબ જ સારું લાગ્યું' કહીને મુખ્યપ્રધાનનું દિલ જીતી લીધું હતું. આ બાળકે મરાઠી ગૌરવ ગીત સાથે ફડણવીસનું સ્વિત્ઝરલેન્ડમાં સ્વાગત કર્યું હતું. 'માનવીય પ્રિય દેવેન્દ્ર ફડણવીસે કાકા, તમારા માટે મારા તરફથી એક નાનકડી ભેટ, ' કહીને બાળકે ફડણવીસને એક ગ્રીટિંગ કાર્ડ આપ્યું. તમે કહ્યું હતું કે હું ફરી આવીશ અને ખરેખર પાછા આવ્યા મને ખૂબ આનંદ થયો.

### જૈન મરાઠા

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન ધર્મભાઈ નિવાસી હાલ ઘટકોપર સ્વ. નવીનચંદ્ર ધીરજલાલ શાહના ધર્મપત્ની સરોજબેન શાહ (ઉં. વ. ૮૯) ગુરુવાર તા. ૧૬-૧-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે કેતનભાઈ, સ્મિતાબેન, અમિતાબેન અને અર્પિતાબેનના માતૃશ્રી. સ્વતાબેન શાહ, દિગ્ગમભાઈ શાહ, સ્વ. ઇગ્નલાલ લીલાધર દોશી અને સ્વ. કાન્ટાબેન ઇગ્નલાલ દોશીના સુપુત્રી. યવતી, માહીના દાદી. વિશ્વત, અદિતિ, માનિની, અર્જુન, કુશ, હર્ષલાલ નાની. મંગળવાર, તા. ૨૧-૧-૨૦૨૫ના સવારે ૧૦થી ૧૧.૩૦. જાપ સાધના રાખેલ છે. ડે. ત્રિધા હાલ, ઘટકોપર -પૂર્વ.

દશા શ્રીમાળી સ્થા. જૈન ગઢગા નિવાસી હાલ કોઈવલી વિનોદભાઈ ભાયાણી (ઉં. વ. ૭૭) તા. ૧૯-૧-૨૦૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રંભાબેન નારણદાસ ભાયાણીના પુત્ર. સ્વ. વસંતબેન અમૃતલાલ મહેતાના જમાઈ. ભાવાબેનના પતિ. તે સ્વ. જયંતીભાઈ, સ્વ. મહાસુભાઈ, સ્વ. વસંતબેન ભા. સ્વ. સવિતાબેન અને લીલાબેનના ભા. સ્વ. વિરલભાઈ અને તુષારભાઈના પિતા. કેતકીબેનના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૩-૧-૨૦૨૫ના બપોરના ૩થી ૫.૩૦. ૩જે માળે, સ્થાનકવાસી જૈન મોટો ઉપાચાર, એસ. વી. રોડ, પારેખ ગલ્લીની બાજુમાં, કોઈવલી (વેસ્ટ). પાટણ જૈન ફોકલીયાવાગે વખતજીની શેરી હાલ મુંબઈ સ્વ. સુભદ્રાબેન નેમચંદ શાહના સુપુત્ર વિનોદભાઈ (ઉં. વ. ૮૨) તા. ૨૦-૧-૨૦૨૫ના અવસાન થયેલું છે. તે રેખાબેન (સ્ત્રી)ના પતિ. પ્રેમિલા સતીપભાઈના ભાઈ. સ્વ. કુસુમબેન ચીમનલાલ શાહના જમાઈ. મેઘના-જિનેશભાઈ ચોકસી તથા ચિરાગ-ચૈતાલીના મામા. તેજશીબેન, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ભદ્રકાંબેન, બિપિનભાઈના ભાઈ. લોકિક વ્યવહાર બંધ છે. કેકાણું ૫૦૪, દિવ્યલોક, એલ.ડી. રૂપારેલ મુંબઈ, મુંબઈ-૬.

દશા શ્રીમાળી સ્થા. જૈન ગોપાલરામ દસા નિવાસી હાલ મુલક સ્વ. નર્મલબેન ન્યાલચંદ ઝાટકીયાના પુત્ર સુરભીભાઈ (ઉં. વ. ૮૪) તે કૈલાશબેનના પતિ. મીનલ જયેશ દેવીલા, ક્રેમલ બિદેશ પેલાભાઈના પિતા. સ્વ. અસાબેન ચંદ્રકાંતભાઈ સંવરજીજી, સ્વ. અરૂબેન કનકભાઈ દેસાઈ, ઈન્સ્પેક્શન કર્યું હતું અને ૨,૧૪૮ કિલોગ્રામ પ્લાસ્ટિક જાત કર્યું હતું અને ૪૧.૭૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. પહેલી જાન્યુઆરીથી ૬૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ૫,૭૮૩ દુકાનોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ૧૬૭ કિલો પ્લાસ્ટિક જાત કરવામાં આવ્યું હતું અને ૬.૧૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના મહારાષ્ટ્ર પ્લાસ્ટિક અને થર્મોકોલ નિયમ, ૨૦૧૮ હેઠળ મુખ્યત્વે સિંગલ યૂઝ પ્લાસ્ટિક વસ્તુ ઉત્પાદન, ઉપયોગ, વેચાણ, સ્ટોક કરવા પર પ્રતિબંધ છે. તો મુંબઈ મહાનગરપાલિકાના નિયમ હેઠળ ઉત્પાદકો, સ્ટોલિસ્ટ, સપ્લાયર દ્વારા પોલિસીનું ઉલ્લંઘન કરવા પર પોલીસે વળત ગુના માટે ૫,૦૦૦ રૂપિયાથી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અને વારંવાર ગુનો કરનારને કેદની સજા થઈ શકે છે.

દશા શ્રીમાળી સ્થ

# તન-મન-ધનથી રહો તૈરાંતાજી

## આ આયુષ્યે હવે કેવી હોવી જોઈએ ખાણી-પીણીની ટેવ?

**ગૌરવ મશરૂવાળા**  
feedback@bombaysamachar.com

‘મેં આખી જિંદગી સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણ્યો છે. હવે સ્વાદના શોખ ઘણા થઈ ગયા. મેં જે ખાધું તેનાથી મને સંતોષ થઈ ગયો છે.’  
‘હવે મારે ક્યાં વધારે વર્ષ જીવવાનું છે? સ્વાદના શોખ પૂરા કરવા દો!’  
ઉપરોક્ત આ બન્ને નિવેદન વ્યક્તિની માનસિકતા વ્યક્ત કરે છે. આ પ્રકરણનો મુદ્દો વરિષ્ઠ નાગરિકોએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની ચર્ચા કરવાનો નથી. ખરું પૂછો તો, બધાને લાગુ પડે એવો કોઈ ચોક્કસ ખોરાક હોઈ

શકે નહીં. દરેકના શરીરનું બંધારણ અને જરૂરિયાતો અલગ અલગ હોય છે. વળી, દરેક વ્યક્તિનો ઉછેર, હવામાન, ખોરાકની ઉપલબ્ધતા વગેરે પરિબલોના આધારે ખાણી-પીણી નક્કી થાય છે.  
મોટી ઉંમરે એ સવાલ અગત્યનો છે કે તમને સ્વાદિષ્ટ ખાવાનું ગમે છે કે પછી સ્વાદના ચટાકા કરવા જોઈએ જ છે. સ્વાદિષ્ટ ખાવાનું મને અને તેનો આનંદ લેવો એક વાત છે અને શરીરને નુકસાન થાય તેની પરવા કર્યા વગર સ્વાદના શોખ પૂરા કરવા એ સાવ જુદી વાત છે.  
જેમને જીભના ચટાકા વધાવા લાગે એવા અનેક માણસો આપણને જોવા મળે છે. દાખલા તરીકે મહેન્દ્રભાઈ. એમણે રોજ કોલેસ્ટરોલ અને ડાયાબિટીસની દવા લેવી પડે છે. દવા લે ત્યારે સુધી એમની આ બન્ને તકલીફ નિયંત્રણમાં રહે છે. આમ છતાં એમને ચટાકેદાર



ભોજન વગર ચાલતું નથી. જે માણસને તંદુરસ્ત રહેવા માટે દવા લીધાં વગર ચાલતું નથી, એ માણસ જો બીમારી માટે કારણભૂત ખોરાક લેવાનું બંધ કરી ન શકે તો એમને આ સ્વાદની લત છે એવું જ કહેવું પડે. આ જ મહેન્દ્રભાઈના મિત્ર શિશિરભાઈ છે. ૭૦ વર્ષની ઉંમરે એ સંપૂર્ણ યુસ્તી-સ્કૂર્તિ ધરાવે છે.  
એમને ફક્ત વિટામિનની ગોળીઓ આપવામાં આવી છે. એ સિવાય એમણે ક્યારેય કોઈ દવા લેવાની જરૂર પડતી નથી. અત્યાર સુધીના એમના બધા મેડિકલ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. એ મસ્ત-મોજલા માણસ છે. ક્યારેક એ પણ તળેલો અને મસાલેદાર ખોરાક લઈ લે છે. વળી, એમને મીઠાઈ પણ પ્રિય છે. આમ છતાં,

એ આ બન્ને પ્રકારનો ખોરાક મર્યાદામાં લે છે. એમને સ્વાદિષ્ટ ખાણી-પીણી ગમે છે એમ કહી શકાય, પણ એમને તેની લત છે એમ ન કહેવાય.  
કોઈક ખાણી-પીણીની વિવિધ આદત પરથી માણસનું યોગી-ભોગી ને રોગી એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકરણ કર્યું છે. પોતે કઈ શ્રેણીમાં આવે છે એ દરેકે જાતે જ નક્કી કરવાનું હોય છે. તમારી આદતોને લીધે ફક્ત તમને જ નહીં, તમારા પરિવારજનોને પણ તકલીફ થતી હોય છે. જો જાડો-સ્થૂળ માણસ માંદો પડે તો એને પથારીમાં ઉઠાડવા-બેસાડવાનું કે વ્હીલચેરમાં ફેરવવાનું અઘરું પડે છે.  
કોર્પોરેટ વિશ્વમાં રહી ચૂકેલા નિવૃત્ત આર. વેંકટે એક વખત મને અર્થપૂર્ણ વાત કરી હતી.  
પોતાના દસ-પંદર મિનિટના સ્વાદના આનંદની પાછળ પડી ગયેલા માણસને પહેલાં તો ખાણી-પીણી પર ખર્ચ થાય છે. પછી એ બીમાર પડે ત્યારે સેવા-ચાકરી કરનારા માણસ રાખવાનો ખર્ચ કરવો પડે છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેનો ખર્ચ વધારાનો.  
એમની વાત ખરેખર સાચી છે. કોઈ પણ સ્વાદ વધુમાં વધુ થોડી મિનિટો સુધી જ મોંમાં રહે છે. એ થોડી મિનિટો માટે માણસ પોતાની અને બીજાઓની તકલીફો વધારી દે છે.  
આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જમતી વખતે શાંત જગ્યાએ બેસવું. બોલવાનું ટાળવું અને ખોરાક પર ધ્યાન આપવું. હું તેને જમવાનું મેડિટેશન કહું છું. આ રીતે જમવાનું કહેવાયું તેની પાછળ ઘણો મોટો વિચાર રહેલો છે. આપણે જ્યારે શાંત બેસીએ અને બોલવાને બદલે ખોરાક પર ધ્યાન આપીએ ત્યારે લાગુ ઝરવાનું પ્રમાણ વધી જાય છે. લાગુને લીધે ખોરાક સારી રીતે પચતો હોય છે. સ્વાદગ્રંથિઓ અને તંદુરસ્તી બન્ને માટે આ જરૂરી છે. જમતી વખતની એકાગ્રતાને લીધે આપણે વધારે પડતું ખાવાથી બચી જઈએ છીએ.  
ટૂંકમાં એટલું જ કહેવાનું કે વ્યક્તિ નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની, ખાવાની વાતને લઈને દરેક વ્યક્તિ જો અહીં કહેલી વાત પર બરાબર ધ્યાન રાખે એ એના પોતાના હિતમાં છે.

## ફાઈનાન્સના ફંડા મિતાલી મહેતા

NPS એટલે કે ‘નાશીય પેન્શન યોજના’ વિશે આપે આ અગાઉની મારી કોલમમાં જાણ્યું. એ જ વિશે આગળ વધારીએ. આ યોજના હેઠળ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની તક મળે છે અને સાથે સાથે તમે કઈ કઈ એસેટમાં કેટલું રોકાણ રાખવા માગો છો એ પણ નક્કી કરવા મળે છે. દરેક એસેટ ક્લાસમાં વળતર અને જોખમનું પ્રમાણ અલગ અલગ હોય છે. દરેક રોકાણકાર પોતે કેટલું જોખમ ખમી શકે છે એના આધારે આ ફાળવણી નક્કી થાય છે. હાલ રોકાણકારોને બે વિકલ્પ ઉપલબ્ધ છે:  
એસેટ એલોકેશનમાં પસંદગી એક્ટિવ ચોઇસ ઈક્વિટી (ઈ) સબસ્ક્રાઇબરની ઉંમર ૫૦ વર્ષની થાય ત્યાં સુધી ઈક્વિટીમાં ૭૫ ટકા રોકાણ કરવામાં આવે છે. ૫૧મા વર્ષથી આ મર્યાદા દર વર્ષે ૨.૫ ટકાના હિસાબે ઘટાડવામાં આવે છે અને ૬૦મા વર્ષે એ ૫૦ ટકા સુધી આવી જાય છે. કોર્પોરેટ ડેટ (સી) મહત્તમ ફાળવણી ૧૦૦ ટકા સરકારી સિક્યોરિટીઝ (જી) મહત્તમ ફાળવણી ૧૦૦ ટકા ઓલ્ટરનેટિવ એસેટ (એ) મહત્તમ ફાળવણી ૫ ટકા અહીં નોંધવું ઘટે કે એનપીએસની એક્ટિવ પસંદગી હેઠળ ઈક્વિટી માટે દર્શાવાયેલી મર્યાદા મહત્તમ છે. દરેક સબસ્ક્રાઇબર પોતાની જોખમ ખમવાની શક્તિના આધારે પોતાના પોર્ટફોલિયોમાં ઈક્વિટીની ઓછી ફાળવણી પણ રાખી શકે છે.  
એક્ટિવ ચોઇસનો એક ફાયદો એ છે કે સબસ્ક્રાઇબરને પોતાનાં

રોકાણનાં લક્ષ્યો સુધી પહોંચવા માટે જેટલો સમય યોગ્ય લાગે એના આધારે એ એનપીએસમાં એસેટ એલોકેશન નક્કી કરી શકે છે. આપણે જોઈએ કે નિવૃત્તિની ઉંમર જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ ઈક્વિટીમાં રોકાણ ઘટતું જાય છે અને ડેટમાં રોકાણ વધતું જાય છે.  
એસેટ એલોકેશન - ઓટો ચોઇસ:  
ઓટો ચોઇસમાં ફાળવણી આપોઆપ બદલાતી જાય છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ જોખમ ઘટાડીને સંપત્તિનું જતન કરવા પર વધુ લક્ષ આપવામાં આવે છે. સબસ્ક્રાઇબરની ઉંમરના આધારે એનપીએસનું એસેટ એલોકેશન બદલાય છે. જોકે, ઓટો ચોઇસમાં પણ સબસ્ક્રાઇબરને થોડી ફ્લેક્સિબિલિટી મળે છે. આ ચોઇસમાં ફાળવણીના ત્રણ અલગ અલગ મોડેલ છે. એમને ‘લાઇફ સાઇકલ ફંડ્સ’ કહેવાય છે. દરેક ફંડ વચ્ચે તફાવત હોય

## NPSમાં એસેટ એલોકેશનની પસંદગી



એ. આ તફાવત સબસ્ક્રાઇબરની ઉંમરના આધારે દરેક એસેટ ક્લાસમાં થતી ફાળવણી પર આધારિત હોય છે. જેમને નાણાકીય બજાર વિશે વધુ જાણકારી ન હોય એવી વ્યક્તિ ઓટો ચોઇસમાં જઈ શકે છે.  
એગ્રેસિવ લાઇફ સાઇકલ ફંડ (એલસી૭૫):  
આ ફંડમાં ઈક્વિટીમાં રોકાણ માટેનો હિસ્સો મહત્તમ ૭૫ ટકા હોય છે. કોર્પોરેટ ડેટમાં મહત્તમ ૧૦ ટકા અને સરકારી સિક્યોરિટીઝમાં મહત્તમ ૧૫ ટકા હિસ્સો રાખવામાં આવે છે.  
આ ટકાવારી ૩૫ વર્ષથી ઓછી વયના સબસ્ક્રાઇબર્સ માટે છે. ૩૬મા વર્ષથી આ ફાળવણીમાં દર ૫ વર્ષે ફેરફાર કરવામાં આવે છે. ૩૫ વર્ષની વય સુધી ઈક્વિટી હિસ્સો વધારે હોવાને કારણે નિવૃત્તિ માટેની બચત નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે.  
મોટી ઉંમરે ઈક્વિટીનો હિસ્સો ઘટીને ડેટનો ભાગ વધતો હોવાથી એનપીએસ

## આરોગ્ય એક્સપ્રેસ સંઘ્યા સિંહ

આજકાલ ભારતીય યુવાનો વિશ્વના અન્ય દેશોના યુવાનોની જેમ એક તરફ ફાસ્ટ ફૂડના દિવાના બની રહ્યા છે તો બીજી તરફ તેમનામાં સલાડ પ્રત્યે એક ખાસ પ્રકારનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. આખરે, આ વિરોધાભાસનું કારણ શું છે? તે ક્યા એવા પાંચ સલાડ છે જે આ દિવસોમાં સમગ્ર ભારતમાં યુવાનોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે? આવી એક પછી એક જાણીએ કે શું માત્ર સલાડ પર નિર્ભર રહેવું સ્વાસ્થ્ય માટે સારું છે?  
**ફાસ્ટ ફૂડના કેઝનું કારણ**  
યુવાનોમાં ફાસ્ટ ફૂડ અને સલાડ પ્રત્યે વધતા આકર્ષણ પાછળ ઘણા કારણો છે, જે સામાજિક, સાંસ્કૃતિક અને સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણ સાથે સંબંધિત છે. ફાસ્ટ ફૂડ પ્રત્યે આકર્ષણનું મુખ્ય કારણ તેનો સ્વાદ, તેની ઝડપી ઉપલબ્ધતા, ઝડપી જીવનશૈલી સાથે અનુકૂળનક્ષમતા. આજકાલ મિત્રો સાથે ફાસ્ટ ફૂડના આઉટલેટ્સની મુલાકાત લેવી એ પણ એક સામાજિક પ્રવૃત્તિ બની ગઈ છે.  
આ બધાની સાથે આ આકર્ષણમાં આકર્ષક માર્કેટિંગનો પણ હાથ છે. સારી રીતે વિચારેલી વ્યૂહરચના તરીકે, મલ્ટીનેશનલ કંપનીઓ તેમની ફાસ્ટ ફૂડ બ્રાન્ડની જોરશોરથી જાહેરાત કરે છે. આ બધાને કારણે યુવાનો સરળતાથી તેમની જાળમાં ફસાઈ જાય છે. આજે સારો પગાર મેળવતા યુવાનો દર મહિને ફાસ્ટ ફૂડ પર સરેરાશ ૫,૦૦૦ રૂપિયા ખર્ચી નાખે છે? આ જ કારણ છે કે ૮૦ ટકા ફાસ્ટ ફૂડનું સેવન કરનારા ભારતીય યુવાનોમાં તેનો વપરાશ વાર્ષિક ૧૫ થી ૨૦ ટકા વધી રહ્યો છે.  
**હવે સલાડનું આકર્ષણ**  
એક તરફ આકર્ષક સ્વાદ અને આધુનિક જીવનશૈલી યુવાનોને ફાસ્ટ ફૂડ તરફ આકર્ષે છે તો બીજી તરફ યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધતી જાગૃક્તા, વધતી સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગના યુવાનોમાં વધતા જતા કેસ, બીજી તરફ મોડર્ન અને ગ્લોબલ આહારમાં સલાડનો વધતો ટ્રેન્ડ પણ યુવાનોને સલાડ તરફ આકર્ષે છે. ફિટનેસના વધતા જતા ટ્રેન્ડને કારણે પણ સલાડ હેલ્થી ડાયટ તરીકે લોકપ્રિય બન્યું છે. આ બધા સિવાય ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત થતી કલરફૂલ અને સર્જનાત્મક

## બની રહ્યા છે આજના યુવાનો... સલાડ દીવાને!



સલાડની તસવીરો પણ યુવાનોને આકર્ષિત કરે છે.  
**ભારતમાં પ ખૂબ જ લોકપ્રિય સલાડ**  
કિવનોઆ અને આવાકાડો સલાડ- પ્રોટીન અને હેલ્થી ફેટ્સથી ભરપૂર છે. દાડમ અને ઓલિવ તેલ ઉમેર્યા પછી તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.  
ગ્રીક સલાડ - કાકડી, ટામેટાં, ઓલિવ, ફેટા ચીઝ અને ઓરેગાનો વડે બનાવવામાં આવે છે, તે તાજગીથી ભરપૂર છે.  
ચિકન સીસર સલાડ - ગ્રીલ્ડ ચિકન, લેટીસ અને પામેઝન ચીઝ તેને યુવાનોમાં લોકપ્રિય બનાવે છે.  
સ્પ્રાઉટ્સ સલાડ - ફાળગાવેલા મગ અને ચણા, લીંબુ અને મસાલા વડે તૈયાર કરાયેલ આ સલાડ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે.

ફૂટ અને ડ્રાયફ્રૂટનું સલાડ - સફરજન, સંતરા, દાડમ, અખરોટ અને કિસમિસનું આ મિશ્રણ હેલ્થી અને સ્વાદિષ્ટ છે.  
**માત્ર સલાડ કેટલું આરોગ્યપ્રદ છે?**  
નિષ્ણાતોના મતે માત્ર સલાડ પર આધાર રાખવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, કારણ કે તેનાથી શરીરમાં પોષણની ઉણપ સર્જાય છે. સલાડમાં પ્રોટીન, ફેટ અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. આ કારણોસર, માત્ર સલાડ ખાવાથી શરીરને પૂરતી ઊર્જા મળતી નથી, ખાસ કરીને યુવાન અને સક્રિય લોકોને. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી માત્ર સલાડ પર રહેવાથી શરીરમાં નબળાઈ આવે છે અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ પણ થઈ શકે છે. તેથી, સલાડને સંતુલિત આહારનો એક ભાગ બનાવવો જરૂરી છે. કહેવાનો અર્થ એ છે કે તેની સાથે દાળ, રોટલી

અને ભાતની સાથે તેમાં પ્રોટીન (ચિકન, પનીર, ટોફુ) અને હેલ્થી ફેટ્સ (ઓલિવ ઓઇલ, નટ્સ) વગેરે પણ ઉમેરવું જોઈએ.  
**સલાડ એક ઊભરતો વ્યવસાય**  
યુવાનોમાં વધતા આકર્ષણને કારણે ભારતમાં સલાડનો વ્યવસાય ઝડપથી ઉભરી રહ્યો છે. ખાસ કરીને શહેરી યુવાનો જંક ફૂડને બદલે અથવા ક્યારેક તેની સાથે હેલ્થી વિકલ્પો પસંદ કરી રહ્યા છે, ખાસ કરીને મેટ્રો શહેરોમાં રહેતા કામ કરતા યુવાનો રેડી-ટુ-ઇટ સલાડને પસંદ કરી રહ્યા છે કારણ કે આ સમય બચાવવાનો વિકલ્પ પણ છે. આ ઉપરાંત, કલાઉડ કિચન અને ઝોમેટો, સ્વિગી અને ઝોઝો જેવી ફૂડ ડિલિવરી એપ્સને કારણે પણ સલાડ વિશે જાગૃતિ વધી છે, જેના કારણે વર્ષ ૨૦૨૪માં ભારતીય સલાડ માર્કેટનું કદ વધીને રૂ. ૩,૦૦૦ - ૪,૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે અને ૧૦-૧૨ વાર્ષિક દરે વૃદ્ધિ થઈ રહી છે. ઉપરાંત, ભારતમાં વધી રહેલા શહેરીકરણ અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિને કારણે આ ઉદ્યોગ વધુ વિકસશે.  
આગામી દિવસોમાં ઓર્ગેનિક સલાડ અને હર્બલ સલાડ જેવા સ્પેશિયાલિટી સલાડ ઉત્પાદનોની માંગ વધવાની છે, કારણ કે આવનારા દિવસોમાં સલાડ વેલનેસ ફૂડ્સ અને ફિટનેસ ડાયટ પ્લાનમાં તેનું મજબૂત સ્થાન બનાવશે. તેમજ ભારતીય યુવાનોમાં સલાડનો વપરાશ વધુ વધશે. કારણ કે હાલમાં ભારતના યુવાનો દર વર્ષે ૫ થી ૭ કિલો સલાડ વાપરે છે, જ્યારે અમેરિકન યુવાનો દર વર્ષે ૨૦-૨૫ કિલો સલાડ વાપરે છે. જ્યારે ઈટાલી, ગ્રીસ અને ફ્રાન્સમાં પણ યુવાનો સરેરાશ ૧૫ થી ૨૦ કિલો સલાડ વાપરે છે.

પ્રકરણ: ૧૮

# મોહશી

પ્રકૃત્ત કાનાબાર


અચાનક આવી પડેલા જેલવાસને કારણે તેની ઘન મેળવવાની લાલસામાં તેર વર્ષનો જે બ્રેક લાગી ગયો હતો એ હવે સ્ટ્રિંગની જેમ ઊછળ્યો હતો...!

જુગારીઓ કેટલીક વાર તીનપત્તીમાં બ્લાઇન્ડ રમતા હોય છે. સોહમ તો કોઈકે બિણાવેલી શતરંજની ચાલ પર જીવનને દાવ પર લગાવીને બ્લાઇન્ડ ગેમ રમવા નીકળી પડેલો નરબંકો જ હતોને!

આ તરફ, સમય સાથે કદમ મિલાવતો 'ગુજરાત એક્સપ્રેસ' હૈસલ વગાડતો તેજ ગતિએ આગળ વધી રહ્યો હતો. દરેક સ્ટેશને એક માનવસમુદાયને પોતાનામાં સમાવતો અને એક માનવ સમુદાયને છોડતો, બધી જ લાગણીઓથી વિસ્તૃત.. અલગારી જોગીની જેમ બસ પોતાના નિર્ધારિત માર્ગ પર પ્રયાણ કરી રહ્યો હતો... એનું તો બસ માત્ર એક જ ધ્યેય હતું.. મુસાફરોને મંજિલે પહોંચાડવાનું.. સોહમનું પણ એક જ ધ્યેય હતું.. ધનવાન બનવાનું.

ટ્રેનનો ડ્રટ નિર્ધારિત હતો. સોહમનો નહોતો. સોહમને તો વાપીથી આગળ ક્યાં જવાનું છે, એ પણ ખબર નહોતી. નિયતિ જે દિશામાં લઈ જાય તે દિશામાં એ હિંમતપૂર્વક આગળ વધ્યે જતો હતો. સોહમ આ ઉંમરે બરોબર સમજી ગયો હતો કે જીવન ક્યારેય એકધારા લયમાં વહેતું નથી. મોહ એ જ જીવનની વાસ્તવિકતા છે. ચાહે એ પ્રેમનો હોય, સત્તાનો હોય, પ્રતિષ્ઠાનો હોય કે ધનનો હોય. લોકો એક પગ કબરમાં

# મોહશી



હોય એ ઉંમરે પણ મોહ છોડી નથી શકતા તો સોહમ તો યુવાન હતો. તેણે આટલી ઉંમરમાં દારુણ ગરીબી સિવાય કાંઈ જોયું જ નહોતું. સોહમને બાળપણનો એ પ્રસંગ યાદ આવી ગયો. એ વખતે તેની ઉંમર દસેક વર્ષની હશે. ચાલીની નજીકમાં જ આવેલી વાડીમાં એક લગ્નપ્રસંગ હતો. ચાલીના અન્ય ત્રણ છોકરાં સાથે સોહમ પણ મફતમાં જમવા માટે અંદર ઘૂસી ગયો હતો. એક ચાલાક માંડવાવાળાના ધ્યાનમાં એ ચારેય છોકરાઓ આવી ગયા હતા. તેણે જઈને શેકનું ધ્યાન દોર્યું હતું. શેક ઉદાર સ્વભાવના હતા.

ચાર ગરીબ છોકરાઓ જમી જાય તો તેમને વાંધો નહોતો. પેલા ભાઈએ શેકને ચેતવ્યા હતા કે નાનાં બાળકોને લઈને શહેરમાં આખી ગેંગ કાર્યરત છે. આવાં બાળક પાસે જ એ ગેંગ ચોરી કરાવતી હોય છે. શેક ચમક્યા હતા.

એ દિવસોમાં ચોરીના એવા બનાવો અખબારમાં વાંચવામાં પણ આવતા હતા. ચારેય છોકરાઓ હાથમાં ડીશ લઈને હજુ જમવાનું શરૂ કરે ત્યાં શેકે તેમને પકડી પાડ્યા હતા. શેકે પ્રસંગ બગડે નહી તેથી પોલીસને બોલાવવાનું માંડી

વાળ્યું હતું. શેકના માણસોએ થોડી ધોલધપાટ કરીને એ છોકરાઓને જવા દીધા હતા. સોહમનું શર્ટ ફાટી ગયું હતું. તેના હાથમાં રહેલો મોહનથાળનો ટુકડો હાથમાંથી નીચે પડી ગયો હતો. સોહમે એ ટુકડો કોઈ જુએ નહીં તેમ ચડીના બિસ્સામાં મૂકી દીધો હતો. બહાર જઈને મ્યુનિસિપલિટીના નળમાં આવતાં પાણી વડે ધોઈને એ મોહનથાળ સોહમે ખાધો હતો. સોહમ ઘરે આવ્યો એ પહેલાં તો ચાલીના અન્ય પાડોશીઓ મારફતે માને સોહમના પરાક્રમની ખબર પડી ગઈ હતી. મા સોહમની રાહ જ જોઈ રહી હતી. સોહમ આવે એટલે તેનો કાન આમળવાનું માએ નક્કી જ કરી રાખ્યું હતું.

સોહમ ઘરમાં આવ્યો અને તેનાં ફાટેલાં કપડાં જોઈને માનો ગુસ્સો ગાયબ થઈ ગયો હતો. તે રડી પડી હતી. સોહમે માની સાડીના ફાટેલા પાલવ વડે તેનાં આંસુ લૂછતાં કહ્યું હતું... 'મા, હવે આનું ક્યારેય નહીં કરું.' મા નાનકડા સોહમને વળગી પડી હતી. જોવાનુજોગ બીજે જ દિવસે બંગલાવાળી શેકાણીએ ખોખામાં જ ચારે મોહનથાળના બે ટુકડા આપ્યા હતા ત્યારે માએ પરાણે બંને ટુકડા સોહમને ખવાડીને સંતોષનો શ્વાસ લીધો હતો! પૈસાના સતત અભાવ વચ્ચે વીતેલું બાળપણ જ્યારે મોટું થાય છે ત્યારે માણસની અંદર અદ્ભુત પૈસા કમાવાની તૃષ્ણા ઊભી કરે છે. એ એવી તૃષ્ણા હોય છે જે દિવસરાત સતત વધતી જ રહે છે.

સોહમે જલદીથી પૈસા કમાવા માટે ભણવાનું છોડીને નોકરી કરવાનું પસંદ કર્યું હતું. પગાર ડબલ થવાની લાલચે તેણે શેક પાસે સામેથી જીવના જોખમવાળું કામ માગ્યું હતું. પહેલે જ દિવસે પયાસ લાખના ડાયમંડ લઈ જતી વખતે મનોહરે બિણાવેલી જાળમાં સોહમ ફસાઈ ગયો હતો.

અમદાવાદ રેલવે સ્ટેશને વેઈટિંગ રૂમમાં બેઠેલા સોહમ અને મનોહર પર કેટલાક જાણભેદુ મવાલીઓ ત્રાટક્યા હતા. સોહમ શેકનો દાગીનો સાચવવામાં નિષ્ફળ નીવડ્યો હતો. એ લૂંટ કેસમાં સોહમ છાપે ચડી ગયો હતો. જોકે એ વખતે નસીબે તેને સારી ચારી આપી હતી. ચોરીસ કલાકમાં જ સાચા ગુનેગારો પકડાઈ ગયા હતા. સોહમે હાશકારો અનુભવ્યો હતો. ખુશખુશાલ સોહમ ઘરે આવ્યો હતો. ઘરમાં પ્રવેશતાં જ તેણે જોયું કે બાપુ મા સાથે પૈસા માટે ઝઘડો કરી રહ્યા હતા. બાપુના મારથી ઘાયલ થયેલી માને જોઈને સોહમે દિમાગ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો. આવેશમાં આવી જઈને તેણે બાપુનું ખૂન કરી નાખ્યું હતું.

સોહમે પરિસ્થિતિથી ભાગવાને બદલે હિંમતપૂર્વક નજીકના પોલીસ સ્ટેશને જઈને ગુનો કબૂલી લીધો હતો. આમ સોહમને જેલમાં તો જવું જ પડ્યું હતું. જો જેલમાં જવાના યોગ ઊભા ન થયા હોત તો કદાચ સોહમની વધારે ને વધારે ધન મેળવવાની દોડ તો ચાલુ જ હોત!

અચાનક આવી પડેલા જેલવાસને કારણે તેની ધન મેળવવાની લાલસામાં તેર વર્ષનો જે બ્રેક લાગી ગયો હતો એ હવે સ્ટ્રિંગની જેમ ઊછળ્યો હતો. મનમાં ઘરબાયેલી એ ધનતૃષ્ણાને કારણે જ સોહમ આજે એવા સુવર્ણમૃગ તરફ દોડી રહ્યો હતો જેના વિષે એ બિલકુલ અજાણ હતો.

ધન મેળવવાની લાલસા અને મળી ગયા પછી તેની પાછળની સતત દોડ જ તૃષ્ણામાંથી મુગતૃષ્ણા સાબિત થતી હોય છે, જેનો ખ્યાલ ભાગ્યે જ કોઈને આવતો હોય છે. સોહમ પણ તેમાંથી બાકાત નહોતો. પડશે એવા દેવાશે સિદ્ધાંત એવો છે કે જો માણસ તેમાં સફળ થાય તો સમાજ તેના સાહસને બિરદાવે છે અને નિષ્ફળ જાય તો એ જ સમાજ માણસને મૂર્ખ કહીને તેની ટેકડી ઉડાડે છે!

સોહમ હવે સમાજ શું કહેશે તેની ચિંતા કરીને જીવવાવાળો યુવાન નહોતો. ભાડમાં જાય સમાજ એવી જ વ્યક્તિ બોલી શકતી હોય છે, જેણે બાળપણમાં અનેક દોકરો ખાધી હોય છે. કહેવાતા સમાજે તેને અને તેની ગરીબીને તબિયતથી ઘા માર્યા હોય છે! સોહમે બારીમાંથી જોયું કે ટ્રેન નવસારી સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રવેશી રહી હતી. સુરત સ્ટેશને કરેલા ભારે નાસ્તાને કારણે સોહમની આંખમાં ઘેન હતું, તેણે ફેરિયા પાસેથી એક કપ ચા લઈને પી લીધી. નવસારી સ્ટેશને ઊતરનારાની સંખ્યા નહિવત્ હતી.

ટ્રેન ઊપડી એટલે સોહમે ડબ્બામાં નજર દોડાવી. સૌ કોઈ પોતાની ધૂનમાં મસ્ત હતું. કોઈ અખબાર વાંચી રહ્યું હતું તો કોઈ કાનમાં ઈઅર ફોન ભરાવીને સંગીત સાંભળવામાં મસ્ત હતું. ઉપરની સીટ પર એક યુવાન લેપટોપ પર વ્યસ્ત હતો. થોડી થોડી વારે તે તેના હાથમાં રહેલા સેલ ફોન પર કોઈકની સાથે વાત પણ કરી લેતો હતો. સોહમ મનમાં જ વિચારી રહ્યો..

ખરેખર આ તેર વર્ષમાં દુનિયા સાવ બદલાઈ જ ગઈ છે. કોમ્પ્યુટર અને મોબાઈલે તો દુનિયાને સાવ નાની બનાવી દીધી છે! થોડી વાર બાદ ડબ્બામાં તાળીઓના ટપાકાનો અવાજ આવવા લાગ્યો. એક પાવેચો દરેક પાસે બંને હાથ વડે તાળી પાડીને પૈસા માગી રહ્યો હતો. સોહમને નવાઈ લાગી.

અત્યાર સુધીમાં ડબ્બામાં ભિખારી તો ઘણા આવી ગયા હતા, પણ આ રીતે ટ્રેનમાં પાવેચાને પૈસા માગતાં તે પહેલી વાર જોઈ રહ્યો હતો. લોકો દસની નોટ આપીને પાવેચાને આગળ રવાના કરતા હતા. સોહમે આંખ બંધ કરી દીધી. તે ઊંઘી રહ્યાનો ડોળ કરવા લાગ્યો. થોડી વાર બાદ સોહમે આંખ ખોલીને જોયું કે પાવેચો આગળ નીકળી ગયો હતો. સોહમને એકાએક અંકુશ યાદ આવી ગયો.

જેલમાંથી છૂટવાના એક દિવસ પહેલાં જ અંકુશ સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ. જો અંકુશ ન મળ્યો હોત તો તેની આ લાંબી અને અજાણી સફર શરૂ જ ન થઈ હોત! સોહમ વિચારી રહ્યો.. અંકુશનું જે લમાં મળવું એ નિયતિનો ખેલ હતો કે કોઈકે બિણાવેલી શતરંજનો ખેલ હતો?

સોહમ હાથમાં સેલફોન રમાડી રહ્યો હતો ત્યાં જ રિંગ વાગી.. (કમશ:)



'મુંબઈ સમાચાર'ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોચડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઇલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

**ભાષા વૈભવ...**

ગુજરાતી - અંગ્રેજી શબ્દોની જોડી જમાવો

A	B
ફીણ	BOILING
ધાતુ	ALLOY
ઉત્કલન	LATHER
અવશેષ	METAL
મિશ્રધાતુ	RESIDUE

**ઓળખાણ પડી?**

ગુજરાતમાં આવેલા રીંછ માટે આરક્ષિત આ ભય ૧ ૨ હુ ય ની ઓળખાણ પડી? રીંછ ઉપરાંત નીલ ગાય અને ઝરખ પણ જોવા મળે છે.

અ) મિતિયાલા અભયારણ્ય બ) જેસોર અભયારણ્ય  
ક) પૂર્ણા અભયારણ્ય ડ) જાંબુઘોડા અભયારણ્ય

**ગયા વખતનો ઉકેલ**

૧	૨	૩	૪	૫	૬
શ	ક્રિ	વ	ર્થ	ક	ક
ધિ	જ	શ	ત	ડ	ચ્છ
૯	૧૦	૧૧	૧૨	૧૩	૧૪
૫	૫	૫	૫	૫	૫
૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭
તિ	ર	ચા	ત	ક	૧૯
૧૬	૧૭	૧૮	૧૯	૨૦	૨૧
તા	ર	ક	૬	૫	છ
૨૧	૨૨	૨૩	૨૪	૨૫	૨૬
અ	સો	મા	૨૪	૨૫	૨૬
વ	વો	પ	૫	૫	ક
૨૭	૨૮	૨૯	૩૦	૩૧	૩૨
ગ	મા	૨	૨	૩	૫
૩૧	૩૨	૩૩	૩૪	૩૫	૩૬
ણ	૩૧	૩૨	૩૩	૩૪	૩૫
૩૩	૩૪	૩૫	૩૬	૩૭	૩૮
ના	ની	ય	ક	લ	ક

**શબ્દલાલિત્ય**

૧	૨	૩	૪	૫	૬
		૭	૮	૯	૧૦
૧૧	૧૨			૧૩	૧૪
૧૫		૧૬	૧૭		૧૮
	૧૯			૨૦	
૨૧		૨૨	૨૩		
	૨૪			૨૫	૨૬
૨૭		૨૮	૨૯	૩૦	
			૩૧		૩૨
	૩૩			૩૪	

- સતીશ વ્યાસ**
૧. ખાસિયત (૪)
  ૪. પુરોહિત, રસોયો (૪)
  ૭. બારણું ખટખટવો (૩)
  ૯. આદત (૨)
  ૧૧. વગાડનાર (૩)
  ૧૩. ગામમાંથી કાઢી મૂકવું તે (૪)
  ૧૪. --- ડાકણને ખાય (૨)
  ૧૬. કોઠો, સારણી (૩)
  ૧૮. યોગ્ય, ઘટિત, પ્રચલિત (૨)
  ૧૯. તજજી (૩)
  ૨૦. ચહેરો (૩)
  ૨૧. રોગ (૨)
  ૨૨. ધૂળ (૪)
  ૨૫. માથે વાળ ના હોય એવો પુરુષ (૩)
  ૨૭. ખંતરમાં જવાનું લાકડાનું બેખાંભિયું (૪)
  ૨૯. માચીસ (૩)
  ૩૧. સન્માનસૂચક સંબોધન (૨)
  ૩૩. વરઘોડા જેવું સરઘસ (૪)
  ૩૪. લોકગીતની નાખિકા (૪)

**ચતુર આપો જવાબ**

‘રાજમહેલમાં સુરાઈ શોખનો વિષય ગણાતી’ પંક્તિમાં સુરાઈ શબ્દનો અર્થ જણાવો.

અ) સુવાસ બ) શરણાઈ ક) કૂંજો ડ) પાત્ર

**ગુજરાત મોરી મોરી રે**

કોઈ વ્યક્તિ AROMACHOLOGY ના અભ્યાસ સાથે સંકળાયેલી છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) શાસ્ત્ર બ) રાજા ક) ગંધ ડ) શસ્ત્ર

**માતૃભાષાની મહેક**

બધી વનસ્પતિ લીલા રંગની હોય છે. તેઓ સૂર્યના પ્રકાશમાં રહીને જ ક્લોરોફિલની મદદથી વાયુમાંના કાર્બોનિક એસિડ ગેસનું પૃથક્કરણ કરીને કાર્બનને પોતાના શરીરમાં પોષણ માટે લે છે તથા ઓક્સિજન તજે છે, પરંતુ પ્રાણીઓ વાયુમાંથી ઓક્સિજન લે છે અને કાર્બોનિક એસિડ તજે છે.

**ઈર્શાદ**

પડ્યા પર પાટું કદી દાગ્યા ઉપર ડામ, દઈશ ના કોઈને કદી એ દુર્જનનું કામ.

- પ્રભુલાલ દિવેદી

**સુડોકુ-૩૦૯૨**

૩			૬	૭	
		૯	૩	૧	૫
	૧	૮	૨	૬	૯
	૩	૭	૮		૫
૬		૫	૮	૧	
૯	૪	૩	૮	૧	
૬		૧	૯	૫	
		૬	૭		૮

**સુડોકુ-૩૦૯૧**

૩	૫	૧	૭	૯	૨	૪	૮	૬
૨	૭	૬	૮	૪	૧	૫	૯	૩
૮	૯	૪	૫	૩	૬	૨	૭	૧
૫	૮	૯	૧	૬	૩	૭	૪	૨
૭	૬	૩	૨	૫	૪	૯	૧	૮
૧	૪	૨	૯	૭	૮	૬	૩	૫
૬	૨	૭	૩	૧	૯	૮	૫	૪
૯	૩	૮	૪	૨	૫	૧	૬	૭
૪	૧	૫	૬	૮	૭	૩	૨	૯

- ઊભી આવી**
૧. ખાસિયત (૪)
  ૪. પુરોહિત, રસોયો (૪)
  ૭. બારણું ખટખટવો (૩)
  ૯. આદત (૨)
  ૧૧. વગાડનાર (૩)
  ૧૩. ગામમાંથી કાઢી મૂકવું તે (૪)
  ૧૪. --- ડાકણને ખાય (૨)
  ૧૬. કોઠો, સારણી (૩)
  ૧૮. યોગ્ય, ઘટિત, પ્રચલિત (૨)
  ૧૯. તજજી (૩)
  ૨૦. ચહેરો (૩)
  ૨૧. રોગ (૨)
  ૨૨. ધૂળ (૪)
  ૨૫. માથે વાળ ના હોય એવો પુરુષ (૩)
  ૨૭. ખંતરમાં જવાનું લાકડાનું બેખાંભિયું (૪)
  ૨૯. માચીસ (૩)
  ૩૧. સન્માનસૂચક સંબોધન (૨)
  ૩૩. વરઘોડા જેવું સરઘસ (૪)
  ૩૪. લોકગીતની નાખિકા (૪)

**માઈન્ડ ગેમ**

વિશિષ્ટ સાધનની મદદથી કુદરતી તેમ જ કૃત્રિમ રેસામાંથી કાપડ વણીને તૈયાર કરનાર ઈસમ કયા નામે ઓળખાય છે?

અ) સલાટ બ) રબારી  
ક) તરગાળા ડ) સાળવી

**ગયા મંગળવારના જવાબ**

ભાષા વૈભવ

A	B
હંસ	SWAN
તેતર	PARTRIDGE
ટીટોડી	LAPWING
ગીધ	VULTURE
કલકલિયો	KINGFISHER

માઈન્ડ ગેમ કંસારા

**ઓળખાણ પડી?**

Sweet Birch

**ગુજરાત મોરી મોરી રે**

ધ્વનિ

ચતુર આપો જવાબ અર્થ જણાવો હાલયાલ

**ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.**

(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ધીરેન ઉદેશી (૫) ગીતા ઉદેશી (૬) પ્રતિમા પમાણી (૭) ભારતી ભુચ (૮) ખુશરૂ કાપડિયા (૯) વિભા મહેશ્વરી (૧૦) ડો. પ્રકાશ કટકિયા (૧૧) ભારતી પ્રકાશ કટકિયા (૧૨) શ્રદ્ધા આશર (૧૩) પુષ્પા પટેલ (૧૪) નિખિલ બંગાળી (૧૫) અમીશી બંગાળી (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) અશોક સંઘવી (૧૮) મીનજી કાપડિયા (૧૯) મહેન્દ્ર લોઢાવિયા (૨૦) મનીષા શેક (૨૧) ફાલ્ગુની શેક (૨૨) મહેશ દોશી (૨૩) સુરેખા દેસાઈ (૨૪) કિશોર બી. સંઘરાજકા (૨૫) અંજુ ટોલિયા (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) રશીક જુથાણી - ટોરંટો - કેનેડા (૨૯) પ્રવીણ વોરા (૩૦) હર્ષા મહેતા (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) જ્યોત્સ્ના ગાંધી (૩૩) રમેશ દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) હિના દલાલ (૩૬) નયના ગિરીશ મિસ્ત્રી (૩૭) જગદીશ ઠક્કર (૩૮) નિતિન બજરિયા (૩૯) નૂતન વિપીન, (૪૦) નંદકિશોર સંજાણવાળા (૪૧) મહેશ સંઘવી (૪૨) વીણા સંપટ (૪૩) દેવેન્દ્ર સંપટ

**ઊભી આવી**

૧. ખાસિયત (૪)
૪. પુરોહિત, રસોયો (૪)
૭. બારણું ખટખટવો (૩)
૯. આદત (૨)
૧૧. વગાડનાર (૩)
૧૩. ગામમાંથી કાઢી મૂકવું તે (૪)
૧૪. --- ડાકણને ખાય (૨)
૧૬. કોઠો, સારણી (૩)
૧૮. યોગ્ય, ઘટિત, પ્રચલિત (૨)
૧૯. તજજી (૩)
૨૦. ચહેરો (૩)
૨૧. રોગ (૨)
૨૨. ધૂળ (૪)
૨૫. માથે વાળ ના હોય એવો પુરુષ (૩)
૨૭. ખંતરમાં જવાનું લાકડાનું બેખાંભિયું (૪)
૨૯. માચીસ (૩)
૩૧. સન્માનસૂચક સંબોધન (૨)
૩૩. વરઘોડા જેવું સરઘસ (૪)
૩૪. લોકગીતની નાખિકા (૪)





feedback@bombaysamachar.com

સ્વાસ્થ્ય સુધા  
શ્રીલેખા યાજ્ઞિક

બોરનું નામ વાંચતાં કે સાંભળતાંની સાથે ભગવાન શ્રી રામ તથા રામભક્ત શબરીની કથા આંખો સમક્ષ તાજી થઈ જાય. બોરને ભારતના 'પ્રાચીન ફળ' તરીકે ઓળખવામાં આવે છે. 'ચીની સફરજન' તરીકે જાણીતા છે. વાનસ્પતિક નામ 'જિજિફસ મોરિસિયાના' છે. બોર સાથે પ્રત્યેક વ્યક્તિની બાળપણની યાદ સંકળાયેલી જોવા મળે છે. એક સમય એવો હતો કે જ્યારે રિસેશ પેડે ત્યારે શાળાની બહાર રેકડીમાં બોર-જામફળ-આથેલાં આમળાં-કોઈ-કાચી કેરી, ગરમાગરમ સિંગ-ચણા જેવી વિવિધ વસ્તુઓ વેચાતી મળતી. બોરની ઉપર ચટપટો મસાલો છાંટીને ખાવાની મજા કાઠક અલગ જ હતી. ભગવાન શિવનું પ્રિય ફળ બોર જ છે. તેથી જ શિવરાત્રીના પર્વમાં ભગવાન શિવજીને બોરનું નૈવેદ્ય અચૂક ધરાવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને બોરનું નૈવેદ્ય ધરાવવા બાદ બોર ખાવાની પ્રથા ભારતમાં જોવા મળે છે.

એવું જાણવા મળે છે કે નાના અમથા ફળમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો સમાયેલા છે. મોસમી ફળ હોવાને કારણે શિયાળામાં તે ઢગલામોઢે જોવા મળે છે. બોર માટે એવું કહેવાય છે કે સ્વાસ્થ્ય માટે આવશ્યક તેવાં ૨૪માંથી ૧૮ એમીનો એસિડ તેમાં સમાયેલાં છે. પૌષ્ટિક તત્ત્વોની વાત કરીએ તો વિટામિન, પનીજ તથા શર્કરાની માત્રા સમાયેલી હોય છે. બોરમાં મુખ્ય વિટામિન, રાઈબોફેવિન તથા થાયમિન સમાયેલાં છે. બોરમાં પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ જેવાં અનેક પોષક સત્ત્વો સમાયેલાં છે. વિટામિન એ તથા વિટામિન સીની માત્રા ભરપૂર છે, બોરનો આહારમાં ઉપયોગ વિવિધ બીમારીની સામે લડવાની ક્ષમતા વધારે છે. ભારત સાથે વિશ્વના અનેક દેશો જેવા કે ચીન, યુરોપ, રશિયામાં બોર ઉગાડવામાં આવે છે. બોરના ઠંણિયામાં કેન્સર સામે લડવાની ક્ષમતા જોવા મળે છે. ભારતમાં બોરમાં વિવિધ પ્રકાર જોવા મળે છે. જેમાંથી ચોક્કસ પ્રકારના બોરનું સેવન કરી શકાય છે. બોર કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે. પાકી ગયા બાદ આછા લાલ રંગના બની જાય છે. હાલમાં તો બજારમાં લીલા રંગના મોટા બોર જોવા મળે છે. જે સ્વાદમાં થોડા ક્રિકા હોય છે. બોર માટે નિષ્ણાત ખોરાકના ઈતિહાસકારો (ફૂડ હિસ્ટોરિયન)ના મત મુજબ બોરની ઉત્પત્તિ ૪૦૦૦ વર્ષ પૂર્વે ચીનમાં થઈ હતી. તો વિશ્વકોશ ટ્રિટાનિકામાં જણાવ્યા અનુસાર ચીનમાં સૌ પ્રથમ બોરની ખેતી જોવા મળતી, ત્યાર બાદ ભારત, અફઘાનિસ્તાન, મલેશિયા, લેબેનોન, ઈરાન કવીન્સલૅન્ડ તથા ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં બોરની ખેતી કરવામાં આવતી.

બોરનો ઉપયોગ વિવિધ ઔષધિ બનાવવામાં લાંબા સમયથી થતો આવ્યો છે. જો પ્રમાણભાવન રાખીને બોરનું સેવન કરવામાં આવે તો શરીરને અનેક ફાયદા મળી રહે છે. ભારતમાં બોરનું અથાણું, મુરબો તથા મુખવાસ બનાવવામાં આવે છે.

## ખટમધુરા બોરમાં સમાયેલા છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો



### બોરનું અથાણું



સામગ્રી: ૫૦૦ ગ્રામ પાકેલાં બોર, ૨ ચમચી વરિયાળી, ૨ ચમચી અજમા, ૨ ચમચી જીરું, ૨ ચમચી આખા ઘાણા, ૫-૬ નંગ આખા લાલ મરચાં, ૧ ચમચી રાઈના કુરિયા, અડધી ચમચી મેથીના કુરિયા, ૨ ચમચી શેકેલું મીઠું, ૪ ચમચી સિંગતેલ, ૧ ચમચી હિંગ

બનાવવાની રીત: સૌ પ્રથમ બોરને બરાબર સાફ કરીને ૨ કલાક તડકે સૂકવવા. બોરને થોડા દબાવી દેવા. બી કાઢવાની આવશ્યકતા નથી. હવે એક કઠાઈમાં સૌ પ્રથમ મીઠું શેકી લેવું. તેને એક બાજુ કાઢી લેવું. કઠાઈમાં વરિયાળી, જીરું, આખા ઘાણા, લાલ મરચાં, શેકી લેવા. સુંગધ આવે ત્યાર બાદ આંચ ઉપરથી ઉતારીને વાટી લેવું. રાઈ મેથીનાં કુરિયાં શેકી લેવાં. હવે તે કઠાઈમાં તેલ ગરમ કરવું. તેલ હુંચ થાય ત્યાર બાદ તેમાં હિંગ ભેળવીને બોર ઉમેરવા. તૈયાર કરેલો મસાલો, મીઠું, રાઈ-મેથીના કુરિયા વગેરે ભેળવીને કાચની સ્વચ્છ બરણીમાં ભરી લેવું. એક સપ્તાહ બાદ બોરનું ચટપટું અથાણું તૈયારવા માટે તૈયાર થઈ જશે. ગરમાગરમ ખાજવાના રોટલાં કે જુવારની રોટલી સાથે ખાવું.

પાચનક્રિયામાં સુધારો લાવે છે: બોરમાં ડાયટેરી ફાઈબર તથા કાર્બોની માત્રા સમાયેલી છે. બોરનું સેવન કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. ફાઈબરની સાથે ચોક્કસ પ્રકારના મિનરલ્સ તથા વિટામિનની માત્રા હોવાને કારણે બોરનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે. લાંબા સમયથી પેટમાં ગેસ-અપચાની તકલીફ રહેતી હોય તેમના માટે બોરનું સેવન વરદાન સમાન છે.

હાડકાંની મજબૂતાઈ માટે ગુણકારી: બોરમાં કેલ્શિયમ, ફોસ્ફરસની માત્રા છે. જે હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. આર્થરાઈટીસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે બોરનું સેવન લાભદાયક ગણાય છે. બોરમાં એન્ટિ-ઈન્ફલેમેટરી ગુણો સમાયેલા છે. જેને કારણે બોરનું સેવન કરનાર વ્યક્તિના શરીરમાં સોજાની સાથે બળતરા કે દુખાવાની તકલીફમાં રાહત મળી શકે છે.

ત્વચા ચમકદાર બને છે: બોરમાં વિટામિન સી તથા એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ જોવા મળે છે. જે ત્વચાને ચમકીલી બનાવવાની સાથે વધતી વયને કારણે ત્વચા ઉપર પડતી અસરને ધીમી પાડવામાં મદદ કરે છે. વિટામિન સીનું પ્રમાણ ભરપૂર હોવાને કારણે બોરનું સેવન કરવાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે. ત્વચા ઉપર કરચલી કે કાળા ડાઘનું પ્રમાણ ઘટવા લાગે છે.

લોહીનું પરિભ્રમણ સુધારવામાં લાભકારી: ખટમધુરા બોરમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, આયર્ન તથા ઝીંક સમાયેલાં છે. ઉપરોક્ત મિનરલ્સને કારણે હૃદય સંબંધિત તકલીફથી બચી શકાય છે. આયર્નનું પ્રમાણ વધુ હોવાને કારણે લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે. જેને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ નિયમિત થવા લાગે છે.

એવું જાણવા મળે છે કે બોરનું સેવન કરવાથી વ્યક્તિ માનસિક તાણથી મુક્ત બને છે. નિયમિત મોસમી ફળનું સેવન કરવાથી મન શાંત બને છે. શરીર તાજગી અનુભવે છે. બોરમાં ફોસ્ફરસની માત્રા સમાયેલી છે જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી: બોરમાં નમકની માત્રા ઓછી તથા પોટેશિયમની માત્રા અધિક હોય છે. બને સાથે મળીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બોરમાં આયર્ન તથા ફોસ્ફરસની માત્રા વધુ હોય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ નિયમિત થવા લાગે છે. લોહીની કોશિકા કે નસ બોરના સેવન બાદ શાંત બને છે. લોહીનું પરિભ્રમણ સુચારુ રીતે થવા લાગે છે. જેથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

feedback@bombaysamachar.com

આરોગ્ય પ્લસ  
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

## કેવી છે પથરીની પળોજણ ....

શું આપ જાણો છો?...

૨૦માંથી ૧ વ્યક્તિને જીવનકાળ દરમિયાન પથરી થાય છે.

\* સ્ત્રીઓ કરતાં પુરુષોને પથરી વધુ પ્રમાણમાં થાય છે. હવે જાણી લો, પથરી એટલે શું? કિડની કે મૂત્રમાર્ગમાં કડક સ્ફટિક જેવું બનિજ કે જે, કેલ્શિયમ ઓક્સલેટ્સ, ફોસ્ફરસ, યુરીકએસિડ વગેરેથી બનેલું હોય છે.

પથરી થવાનાં લક્ષણ:

જો પથરી નાની હોય તો તે પોતાની રીતે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, પરંતુ જો મોટી હોય તો એનાં લક્ષણો આવાં હોય છે.

\* કમર, મૂત્રાશય, નાભી, મસ્તક વગેરેમાં ખૂબ જ દુ:ખાવો થાય. \* પથરી જ્યારે કિડનીમાંથી મૂત્ર નળીમાં આવે ત્યારે મૂત્રનળી સાંકડી હોવાથી મૂત્ર વિસર્જન સમયે ખૂબ જ ધીડા થાય છે અને પેશાબમાં લોહી પણ આવી શકે છે.

\* વારંવાર થોડો થોડો પેશાબ થવો, પેશાબમાંથી દુર્ગંધ આવવી અને શરીરમાં પરસેવો વધુ વળવો.

શું છે પથરી થવાનાં કારણ ? :

- \* ૨૦થી ૪૦ વર્ષ સુધીના લોકોને પથરી વધુ પ્રમાણમાં થાય છે.
- \* મૂત્રના વેગને રોકવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે.
- \* વધુ પડતા ગળ્યા, ખારા અને ક્ષારવાળા પદાર્થોના સેવનથી પથરી થાય... \* પાણી ઓછું પીવાથી તેમ જ પેશાબ ઓછો આવવાથી પણ થાય,,
- \* દારૂના વ્યસનથી.
- \* વધારે તડકામાં રહેવાથી કે વધારે શ્રમ કરવાથી.
- \* જાડાપણું, ડાયાબિટીસ કે વધારે બ્લડપ્રેશર હોવાથી.
- \* મૂત્રાશયનું ઇન્ફેક્શન થવાથી.
- \* અમુક પ્રકારની દવાઓના સેવનથી.
- \* સંભોગ વખતે વીર્યના વેગને રોકવાથી.
- \* અમુક લોકોને વારસાગત પણ થઈ શકે છે.

પથરી વિશે આ પણ જાણવું જરૂરી છે....

\* પથરીના દર્દીએ આહારમાં આ ત્રણ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. \* પથરી મોટે ભાગે કેલ્શિયમ ઓક્સલેટ્સથી બનેલી હોય છે એટલે...

(૧) ઓછા સોડિયમયુક્ત (મીઠાચુકત) આહાર લેવા કેમ જે, ખોરાકમાં વધુ મીઠું (સોડિયમ) આવવાથી તે વધારાનું સોડિયમ લોહીમાં રહેલ કેલ્શિયમને કિડનીમાં જમા કરશે. પથરી કિડની તે કેલ્શિયમને મૂત્રનળી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેથી મૂત્રનળીમાં કેલ્શિયમની પથરી થઈ શકે છે.

(૨) ઓછા ઓક્સલેટ્સ યુક્ત આહાર લેવા કેમ કે, આહારમાં ઓક્સલેટ્સ યુક્ત પદાર્થો વધવાથી તે ઓક્સલેટ્સનું લોહીમાંથી કિડનીમાં જઈ પથરીમાં રૂપાંતર થાય છે.

(૩) વધુ કેલ્શિયમયુક્ત આહાર લેવા... ઘણા લોકો એવું માનતા હોય છે કે, પથરી દરમિયાન કેલ્શિયમ યુક્ત પદાર્થો જેવા કે, દૂધ-દહી ન જમવા જોઈએ, પરંતુ તે ખોટી માન્યતા છે. આહારમાં કેલ્શિયમની માત્રા ઓછી કરવાથી ઓક્સલેટ્સની પથરી થવાની શક્યતા વધી જાય છે. એટલું જ નહીં,



કેલ્શિયમ ઓછું કરવાથી હાડકાં સંબંધી અનેક રોગ થઈ શકે છે.

દર્દી માટે આહાર શું જમવું ?

\* રોજ ૩-૪ લિટર પાણી પીવું. \* વધુ કેલ્શિયમયુક્ત આહાર લેવો, જેમકે દૂધ, દહીં, સફરજન, કેળાં, સૂકામેવો વગેરે....

\* પાણીમાં જવ નાખી ઉકાળીને ગાળી લેવું, તે છૂટથી પીવું.

\* કળથી, મેથી, મૂળા અને તાંદળજાની ભાજી વધુ લેવી.

શું ન જમવું ?

\* વધુ મીઠાચુકત આહાર

\* વધુ ઓક્સલેટ્સયુક્ત આહાર : નશીલા પદાર્થો, દાઘ, નારંગી, સ્ટ્રોબેરી, બીટ, ગાજર, ફલાવર, રીંગણા, લીલાં મરચાં, શકરિયાં, મરી, વગેરે.

\* પોલિશ કરેલા ચોખા, ઘઉંનો લોટ વગેરે ઓછા ખાવા.

\* ક્ષારવાળા પદાર્થો ખૂબ જ ઓછા જમવા : ટમેટાં, પાલખ, આદિ ભાજી, રીંગણા, ભીંડો, મગફળી, શકરિયા, બીટ વગેરે...

\* કોઈ પણ પ્રકારની સોડા ન લેવી. ચા-કોફી પણ વધુ ન લેવા.

\* વધુ ગળ્યાં અને ખાટાં પદાર્થો ઓછાં જમવાં.

શું છે પથરીના અકસરી કહી શકાય એવા ઉપચાર ?

\* સવાર-બપોર અને સાંજ ૧ ચમચી ગોખરનું ચૂર્ણ ફાકીને પાણી પીવું.

\* રોજ સવાર-સાંજ નાળિયેરના પાણીમાં ૧ ચણા જેટલું સિંધાલૂણ નાખીને પીવાથી પથરી તૂટીને ભૂકો થઈ પેશાબ દ્વારા નીકળી જાય છે.

\* મૂળાના પાનની ઘીમાં બનાવેલી ભાજીમાં લીંબુનો રસ મેળવી રોજ જમવાથી કિડનીની પથરી ઓગળી જાય છે.

\* લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.

\* ૧ ગ્લાસ નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને રોજ સવારે પીવું.

\* કારેલાનો રસ છાશ સાથે પીવો.

\* એક મહિના સુધી રોજ સવારે ગાયના દૂધની છાશમાં સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં પીવાથી પથરી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

\* રોજ રાત્રે ૫૦ ગ્રામ કળથી પાણીમાં પલાળી, તેને સવારે ઉકાળી ગાળીને પીવાથી પથરી મટે છે.

\* ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર નાખી ઉકાળી પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે.

\* રોજ દાડમ ખાવું અથવા ૧ કપ દાડમનો જ્યૂસ પીવો.

### સાવધાની

- \* પાણી વધુ પીવું.
- \* કબજિયાત ન રહે તેની ખાસ સાવધાની રાખવી.
- \* રોજ ૨૫થી ૩૦ મિનિટ શ્રમ કરવો.

feedback@bombaysamachar.com

આહારથી આરોગ્ય સુધી  
ડૉ. હર્ષા છાડવા

## ઔષધિય ગુણોથી ભરપૂર 'બાંબુ મીઠું'

મીઠા (નમક) ને સ્વાદનો રાજા કહેવામાં આવે છે. મીઠા વગર કોઈપણ વાનગી અધૂરી છે. ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે, પરંતુ મીઠું ન ઉમેરવામાં આવે તો ભોજન અધૂરું લાગે. મીઠું જે ઔષધિય ગુણવાળું હોય તો સોનામાં સુંગધ ભળે સમુદ્રી મીઠું ઉત્તમ મીઠું છે. સમુદ્રી મીઠામાં પ્રક્રિયા કરીને ઔષધિય ગુણવાળું મીઠું બનાવવામાં આવે છે. આ મીઠું છે 'બાંબુ મીઠું' જે ઉચ્ચ ગુણવત્તાવાળું અને સૌથી મોંઘું મીઠું છે. આને પ્રાકૃતિક રૂપથી શેકીને બનાવવામાં આવે છે.

હજારો વર્ષ પહેલા કોરિયા દેશમાં આ નમક બોદ્દ ભિશ્વક દ્વારા બનાવવામાં આવ્યું હતું આને કોરિયામાં જુડિયામ નામથી ઓળખાય છે. જે બાંબુમાં ભરીને માટીથી સીલ કરીને શેકવામાં આવે છે. બાંબુની મહત્તા વિશે અગાઉના લેખમાં માહિતી આપી હતી. બાંબુ એ ઔષધિ ગુણોનો ભંડાર છે. બાંબુ ઉચ્ચ પ્રકારનું કેલ્શિયમ હોય છે. જે તૂટેલા હાડકાં જલદી જોડે છે. કેલ્શિયમની ઓછાપને કારણે થતાં રોગો પર જલદી કાબુ મેળવે છે. આ ઔષધિ ગુણોની પરખ કરીને બોદ્દ ભિશ્વકે આ બાંબુ મીઠું બનાવ્યું. જે આને ત્રણથી નવ વખત શેકવામાં આવે છે. જેટલું વધુ શેકાય તેટલું વધુ ગુણોવાળું બને છે. આ મીઠું કોરિયા, ચીન વિષેતનામ જેવા દેશોમાં મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. આ ઔષધિ ગુણો અનોખા અને પ્રાચીન છે. જેના અગણિત સ્વાસ્થ્ય લાભો છે. પારંપારિક ચિકિત્સા માટે આ શક્તિશાળી પ્રાકૃતિક ઉપાય છે. વિશ્વના ઘણાંય દેશો આનું મહત્ત્વ સમજીને આનો ઉપયોગ ચિકિત્સા માટે કરી રહ્યા છે. એન્ટિ-ઈન્ફલેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ જેવી મેડિકલ પ્રોપર્ટી છે.

ભારતમાં આ નમકની શરૂઆત થોડા વર્ષ પહેલાં જ થઈ છે. પંજાબ પ્રાંતના હોશિયારપુરમાં આ મીઠું બની રહ્યું છે. તે બહારના દેશ કરતાં થોડું સોઝું છે. આ મીઠું બનાવવા માટે પચ્ચીસથી પચાસ દિવસ લાગે છે. બાંબુમાં ભરીને શેકવાથી આનો રંગ બદલાઈ જાય છે. પરપલ ઝાય વાળાં કાળા રંગનો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ પ્રભાવશાળી છે. આ મીઠા વિશેની જાણકારી આપણે ત્યાં નહીવત છે. મોઘું હોવાને કારણે તેમ જ ખૂબ જ મહેનત અને લાંબી પ્રક્રિયાથી બનતું હોવાથી લોકો છૂજુ આ મીઠા માટે માહિતગાર નથી.

વાંસનું મીઠું એક ઉચ્ચ ઊર્જાવાળું ભોજન છે. બાંબુ મીઠું કેલ્શિયમનો ખજાનો છે. વધુ શેકવાને કારણે આ શક્તિશાળી દૂર-અવિરત પ્રકાશ છોડે છે. જે શરીરના તરલ પદાર્થમાં હાઇડ્રોજન પરમાણુઓની કોશિકાઓને પુનઃજીવિત કરવા અને ચયાપચયને ગતિ આપે છે. જે પ્રતિ સેકન્ડ એક ટ્રિલિયનના દરથી કંપન કારણ બને છે. જેથી ચયાપચય વેગવાન બને



છે. વાંસનું મીઠું શરીરના દુષ્પ્રભાવને સાફ, નિયંત્રિત અને પોષિત કરે છે. તેમ જ પોષક તત્ત્વોનું અવશોષણના દરને દસ ગણું વધારે છે. આમાંના એસીથી વધુ ખનિજો જે પ્રતિરક્ષા પ્રણાલીને વધારી દે છે. રક્ત કોશિકાઓને સાફ રાખે છે. જેથી હૃદયનું સ્વાસ્થ્ય અનેકગણું વધી જાય છે. કેલ્શિયમની માત્રા પ્રચીન હોવાને કારણે હાડકાં, દાંત, નખ અને વાળને મજબૂતી આપે છે. સ્નાયુઓના દર્દને મિટાવી દે છે. ઓસ્ટીયો પોરોસીસ જેવી બીમારી થવા દેતા નથી અને થઈ હોય તો સુધાર

અનુપાત અને શરીરના તરલ પદાર્થના પી.એચ.ને સંતુલિત કરે છે. (એટલે કે આલ્કલાઇન બનાવે છે) ૩. ૭૫-૭. ૪૫ના પી.એચ.માનકવાળા માનવ રક્તમાં કીટાણુ જીવિત રહેતા નથી. તેનું સ્વાસ્થ્ય ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે. વાંસનું મીઠું પી. એચ.માં સુધારો કરે છે.

બાંબુ મીઠું રક્તકોશિકાઓને સાફ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. જે અંદરનાં અવયવોને ડિ. ટોકસીફાઇ કરે છે અને સેલ્યુલર મેટાબોલીઝમને ઉત્તેજિત કરે છે. સાથે સાથે પાણી અને ભોજન પર ધારીય પ્રભાવ નાખે છે. જે પ્રતિરક્ષા પ્રણાલીને દૈર્ઘકાલીન લાભ પ્રદાન કરે છે.

વિશ્વનાં ઘણાં ચિકિત્સા કેન્દ્રોમાં આનો ઉપયોગ થઈ રહ્યો છે. મોઘું હોવાને કારણે સામાન્ય લોકો આનાથી વંચિત રહે છે. આ ઉદ્યોગ મહેનતવાળો છે. સાથે સાથે નફાકારક છે. તે બે રીતે સ્વાસ્થ્યના લાભો અને સમુદ્રી મીઠું સરતું છે તેને આ પ્રકારે બનાવીને મોટો નફો કમાવી શકાય છે. બાંબુ ઉદ્યોગને હાલની ભારત સરકાર ખૂબ જ મહત્ત્વ આપે છે. આ ઉદ્યોગ માટે વિત્તીય પ્રાવધાન પણ આપે છે. આ ઉચ્ચ ગુણવાળું મીઠું બનાવવાનો પ્રચાર વધારવો જોઈએ. જેથી સામાન્ય લોકો પણ આનો લાભ લઈ શકે.

સરળતાથી આ મીઠું મળતું નથી. ઓનલાઇન મળી રહે છે. અત્યારના સમયમાં મળતાં પેકેટવાળા નમક સાવચેતીથી ખરીદવા. કેમિકલનું પ્રમાણ અધિક હોવાથી કે વધુ સોડિયમ હોવાથી શરીરમાં બગાડ વધારી દે છે. જેથી બી. પી. ની સમસ્યા વધી રહી છે. બી. પી. ની દવાઓમાં સોડિયમ અને કેમિકલ જે કિડનીની સમસ્યાઓ વધારી દે છે. સમુદ્રી નમક અથવા બાંબુ નમકનો ઉપયોગ હિતવાહ છે.



# ખો-ખો વર્લ્ડકપની ફાઇનલમાં મહિલા બાદ ભારતીય પુરુષ ટીમે પણ રચ્યો ઇતિહાસ, નેપાળને હરાવી જીતી ટ્રોફી

નવી દિલ્હી: ભારતીય પુરુષ ટીમે રવિવારે અહીં રમાયેલી ફાઇનલમાં નેપાળને ૫૪-૩૬ થી હરાવીને પ્રથમ ખો-ખો વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું હતું. કેપ્ટન પ્રતીક વાઘકર અને ટૂનમિન્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા રામજી કમ્પે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેપાળે અગાઉ સ્પર્ધાની શરૂઆતની મેચમાં ભારતને સખત હાર આપી હતી પરંતુ ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં પ્રથમ ટર્નથી નેપાળ પર દબાણ ઊભું કર્યું હતું.



વિજયની ઉજવણી: દિલ્હીમાં રવિવારે રાત્રે ખો ખો વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નેપાળને પરાજય આપ્યા બાદ ઉજવણી કરી રહેલી ભારતીય ટીમ. (એજન્સી)



વિજયની ઉજવણી: દિલ્હીમાં રવિવારે રાત્રે ખો ખો વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નેપાળને પરાજય આપ્યા બાદ ઉજવણી કરી રહેલી ભારતીય ટીમ. (એજન્સી)

## સૌપ્રથમ ખો-ખો વર્લ્ડકપ જીતનાર ભારતની મહિલા અને પુરુષ ટીમને વડા પ્રધાન મોદીનાં અભિનંદન

નવી દિલ્હી: પાટનગર દિલ્હીમાં ભારતની મહિલા ટીમ રવિવારે સૌથી પહેલાં ખો-ખો વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ત્યાર બાદ ભારતીય પુરુષોની ટીમે પણ ફાઇનલમાં નેપાળને હરાવીને ઐતિહાસિક વિજેતાપદ મેળવી લીધું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ

પેલ્લકર મંત્રાલયે બન્ને ચેમ્પિયન ટીમને સોશિયલ મીડિયા મારફત અભિનંદન પાઠવ્યું હતું. મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે 'આપણી પરંપરાગત અને સૌથી જૂની રમતોમાંથી એક ખો-ખોની રમતનો વિશ્વ કપ જીતવા બદલ બન્ને ટીમને

દાર્દિક અભિનંદન. આ તમારી ચળવળ, સંસ્કૃત અને ટીમ વર્કનું સુંદર પરિણામ છે. આ સિદ્ધિ આપણી યુવા જનતામાંથી વધુ ને વધુ લોકોને આ રમત રમવા તરફ પ્રેરિત કરશે.' ભારતીય મેન્સ ટીમે ફાઇનલમાં નેપાળને ૫૪-૩૬ થી હરાવીને ટ્રોફી

જીતી. પ્રતીક વાઘકર પુરોનો છે અને તે આ ફાઇનલનો સ્ટાર પ્લેયર હતો. રવિવારે મહિલાઓની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે નેપાળને ૭૮-૪૦ થી હરાવ્યું હતું. નેપાળની સરખામણીમાં ભારતીય ખેલાડીઓ

સમઝાનાએ પ્રિયંકાને ફાઇનલની બહાર કરી હતી, પણ એ લખકે બી. ચૈત્રાએ જવાબદારી સંભાળી હતી અને ભારતીય ટીમને મુસીબતમાંથી ઉગારી લીધી હતી. ચૈત્રા પાસ કરીને પ્રીમ રન નામના રાઉન્ડમાં છવાઈ ગઈ હતી અને તેને કારણે જ ભારતીય ટીમનો સ્કોર ૭૮

## રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ રણજી ટ્રોફી માટેની મુંબઈની ટીમમાં, જમ્મુ કાશ્મીર સામે રમશે મેચ

મુંબઈ: ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને ૨૩ જાન્યુઆરીથી અહીંના એમસીએ-બીકેસી સ્ટેડિયમમાં રમાનારી જમ્મુ કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચમાં મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે ટીમની કેપ્ટનશિપ કરશે. રોહિતે શાનવારે રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં રમવાની પુષ્ટી કરી

હતી. ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ રમતના લાંબા ફોર્મમાં રોહિતના ફોર્મ પર છેલ્લાં કેટલાક સમયથી સવાલો ઊભા થઈ રહ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તાજેતરમાં જ બધા કરારબદ્ધ ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવાનું ફરજિયાત બનાવ્યું છે, જેમાં ફક્ત ક્રિકેટને સંબંધિત મુદ્દાઓના કિસ્સામાં જ છૂટ આપવામાં

આવી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને જમ્મુ અને કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચ માટે મુંબઈ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત ઘણા સમયથી રેડ બોલ ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે. રોહિત ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ ફોર્મ સામે જઝમી રહ્યો છે. ૩૭ વર્ષીય રોહિતે છેલ્લી ૧૫ ઇનિંગ્સમાં ફક્ત એક અડધી સદી ફટકારી હોવા છતાં ટેસ્ટ ફોર્મમાંથી નિવૃત્તિ લેવાનો ઇનકાર કર્યો હતો. રોહિતે ગયા અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે રોહિતે છેલ્લે ૨૦૧૫માં ઉત્તર પ્રદેશ સામે રણજી ટ્રોફી મેચમાં મુંબઈ તરફથી રમ્યો હતો.

## ગાર્સ અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ભારતનો ધમાકેદાર વિજયી આરંભ

કવાલાલમ્પુર: ડિકેન્ટિંગ ચેમ્પિયન ભારતે મહિલાઓના અન્ડર-૧૯ ટી-૨૦ વર્લ્ડ કપમાં ધમાકેદાર વિજય સાથે શરૂઆત કરી છે. નિક્કી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને ૪૪ રનમાં ઓલઆઉટ કર્યા પછી એક વિકેટના ભોગે ૪૭ રન બનાવીને જીત હાંસલ કરી હતી.



ભારતે મહિલાઓનો સૌપ્રથમ અન્ડર-૧૯ ટી-૨૦ વર્લ્ડ કપ રમવાયો હતો જેમાં ભારતે શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઐતિહાસિક ટ્રોફી મેળવી હતી.

૨૦૨૩માં મહિલાઓનો સૌપ્રથમ અન્ડર-૧૯ ટી-૨૦ વર્લ્ડ કપ રમવાયો હતો જેમાં ભારતે શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ઐતિહાસિક ટ્રોફી મેળવી હતી.

ભારતે રવિવારે ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. ૨૬ રનમાં તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. ૧૮ રનમાં બીજી પાંચ વિકેટ પડી અને ૧૩.૨ ઓવરમાં આખી ડેરિલિયન ટીમ ૪૪ રનમાં પેલિલિયન ભેગી થઈ ગઈ હતી. લેફ્ટ-આર્મ સ્પિનર પારુનિકા સિસોદિયાએ માત્ર સાત રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બે-બે વિકેટ પેસ બોલર વી. જે. જોશીયા અને સ્પિનર આયુષી શુક્લાએ અનુક્રમે પાંચ અને છ રનના ખર્ચે મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝની ત્રણ બેટર રનઆઉટ થઈ હતી.

ભારતે રવિવારે ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ખરાબ શરૂઆત કરી હતી. ૨૬ રનમાં તેમની પાંચ વિકેટ પડી ગઈ હતી. ૧૮ રનમાં બીજી પાંચ વિકેટ પડી અને ૧૩.૨ ઓવરમાં આખી ડેરિલિયન ટીમ ૪૪ રનમાં પેલિલિયન ભેગી થઈ ગઈ હતી. લેફ્ટ-આર્મ સ્પિનર પારુનિકા સિસોદિયાએ માત્ર સાત રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બે-બે વિકેટ પેસ બોલર વી. જે. જોશીયા અને સ્પિનર આયુષી શુક્લાએ અનુક્રમે પાંચ અને છ રનના ખર્ચે મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝની ત્રણ બેટર રનઆઉટ થઈ હતી. ભારતે ૪૫ રનનો નાનો લક્ષ્યાંક

## ઋષભ પંત હશે લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, સંજીવ ગોયન્કાએ કહ્યું- 'તે સફળ કેપ્ટન સાબિત થશે'

કોલકાતા: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમના માલિક સંજીવ ગોયન્કાએ સોમવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં પંત આઈપીએલના ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન બનશે. નોંધનીય છે કે લખનઉએ ગત સીઝન સુધી ટીમની કેપ્ટનશિપ કરી રહેલા કે.એલ. રાહુલને રિટાઇન કર્યો ન હતો.

પંત. અમે તે સમયે તેના પર નિર્ણય કરી લીધો હતો જ્યારે અમે તેને હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ અમે સાથે મળીને તેની જાહેરાત કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. નોંધનીય છે કે પંતને આઈપીએલના મેગા ઓક્શનમાં લખનઉની ટીમે ૨૭ કરોડ રૂપિયાના રેકોર્ડ ભાવે ખરીદ્યો હતો. નવા કેપ્ટન બન્યા બાદ પંતે મીડિયાને કહ્યું હતું કે, 'હું મારું ૨૦૦ ટકા આપીશ. આ મારું તમને વચન છે. હું આ વિશ્વાસ પર ખરા ઊતરવાનો પ્રયત્ન કરીશ. હું નવી શરૂઆત અને નવી ઊર્જા માટે ખૂબ જ ઉત્સાહિત છું.'

ટીમના માલિક સંજીવ ગોયન્કાએ કહ્યું હતું કે, 'અમે નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે શરૂઆત કરીશું. સૌથી અગત્યનું નવા આત્મવિશ્વાસ સાથે હું તમને અમારા નવા કેપ્ટન ઋષભ પંતને રજૂ કરું છું. પંત આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ક્રિકેટ મેચો રમીને ખેલાડી બન્યો હતો. તેણે આ બાબતમાં શ્રેયસ ઐચરને પાછળ છોડી દીધો હતો જેને ૨૬.૭૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ૨૦૧૬ પછી પહેલી વાર પંત દિલ્હી સિવાયની ટીમ તરફથી રમતો જોવા

## નીરજ અને હિમાની: બન્ને હરિયાણાનાં, પણ પહેલી મુલાકાત થયેલી અમેરિકામાં!

► ભાલાઈકેના ચેમ્પિયન ટેનિસ જેલાડી સાથે ગુપચુપ લગ્ન કરી લીધાં

રોહિતક: ભાલાઈકેના ભારતીય ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડાએ રવિવારે શિમલામાં નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ટેનિસ પ્લેયર હિમાની મોર સાથે ગુપચુપ લગ્ન કરી લીધા ત્યાર બાદ નીરજના કાકા સુરેન્દ્ર ચોપડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નીરજ અને હિમાની એકબીજાને સૌથી પહેલાં અમેરિકામાં મળ્યાં હતાં. બન્નેની એ મુલાકાત પછીથી પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. નીરજ અને હિમાની, બન્ને હરિયાણાનાં છે. ઉદ્દેશનીય છે કે ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિક્સ વખતે શૂટર મનુ ભાસ્કરના મમ્મી જયારે પેરિસમાં નીરજ ચોપડાને મળ્યાં હતાં અને તેમની વચ્ચે ખૂબ વાતચીત થઈ હતી ત્યારે મીડિયામાં એવી વાત ચર્ચા હતી કે નીરજ અને મનુ વચ્ચે દિલેશનશિપ છે અને તેઓ કદાચ લગ્ન કરી લેશે. જોકે પછીથી એ માત્ર અટકળો સાબિત થઈ હતી. હિમાની મૂળ હરિયાણાના લરસોલી ગામની રહેવાસી છે. તેણે સ્કૂલ-શિક્ષણ પાણીપતની કિલ્લ એન્જલ્સ સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું અને ત્યાર બાદ દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસમાંથી રાજનીતિશાસ્ત્ર તથા શારીરિક શિક્ષણમાં બેચલર ડિગ્રી મેળવી છે.



તેણે આગળના અભ્યાસ માટે અમેરિકા ગઈ જ્યાં હાલ તે મેકોરમાર્ક આઇઝનબર્ગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ તથા એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી છે. તેણે સઘન વ્યૂસિયાના યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. તે ફેકલ્ટિન પિયર્સ યુનિવર્સિટીમાં પાઈ-ટાઇમ ટેનિસ કોચ તરીકે પણ કામ કરી ચૂકી છે. હાલમાં તે એમ્પ્લોઈડ કોલેજની ટેનિસ ટીમ મેનેજર કરી રહી છે, જ્યાં તે ગ્રેજ્યુએટ સહાયક તરીકે જોડાયેલી છે. હિમાનીના પિતા નિવૃત્ત બેન્ક અધિકારી છે અને તેમણે તેમના ગામમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે.

## ટીમમાં ફેરફારને લઈને અક્ષર પટેલનું મોટું નિવેદન, 'મારે કાંઈ સાબિત કરવાની જરૂર નથી'

કોલકાતા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અનુભવી રવિન્દ્ર જોશીનું સ્થાન લેવાનો મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. અક્ષર પટેલ ભારતીય ટેસ્ટ ટીમમાં થનારા મોટા ફેરફારોની સંભાવનાઓથી અજાણ નથી, પરંતુ તેણે આ મામલે કાંઈ સાબિત કરવાની જરૂર નથી. અક્ષર પટેલ ૩૧ વર્ષનો થયો હતો અને તેના સિનિયર સાથી જેટલી જ કુશળતા હોવા છતાં તે છેલ્લા ઘણાકાંઈ જોડાઈને ગેરહાજરીમાં જ ટીમમાં સ્થાન મેળવી શક્યો છે. અક્ષરે પોતાના ૧૧ વર્ષના આંતરરાષ્ટ્રીય કારિયરમાં ત્રણે ફોર્મેટમાં ૧૮૪ વિકેટ ઝડપી છે જેમાંથી ૫૫ વિકેટ ૧૪ ટેસ્ટમાં ઝડપી છે.

આ ૧૪ ટેસ્ટમાંથી બે બાંગ્લાદેશમાં રમી હતી જ્યારે જોડાઈ અનફિટ થયે. ભારતીય ક્રિકેટમાં થયેલા ફેરફારો વિશે પૂછવામાં આવતા ભારતની ટી-૨૦ ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલે કહ્યું હતું કે ચોક્કસ, પરિવર્તનનો યુગ આવવાનો છે. પણ અંતે તો એ પસંદગીકારો અને કેપ્ટનનો નિર્ણય છે. મારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. તેણે કહ્યું હતું કે મારું કામ મને સોંપાયેલ ભૂમિકા નિભાવવાનું અને સતત મારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો હું સારું પ્રદર્શન કરીશ તો ટીમમાં મારું સ્થાન આપમેળે સુરક્ષિત થઈ જશે. તે માને છે કે તે એક ઓલ-રોન્ડર ખેલાડી છે. હું મારી જાતને

## ચેમ્પિયન ટ્રોફી જીતવાની રોહિત શર્માએ વ્યક્ત કરી આશા, કહ્યું - '૧૪૦ કરોડ ભારતીયો અમારી સાથે હશે'

મુંબઈ: ભારતીય કેપ્ટન રોહિત શર્માને આશા છે કે જ્યારે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વર્ણ પદ્મ પુરસ્કાર ત્યારે ૧૪૦ કરોડ ભારતીયો તેમનું સ્વાગત કરશે. રવિવારે મુંબઈ ક્રિકેટ એસોસિયેશને વાનખેડે સ્ટેડિયમમાં ૫૦ વર્ષ પૂરાં થવા પર એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કર, પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે જેવા સ્ટાર ખેલાડીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન રોહિત શર્માએ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં રોહિત શર્માએ કહ્યું હતું કે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ જીત્યા બાદ ચાલકોની ભીડ જોઈને તેને ટી-૨૦ વર્લ્ડ કપની જીતનો અહેસાસ થયો હતો. રોહિતને પૂછવામાં આવ્યું કે તેને ખરેખર કઈ ઘણા સમજાયું કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું છે? આ અંગે તેણે કહ્યું, 'અહીં સેલિબ્રેશન કર્યા પછી બીજા દિવસે જ્યારે હું જાઓ, ત્યારે અમને ખબર પડી હતી. મને સમજાયું કે અમે જે કર્યું છે તે ખૂબ જ પાસ હતું. ભારતીય કેપ્ટનને કહ્યું હતું કે, 'વર્લ્ડ કપ જીતવો એક વાત છે અને તમારા લોકો સાથે તેની ઉજવણી કરવી અલગ વાત છે. તમે તમારા સાથી ખેલાડીઓ સાથે વિજયની ઉજવણી કરો છો, પરંતુ મને મુંબઈ આવ્યા પછી લોકો

સાથે આ ઉજવણી શેર કરવાની લાગણી મળી હતી. રોહિતે કહ્યું કે 'ભારતીય ટીમ ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન શરૂ કરશે અને અહીંના પ્રતિષ્ઠિત સ્ટેડિયમમાં બીજી ટ્રોફી લાવવાનો પ્રયાસ કરશે.' અમે બીજી ટૂનમિન્ટ શરૂ કરીશું. મને ખાતરી છે કે જ્યારે અમે હુબલ્ડ પર્ફોર્મિંગ ત્યારે ૧૪૦ કરોડ લોકોની શુભકામનાઓ અમારી સાથે હશે. અમે આ જાણીએ છીએ. અમે આ ટ્રોફી (ચેમ્પિયન્સ ટ્રોફી)ને વાનખેડે પરત લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. મહાન સુનીલ ગાવસ્કરે કહ્યું કે જ્યારે પણ તે સ્ટેડિયમ જાય છે ત્યારે તેને હોમ ગ્રાઉન્ડ પર આવવાનું મન થાય છે. સચિન તેંડુલકરે કહ્યું હતું કે તેણે ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેની છેલ્લી ટેસ્ટ રમતી વખતે પણ આવી જ લાગણીઓ અનુભવી હતી. તેણે કહ્યું, 'જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝનું શિશૂલ જાહેર થયું ત્યારે મેં એન શ્રીનિવાસ (તત્કાલીન બીસીસીઆઈ પ્રમુખ)ને ફોન કર્યો અને વિનંતી કરી કે શું સીરિઝની બીજી અને છેલ્લી મેચ વાનખેડેમાં રમાઈ શકે કારણ કે હું ઇચ્છું છું કે તે જોવા માટે મારી માતા આવે. મારી માતાએ અગાઉ ક્યારેય સ્ટેડિયમમાં આવીને મને રમતા જોયો ન હતો. તે સમયે તેની તબિયત એવી હતી કે તે વાનખેડે છોડીને અન્ય કોઈ જગ્યાએ જઈ શકતી ન હતી. બીસીસીઆઈએ તે વિનંતી સ્વીકારી અને મારી માતા અને આખો પરિવાર તે દિવસે વાનખેડેમાં હતો.'

## સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરશે ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ

જૈનપુર (ઉત્તર પ્રદેશ): ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ સમાજવાદી પાર્ટીનાં સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રિયાના પિતા અને કેડાકટથી સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય તુફાની સરોજે જણાવ્યું હતું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુના પિતા સાથે તેમના લગ્ન વિશે વાત કરી છે અને બંને પક્ષ તેના માટે તૈયાર છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ સગાઈ કરવામાં આવી નથી. ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા તુફાની સરોજે કહ્યું હતું કે તેમની પુત્રી અને રિંકુ એક મિત્ર મારફતે મળ્યાં હતાં જેના પિતા પણ ક્રિકેટર છે. તેમણે કહ્યું, રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી પણ વધુ સમયથી ઓળખે છે. બંને એકબીજાને શગુન અને બેટો આપ્યા બાદ સંબંધ નક્કી કર્યો હતો. પ્રિયા સરોજ વારાણસીની રહેવાસી છે અને લાંબા સમયથી સપા સાથે જોડાયેલી છે. તેણીએ ગયા વર્ષે જૈનપુર જિલ્લાની મહલીશહર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી હતી. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ પ્રિયાએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેના પિતા માટે પ્રચાર કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાંથી આટર્સ ગ્રેજ્યુએટ થયેલી પ્રિયાએ નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.

# ધારાવીના રહેવાસીઓને તેમના સપનાનું ઘર મળશે: પ્રોજેક્ટના સીઈઓની હૈયાધારણ

મુંબઈ: કુંભારવાડાની માફક ધારાવીમાં મહારાષ્ટ્ર સરકારની રદ કરવામાં આવેલી ખાલી જમીનને લગતી યોજના વેકેટ લેન્ડ ટેન્ચોર (વીએલટી)ના ભૂતપૂર્વ જમીન ધારકો ધારાવી નોટ ફાઇઝ એરિયા (ડીએનએ)નો જ ભાગ છે અને તેમને કરોડો રૂપિયાના ખર્ચ થઈ રહેલા ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ પુનર્વિકાસ યોજનાનો લાભ મળશે, એમ ધારાવી રિવેલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) / ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તામંડળ (એસઆરએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ધારાવી રિવેલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી)ની રચના સાથે ધારાવીમાં વીએલટી આપમેળે રદ થઈ ગયું હોવાથી ભૂતપૂર્વ માલિકો (ધારકો)ને પુનર્વિકાસ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા હોવાથી તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

આ યોજના હેઠળ ધારાવીમાંથી કોઈ પણ વ્યક્તિ બેઘર નહીં બને, કારણ કે ધર ધરાવતી દરેક વ્યક્તિને તેના સપનાનું ઘર મળશે એમ ડીઆરપી/ એસઆરએના સીઈઓ શ્રી એસવીઆર શ્રીનિવાસએ જણાવ્યું હતું.

નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એનએમડીપીએલ)ના ચેરમેનનો પણ હોદ્દો ધરાવતા શ્રી શ્રીનિવાસએ ઉમેર્યું હતું કે 'હકીકતમાં વીએલટી હેઠળની જમીન હવે ડીએનએ હેઠળ હોવાથી આ વિસ્તારના અલગથી પુનર્વિકાસની જરૂર નથી. એડીઆરપીના કાર્યક્રમ હેઠળ જ આવે છે.'

ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ મેળવનાર અદાણી ગ્રુપ, મહારાષ્ટ્ર સરકાર સાથે તેની સંયુક્ત સાહસ કંપની નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એનએમડીપીએલ) હેઠળ હાઉસિંગ અને કોમર્શિયલ ઇમારતો બનાવી સર્વેનાં તારણો મુજબ ફાળવણી માટે મહારાષ્ટ્ર સરકારના ડીઆરપી/એસઆરએને સોંપી દેશે.

મહારાષ્ટ્રના ૨૦૩૪ના વિકાસ નિયંત્રણ અને પ્રમોશન નિયમન (ડીસીપીઆર)ની કલમ ૩૩ (૧૦) મુજબ કલમ નંબર ૧.૧૨ સ્પષ્ટપણે જણાવે છે કે ડીઆરપી/એસઆરએની સરકારી એકમ તરીકે રચના થતાં ધારાવીમાં વીએલટી આપમેળે રદ થઈ જશે.

આ કલમ અનુસાર મુંબઈ મહાનગરપાલિકા અથવા મ્યુનિસિપલ કમિશન દ્વારા રચાયેલા વેકેટ લેન્ડ ટેન્ચોર હેઠળની કોઈ જમીન અથવા આવી જમીનના કોઈ હિસ્સામાં ઝૂંપડપટ્ટી આવી હોય તો તે જાહેર હિત માટેનો ધારાવી રિવેલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર થાય અને એસઆરએના ધારાવી રિવેલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) વિભાગને મંજૂરી માટે રજૂ કરવામાં આવતાની સાથે જ આપમેળે સમાપ્ત થઈ જશે.

શ્રી શ્રીનિવાસને વધુમાં જણાવ્યું હતું કે 'સર્વેક્ષણ પ્રક્રિયામાં અમને ધારાવીના રહેવાસીઓનું અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે અને મને ખાતરી છે કે વીએલટીના ભૂતપૂર્વ માલિકો (વીએલટી પર વસેલા રહેવાસીઓ) પણ વહેલામાં વહેલી તકે યાલુ પ્રક્રિયામાં સહભાગી થશે.'

તેમણે ડીએનએ હેઠળના કોલીવાડા અને અન્ય પ્રાઈવેટ સોસાયટીઓના પ્રાઈવેટ જમીન માલિકોને પણ પુનર્વિકાસ પહેલાં જોડાવા અપીલ કરી જણાવ્યું હતું કે 'ધારાવીના કેટલાક અંગત માલિકોના વિસ્તારને અમારી સાથે જોડાવવા અને વિશ્વના સૌથી મોટા શહેરી કાયદાકલ્પ પ્રોજેક્ટનો હિસ્સો બનવા મારું આમંત્રણ છે.'

# મુંબઈના પ્રાણીબાગમાં સિંહ લાવવાના પ્રયાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)  
મુંબઈ: ભાયખલામાં રાણીબાગ તરીકે ઓળખાતા વીરમાતા જીજ્ઞાબાઈ ભોસલે બોટોનિકલ ગાર્ડન એન્ડ ઝૂએ ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્સર્વેટર ઓફ ફાઈરેસ્ટ એશિયાઈ સિંહોની જોડી આપવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કમાંથી સિંહોને મુંબઈ લાવવામાં નિષ્ફળતા મળ્યા બાદ રાણીબાગના પ્રશાસન દ્વારા હવે ફરી આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રાણીબાગમાં ૨૦૧૪માં જીમી નામના સિંહનું મૃત્યુ થયું હતું ત્યારથી મુંબઈગરને મુંબઈના પ્રાણીસંગ્રહાલયમાં સિંહના દર્શન કરવા મળ્યા નથી.

આફ્રિકન-એશિયાટિક મૂળના ૧૬ વર્ષનો જીમીનું લાંબી બીમારી બાદ ૨૦૧૪માં રાણીબાગમાં મૃત્યુ થયું હતું. ૧૯૯૮માં ભાયખલાના પ્રાણીસંગ્રહાલયમાં આફ્રિકન સિંહ અમર અને એશિયાઈ સિંહ અનિતાને ત્યાં જન્મેલો જીમી પ્રાણી સંગ્રહાલયનો છેલ્લો સિંહ હતો અને પર્યટકોમાં આકર્ષનું કેન્દ્ર રહ્યો હતો.

## ગુજરાતના પન અધિકારીને વિનંતી

તાજેતરમાં જ મુંબઈ પ્રાણીબાગના અધિકારીઓએ ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્સર્વેટર ઓફ ફાઈરેસ્ટ વિભાગને સંપર્ક કર્યો હતો અને જૂનાગઢ અથવા રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઈ સિંહોની જોડીની માગણી કરી હતી. અગાઉ જ્યારે પ્રાણી સંગ્રહાલયે સિંહો માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો સંપર્ક કર્યો હતો તેના બદલામાં ઝેબ્રાની જોડી આપવાનો પ્રસ્તાવ મુંબઈ રાણીબાગ પ્રશાસન તરફથી મૂકવામાં આવ્યો હતો.

ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં ઝેબ્રા ન હોવાથી અધિકારીઓએ શરૂઆતમાં એશિયાઈ સિંહોના બદલામાં ઈઝરાયેલના રામત ગન સફારી પાર્કમાંથી એશિયાઈ સિંહોને બે જોડી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમાં નિષ્ફળતા મળી હતી.

ભાયખલાના પ્રાણીસંગ્રહાલયના ઉચ્ચ અધિકારીઓએ ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્સર્વેટર ઓફ ફાઈરેસ્ટ વિભાગને સંપર્ક કર્યો હતો અને જૂનાગઢ અથવા રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઈ સિંહોની જોડીની માગણી કરી હતી. અગાઉ જ્યારે પ્રાણી સંગ્રહાલયે સિંહો માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનો સંપર્ક કર્યો હતો તેના બદલામાં ઝેબ્રાની જોડી આપવાનો પ્રસ્તાવ મુંબઈ રાણીબાગ પ્રશાસન તરફથી મૂકવામાં આવ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના એક્સપેર્ટ પ્રોગ્રામ હેઠળ સિંહોની નવી જોડી મેળવવાના અમારા અનેક પ્રયાસ નિષ્ફળ ગયા છે. છતાં અમારા પ્રયાસ ચાલુ છે, જે હેઠળ ગુજરાતના પ્રાણીસંગ્રહાલયમાં વધુ સિંહો છે તેથી અમે એશિયાઈ સિંહોની જોડીની તેમની પાસે માગણી કરી છે.

આ અગાઉ નાગપુરના ગોરેવાડા પ્રાણીસંગ્રહાલયમાંથી ૨૦૨૨માં દીપડાની જોડી લાવવામાં આવી હતી. આ દરમિયાન ૨૦૨૨માં ભાયખલાના પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓની સંખ્યા અને આવકમાં પાછલા છેલ્લા બે વર્ષની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૨૪માં પ્રાણી સંગ્રહાલયમાં ૨૪.૨ લાખ મુલાકાતીઓ નોંધાયા હતા અને ૮.૫ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જે ૨૦૨૩માં ૩૦.૨ લાખ મુલાકાતીઓ અને ૧૨ કરોડ રૂપિયાની આવક હતી. તો ૨૦૨૨માં પ્રાણી સંગ્રહાલયમાં ૨૫.૨ લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને ૧૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી.

# પાલક પ્રધાનોની નિમણૂક માત્ર સીએમની મરજીથી થઈ હોય એવું લાગે છે: દાનવે

છત્રપતિ સંભાળ નગર: રાજ્યના જિલ્લા પાલક પ્રધાનોની યાદીને પગલે જોવા મળતી નારાજગી દર્શાવે છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોઈની પણ સલાહ લીધા વિના તમામ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એમ શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા અંબાદાસ દાનવેએ સોમવારે જણાવ્યું હતું. ૧૮ જાન્યુઆરીએ

જિલ્લાના પાલક પ્રધાનોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના પગલે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના નારાજ હોવાની અટકળો ચાલી રહી છે.

'જે રીતે પાલક પ્રધાનોની નિમણૂક કરવામાં આવી છે તે બતાવે છે કે મહાયુતિમાં અભિપ્રાય નથી લેવામાં આવ્યા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

એકલા જ નિર્ણય લે છે' એવો દાવો મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા દાનવેએ કર્યો હતો.

અસંતોષના અહેવાલો વચ્ચે પ્રધાનો ચંદ્રશેખર બાવનકુળે અને ગિરીશ મહાજન શિંદેને મળવા ગયા છે. મુખ્ય પ્રધાન ફડણવીસ હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માટે દાવોસમાં છે. (પીટીઆઈ) ■

# દુબઈના જાણીતા ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે અભિનેતા કાર્તિક આર્યને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

## મુંબઈમાં કોન્ટ્રાક્ટ પર કરવામાં આવ્યા હસ્તાક્ષર

(અમારા પ્રતિનિધિ તરફથી)  
મુંબઈ: વિદેશમાં ભારતીયોએ નામ સાથે દામ પણ કમાવ્યાં છે ત્યારે દુબઈના જાણીતા પ્રોપર્ટી ડેવલપર ડેન્યૂબ પ્રોપર્ટીઝે બોલીવુડના જાણીતા અભિનેતા કાર્તિક આર્યનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી હતી. બોલીવુડના યુવા સુપરસ્ટાર કાર્તિક આર્યનની આગામી બે વર્ષ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ કાર્તિક આર્યને કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યાં હતા.



ડેન્યૂબ ગ્રૂપના સંસ્થાપક અને અધ્યક્ષ રિઝવાન સાજન અને અભિનેતા કાર્તિક આર્યન

દરમિયાન ડેન્યૂબ પ્રોપર્ટીઝ સાથે જોડતા અભિનેતા કાર્તિક આર્યને વર્લ્ડ ક્લાસ કંપનીની વિશ્વસનીયતા અને ઉત્કૃષ્ટતા મારા વિશ્વાસને અનુરૂપ છે, જ્યારે આ ડેવલપર સાથે જોડાવાનો આનંદ છે, એમ કાર્તિક આર્યને જણાવ્યું હતું.

અહીંના કાર્યક્રમનું સંચાલન મુંબઈ મનીષ પોલ દ્વારા કરવામાં આવ્યું હતું. ડેન્યૂબ પ્રોપર્ટીઝે પોતાની નવી ટેગલાઈન 'ડેન્યૂબ હૈ ના' લોન્ચ કરી હતી, જે નવા ધરવાંચુઓ માટે બ્રાન્ડની મજબૂત વિશ્વસનીયતાનું પ્રતીક છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૩૦ વર્ષના વારસા સાથે આ જ ગુણને લઈને તેઓ ડેન્યૂબ પ્રોપર્ટીઝ સાથે જોડાયા છે. તેની સફળતા અમારી બ્રાન્ડ માટે એક આદર્શ બ્રાન્ડ એમ્બેસેડર બનશે. કાર્તિક સાથે મળીને અમારાં લક્ષ્ય, વિશ્વાસ અને મૂલ્યના વારસાના જતન સાથે ધરના માલિકોને પણ પ્રેરિત કરશે.

અહીંના કાર્યક્રમને સંબોધતાં ડેન્યૂબ ગ્રૂપના સંસ્થાપક અને અધ્યક્ષ રિઝવાન સાજને વધુમાં જણાવ્યું હતું કે 'કાર્તિક આર્યન દૃઢ સંકલ્પનું પ્રતીક છે. આ જ ગુણને લઈને તેઓ ડેન્યૂબ પ્રોપર્ટીઝ સાથે જોડાયા છે. તેની સફળતા અમારી બ્રાન્ડ માટે એક આદર્શ બ્રાન્ડ એમ્બેસેડર બનશે. કાર્તિક સાથે મળીને અમારાં લક્ષ્ય, વિશ્વાસ અને મૂલ્યના વારસાના જતન સાથે ધરના માલિકોને પણ પ્રેરિત કરશે.'

# આધુનિક લગ્નપ્રસંગો માટેનો 'ધ બ્રાઈડ એન્ડ બારાત શો'

લગ્નની મોસમમાં વર-વધૂ સહિત વરઘોડિયાઓ માટે મુંબઈમાં લક્ઝરી વેડિંગ શો 'ધ બ્રાઈડ એન્ડ બારાત શો'નું આયોજન જે ૭ બલ્યુ મેરિયટ, જૂહુ ખાતે ૨૩-૨૪ જાન્યુઆરીના સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ શોમાં ૧૨૦ થી વધુ બ્રાન્ડનો સમાવેશ કરાયો છે. અહીં આધુનિક અને શ્રીમંત લગ્નપ્રસંગો પહેરાંત વસ્ત્રો, જ્વેલરી સહિત બધું એક છત હેઠળ મળી રહેશે. જાણીતા ડિઝાઈનરો, જ્વેલર્સ, ડેકોર વગેરે શોમાં તમારી દરેક પસંદગી ખ્યાલ રાખવા તૈયાર હશે. જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ઓજસ રાજાની પાસેથી ટિપ્સ પણ આપવામાં આવશે.

# રાણીબાગમાં આવેલા મેયર બંગલામાં લાગી ઉદ્યર્



રાણીબાગમાં આવેલા મેયર બંગલામાં લાગી ઉદ્યર્

મુંબઈ મહાનગરપાલિકામાં બે વર્ષથી વધુ સમયથી પ્રશાસકનો કારભાર ચાલી રહ્યો છે અને નગરસેવકોની મુદત માર્ચ ૨૦૨૨માં પૂરી થઈ ગઈ હોવાથી ત્યારથી ભાયખલામાં રાણીબાગમાં આવેલા મેયર બંગલો પણ મેયર વગર ખાલી પડી રહ્યો છે. બંગલાની દેખરેખ રાખવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ હોવા છતાં આ બંગલામાં ઉદ્યર્ લાગી ગઈ હોવાનું જણાઈ આવ્યું છે. આગામી સમયમાં ગમે ત્યારે પાલિકાની યૂંટણી થઈ શકે છે તેથી પ્રશાસને હવે મેયર બંગલાનો સમારકામનો નિર્ણય લીધો છે અને તે માટે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટર નીમવામાં આવ્યો છે. (અમય ૩૪૨)

### ૯. લગ્ન સંબંધી

■ પુશાહિત મેરેજબ્યુરો યોગ્ય જીવનસાથી માટે સંપર્ક ઉર્મિલાબેન 8879576963. (દહેજ નહીં). (૧૫૫૧૫/બી)

### ૧૯. ફેક્ટરી વક્ષાપ

વસર્ધ  
ઈન્ડસ્ટ્રીયલ ગાળા લેવા-વેચવા-ભાડેથી વિશ્વસનીય નામ રાજેશ દિડિયા 9326495003. (એસડીબી-૨૨૭૨)

### ૪૪. પેસ્ટ કન્ટ્રોલ

એસ પેસ્ટીસાઈડ  
(૧૯૯૩થી) ઉદ્યર્, વાંદા, માંકડ. કોલિવેલ 9833523290, 9220789533  
ચીરાબજાર : 9029181030. (૧૫૪૩૯-બી)

### ૧૨. યાત્રા સહેલગાઈ

કેરલા - તમિલનાડુ  
પથનાભ - કન્યાકુમારી - રામેશ્વર - મદુરાઈ - કોટ્ટાઈનાલ 9 દિવસ, એસી ટ્રેન /બસ, શ્રી સ્ટાર હોટેલ. 9867992245 / 8329712327. (બી-૧૫૪૪૬)

### ૩૨. જમીન-મિલકત

■ બંગલા પ્લોટ અને હાઉસિંગ પ્રોજેક્ટ માટે ખાનસ સ્કૂલ રોડ પર દેવલાલી નામ એગ્રી જમીન. માલિક - deolai422401@gmail.com (બી-૧૫૪૪૧)

### ૪૬. વોટર મુકિંગ

BUILDING REPAIR  
સોસાયટી, ટાવર, બંગલો, ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, ટેરેસ, પેરાડીઝ વાંદ, એક્સ્ટરિયલ પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ, આર.સી.સી. પોલીમર વર્ક, પી.યુ. ઈન્જેક્શન ડ્રાઈટિંગ, સીમેન્ટ ડ્રાઈટિંગ (પોર્ટીયમ, બેઝમેન્ટ માટે), દરેક ટાઇપના વોટરમુકિંગ (10 વર્ષની વોરન્ટી).: એથોરાઈઝ્ડ એપ્લિકેટર, સીવીલ કોન્ટ્રેક્ટર.: રાજુ ઠાકોર.: 9172327272, 9323276664. (બી-૧૫૪૪૫)

### વિન્ટર સ્પેશિયલ ઓફર\*

## માથેરાન

સ્વિમિંગ પૂલ  
ઇન્ડોર અને આઉટડોર ગેસ  
ડિસ્કો ટેન્ક  
સ્વાઇપ વેજ લોજન

ધી બાઈક બ્રાઇટલેન્ડ  
+91 7506 111 712  
stay@thebyke.com  
www.thebyke.com

ધી બાઈક હેરિટેજ  
+91 7506 111 715  
+2499/- +3199/-  
weekdays / weekend  
per person per night

(બી-૧૫૩૯૭)

### ૧૪. નોકરી ખાલી છે

NEED STAFF FOR PICKUP. "Majestic", G21, Heena Arcade, Jogeshwara, 9967722995. (SDB-2374)

### ૩૩. પંખાદારી

■ બ્રાઉન કાફેસ્ટા પેપર બેસ બનાવવાના રીટલ્સ, હોલસેલ્સ ખરીદનાર ખોઈએ છે. - 9619959698, 9136961627, 9136967216. (બી-૧૫૪૦૬)

### ૧૭ જગ્યા આપવી છે

BKC INSIGNIA. LARGE 5 BHK, 6 Balcony, 6 Bath-rooms 2 Covered Car Parks. 1706 Sqft Carpet. Fully Furnished with White Goods Available for Sale by Owner. Contact: 9004344049. (B-15403)

### ૪૦. ઈન્સ્ટીટીઅર ડોકોરેશન

ઈન્ટરિયર ડિઝાઈનર  
કમ્પ્લીટ 2 બેડરૂમ, 3D-પ્રોઈંગ 4000/-, 3 બેડરૂમ 3D-પ્રોઈંગ 5000/-, સ્પેશિયલિઝ્ડ બાયથરૂમ, કિચન રીનોવેશન, કમ્પ્લીટ ઈન્ટરિયર ડિઝાઈનિંગ, પ્લાનિંગ, રીનોવેશન. Whatsapp 8989282877. (બી-૧૫૪૦૨)

# શું ઉદય સામંત એકનાથ શિંદેનો પક્ષ છોડશે?

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં પડઘા પાછળ મોટી ઉંચલાપાચલ થઈ રહી છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત સાથે દાવોસની મુલાકાતે ગયા છે અને બીજા તરફ મહારાષ્ટ્રમાં નાથમ મુખ્યપ્રધાન એકનાથ શિંદે તેમના ગામ ગયા હતા. આ બાદમાં રાજકીય વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે.

પૂર્વ વિપક્ષી નેતા વિજય વેડેટીવાર અને ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે સનાસનાટીભર્યાં નિવેદનો આપ્યા હતા. વેડેટીવારે કહ્યું કે ઉદવ ઠાકરેને ખતમ કરીને શિંદેને લાવવામાં આવ્યા હતા. શિંદેને ખતમ કરીને ત્રીજા ઉદયને નક્કરી શકાય નહીં, કારણ કે આ ઉદય બંને બાજુ હાથ રાખી રહ્યા છે. મારો અને એકનાથ શિંદેનો સંબંધ રાજકારણથી પર છે. અમારા વચ્ચે લડાઈ ઉભી કરવાનો પ્રયાસ કરશે તે સફળ નહીં થાય' એમ ઉદય સામંતે દાવોસથી જણાવ્યું હતું. ■

# વતન આવ્યો એનો અર્થ હું નારાજ છું એવું નથી: એકનાથ શિંદે

સતારા: પાલક પ્રધાન તરીકેની નિમણૂકથી નારાજ એકનાથ શિંદે તેમના વતન દરેગામ જતા રહ્યા હોવાની ચર્ચા શરૂ થયા બાદ શિંદેએ પોતે જ આ બાબતે પુલાસો કર્યાં છે. કેટલાક લોકો કહે છે કે હું ગામમાં આવ્યો એટલે હું નારાજ છું. પરંતુ મુખ્ય પ્રધાને કહ્યું કે તેઓ આ જિલ્લાની કાયાપલટ કરવા અને તેને પ્રવાસી જિલ્લા તરીકે વિકસાવવાના કામની સમીક્ષા કરવા દરેગામ આવ્યા હતા. એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે મહાયુતિ મજબૂત છે અને જો તે સંબંધમાં કોઈ સમસ્યા હશે તો ત્રણેય નેતાઓ સાથે બેસીને નિર્ણય લેશે.

તેમણે વધુમાં કહ્યું કે, તેઓ નારાજ હોવાના કારણે નહીં પરંતુ નવા મહાબળેશ્વર પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ગામમાં આવ્યા છે. એકનાથ શિંદેએ

# બીડના સરપંચની હત્યા અંગે મરાઠા સંગઠનો વિરોધ: અજિત પવારને કાળા ઝંડા બતાવ્યા

જાલના: બીડમાં સરપંચની હત્યાના વિરોધમાં મરાઠા સંગઠનના કાર્યકર્તાઓએ સોમવારે જાલનામાં મહારાષ્ટ્રના નાથમ મુખ્ય પ્રધાન અજિત પવારને કાળા ઝંડા બતાવ્યા હતા.

અજિત પવાર રાજવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા એકમના એક કાર્યકર્મમાં સામેલ થયા હતા જ્યાં મરાઠા મહાસંઘના કાર્યકર્તાઓએ તેમને કાળા ઝંડા બતાવ્યા હતા. મરાઠા મહાસંઘના અધ્યક્ષ અરવિંદ દેશમુખે પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. કાર્યકરોએ બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને ન્યાયિક હિંસાના સંબંધમાં ધરપકડ કરાયેલ દલિત સોમનાથ સુર્વેશીનું કસ્ટીમાં મૃત્યુ અંગે નિંદા કરતા સુગ્રોચ્યારે કર્યાં હતા.

અરવિંદ દેશમુખે કહ્યું, "બીડના પાલકપ્રધાન પવારે પરભણીમાં હત્યા કરાયેલા સરપંચ અને દલિત વ્યક્તિના પરિવારજનોને ન્યાય અપાવવો જોઈએ."

બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ૯ ડિસેમ્બરે આ પ્રદેશમાં પવનચક્કી પરિયોજનાનું સંચાલન કરતી ઊર્જા પેઢી પર ગેરવસૂલી બિડ રોકવાના પ્રયાસ બદલ અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. (પીટીઆઈ) ■

# મુંબઈગરા ગરમીથી હેરાન-પરેશાન

(અમારા પ્રતિનિધિ તરફથી)  
મુંબઈ: મુંબઈમાં સોમવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સમગ્ર રાજ્યમાં દિવસનું સૌથી વધુ તાપમાન રહ્યું હતું. દિવસનું ૩૫.૪ ડિગ્રી તાપમાન સામાન્ય કરતા ૪.૩ ડિગ્રી વધુ રહ્યું હતું.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પૂર્વીય પવનોને કારણે મુંબઈમાં દિવસના તાપમાનમાં વધારો થયો હતો. આ દરમિયાન કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૩.૮ ડિગ્રી વધુ હતું.

સોમવારે કોલાબામાં લઘુત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૨.૨ ડિગ્રી વધુ હતું. જ્યારે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન ૧૮.૧ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૦.૯ ડિગ્રી વધુ હતું. ■

# બજારની નજર ટ્રમ્પના પ્રવચન પર: બેન્કિંગ શેરોની આગેવાનીએ સેન્સેક્સમાં ૫૪૫ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ૨૩,૩૦૦ની ઉપર

## મથકો પાછળ સિંગલેલમાં ફેરવો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મક્કમ વૈશ્વિક વલણ સાથે સ્થાનિક બજારમાં બેન્ક શેરોની આગેવાનીએ નિકળેલી લેવાલીના બળે શેરબજારમાં તેજીએ ફરી સ્થાન મેળવ્યું હતું, જેને પગલે સોમવારે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટ ઊછાળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૩,૩૦૦ પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સ ૪૫૪.૧૧ પોઈન્ટ અથવા ૦.૫૯ ટકા ઉછાળીને ૭૭,૦૭૩.૪૪ પોઈન્ટ પર સેટલ થયો હતો. ઈન્ડો-૩, તે ૬૯૯.૬૧ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા વધીને ૭૭,૩૧૮.૯૪ પોઈન્ટની ઊંચી સપાટીને અધીરો હતો. જ્યારે એનએસઈનો બેન્ચમાર્ક નિફ્ટી ૧૪૧.૫૫ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકા વધીને ૨૩,૩૪૪.૭૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો અને ઈન્ડેક્સના ૨૯ ઘટક ઉંચા મથાળે બંધ થયા હતા.

સેન્સેક્સના શેરોમાં, કોટક મહિન્દ્રા બેંક તેના એકીકૃત યોજના નફામાં ૧૦ ટકાની વૃદ્ધિ નોંધાવ્યા પછી, ક્રેના શેરમાં નવ ટકાથી ઉપરનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત બજાર ફાઈનાન્સ, બજાર ક્રિસર્વ, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સ અન્ય સૌથી વધુ વધારા શેરોમાં સામેલ હતા. જોકે, ઝોમેટો, અદાણી પોર્ટર્સ, ડાટા કન્સલ્ટન્ટ્સ સર્વિસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મારુતિ અને ડાટા મોટર્સ ટોપ લુટર રહ્યા હતા.

અમેરિકાના કુવાવાના હળવા ડેટાને પગલે ફેરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની આશા ફરી વધી છે. વધુમાં, ઇઝરાયેલ અને હુમાસ વચ્ચે યુદ્ધવિરામ, યાહયાના અર્થતંત્રનો પાંચ ટકાથી વધુનો વિકાસ, ડોલર ઈન્ડેક્સ અને યુએસ બોન્ડ વિલડનો જળવાયેલો ઘટાડાના ટ્રેન્ડ તેમ જ સ્થાનિક સ્ટરે વેપાર ખાધમાં ઘટાડો થવાથી બજારના

સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. જોકે, યુદ્ધના નબળા આર્થિક વિકાસના ડેટા ચિંતાનો વિષય છે. આ ઉપરાંત નિષ્ણાતો માને છે કે ડોલર ઈન્ડેક્સ અને યુએસ બોન્ડ વિલડનો ઘટાડાનો ટ્રેન્ડ એવો નથી કે વિદેશી ફંડોની વેચવાલીના તીવ્ર દબાણને હળવું કરી શકે. રોકાણકારો ટ્રમ્પ વહીવટ હેઠળ નીતિમાં ધરમ ફેરફારની લહેર અવશે એવું ધારી રહ્યાં છે, જેની વૈશ્વિક ઈકોનોમી બજાર પર અસર પડશે. નિષ્ણાતો અનુસાર ટ્રમ્પની સંભવિત નીતિ ભારતીય રૂપિયા અને શેરબજાર બંને માટે પ્રતિકુળ રહેવાની સંભાવના છે.

સ્થાનિક બજારના સેન્ટિમેન્ટ પર ચાલુ કમાણી સીઝનની અસર વર્તાવી શકે છે, જ્યારે આગામી કેન્દ્રીય બજેટની અટકળોની વધુ અસર વર્તાવી શકે થઈ શકે. બજેટ અંગે અત્યારે મિશ્ર મત પ્રવર્તી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં સુધારો અને સ્થાનિક સીપીઆઇ કુવાવામાં ઘટાડો થવાથી શેરબજારને રાહત મળી છે, આનાથી આરબીઆઇને તેની આગામી નીતિ નક્કી કરવામાં થોડી છૂટ મળી શકે છે; જોકે, ફૂડ ઓઇલના વધતા ભાવ અને દસ વર્ષના બોન્ડની ઊંચી ઉપજ પર ખાસ નજર રાખવામાં આવશે.

કોટક મહિન્દ્રા બેન્કના પરિણામ પછી તેના શેરમાં દસ ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિમોનો શેર એ જ રીતે આઠ ટકા સુધી ઊછાળ્યો હતો. વિમોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ૨૪.૪૦ ટકાના વધારા સાથે રૂ. ૩૩૫૪ કરોડનો યોજાનો નફો અને ૦.૫ ટકાના સુધારા સાથે રૂ. ૨૨,૩૧૯ કરોડની રેવન્યુ નોંધાવી છે. પેટીએમની ખોટ ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને રૂ. ૨૦૮.૫૦ કરોડ રહી છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૨૨.૧.૭૦ કરોડ કરોડની હતી. ઝોમેટોએ ત્રીજા ક્વાર્ટરમાં ૫૭.૨૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૯ કરોડનો યોજાનો નફો નોંધાવ્યો છે.

આઈટીબીઆઇ બેન્કે ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં ૩૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૯૦૮ કરોડનો યોજાનો નફો નોંધાવ્યો છે. આઈઓબીએ બેઝ લોનમાં ઘટાડો થયો હોવાથી ત્રીજા ક્વાર્ટરમાં ૨૧ ટકાના વધારા સાથે રૂ. ૮૭૪ કરોડનો યોજાનો નફો નોંધાવ્યો છે. જીસીસીમાં વિસ્તરણના ભાગરૂપે નિસસ ફાઇનાન્સ સર્વિસિસ કંપની લિમિટેડે દુબઈ નજીક બે એ ગ્રેડ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ, જુમરાહ વીલેજ સર્કલ અને અલ ફર્જાન હસ્તગત કરી હોવાનું જાહેર કર્યું છે. આ સોદા દુબઈ ઈન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સિયલ સેક્ટરના રિજીસ્ટર્ડ નિસસ હાઈ ચીલ્ડ ગ્રોથ ફંડ ક્લોઝડ એન્ડેડ આઇસી મારફ્ટ પર પાડવામાં આવ્યો છે, જે તેની એચએમમાં પંચાવન મિલિયન ડોલરનું યોગદાન આપે છે.

લક્ષ્મી ઈન્ટલનો શેર તેના રૂ. ૪૨૮ના ઇશ્યુ ભાવ સામે એનએસઈ પર ૨૭ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૫૪૨ની સપાટીએ ખૂલ્યો હતો. વેરીટાસ ફાઇનાન્સે રૂ. ૨૮૦૦ કરોડના આઇપીઓ માટે સેબી પાસે ડિઆરએચપી ફાઇલ કરાવ્યું છે. વીનીર એન્જિનિયરિંગે પણ જાહેર ભરખું લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે ડિઆરએચપી જમા કરાવ્યું છે. પ્રવેગ લિમિટેડે ૧૮મી જાન્યુઆરી, ૨૦૨૫ પછી લક્ષ્મીના બાંગારામ ટાપુ પર તેના લક્ઝરી રિસોર્ટ ઓપરેશન્સ શરૂ કરવાની યોજના જાહેર કરી છે. બંગારામ ટાપુમાં પ્રવેગ લિમિટેડનું વિસ્તરણ વૈભવી અને પર્યાવરણભાન રહેઠાણની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવ્યું છે.

પછી તેના શેરમાં દસ ટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો. વિમોનો શેર એ જ રીતે આઠ ટકા સુધી ઊછાળ્યો હતો. વિમોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં ૨૪.૪૦ ટકાના વધારા સાથે રૂ. ૩૩૫૪ કરોડનો યોજાનો નફો અને ૦.૫ ટકાના સુધારા સાથે રૂ. ૨૨,૩૧૯ કરોડની રેવન્યુ નોંધાવી છે. પેટીએમની ખોટ ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને રૂ. ૨૦૮.૫૦ કરોડ રહી છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૨૨.૧.૭૦ કરોડ કરોડની હતી. ઝોમેટોએ ત્રીજા ક્વાર્ટરમાં ૫૭.૨૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૯ કરોડનો યોજાનો નફો નોંધાવ્યો છે.

દરમિયાન, સ્વાન ડિકેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝે સોમવારે દલાલ સ્ટ્રીટમાં પુનરાગમન કર્યું, તેના શેર ૧.૫ વર્ષના વિરામ પછી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ફરીથી સૂચિબદ્ધ થયા. સત્ર દરમિયાન ઈન્ડેક્સ પર આ સ્ટોક પાંચ ટકા જેટલો આગળ વધ્યો હતો. તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી બે વર્ષમાં દેશમાં ૧૦૦થી વધુ આઇપીઓ આવવાની શક્યતા છે. સોમવારે બીએસઈ સેન્સેક્સ ગત શુક્રવારના ૭૬,૬૧૯.૩૩ના બંધથી

યુએસ નીતિ માળખા વિશે રોકાણકારોની ચિંતા અને સ્થાનિક કોર્પોરેટ કમાણીમાં સંભવિત મંદી સેન્ટિમેન્ટ પર ભાર મૂકે છે. એશિયન બજારોમાં, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ઝોનમાં સ્થાયી થયા હતા જ્યારે સિંગોલ નેગેટિવ ઝોનમાં સરક્યું હતું. યુરોપના બજારોમાં તેજી જોવા મળી હતી. શુક્રવારે યુએસ બજારો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એશિયન બજારોમાંથી મજબૂત સકારાત્મક સેન્ટિમેન્ટ સ્થાનિક બજારોને પ્રોત્સાહન આપ્યું હોવાથી સપ્તાહની શરૂઆત તંદુરસ્ત નોંધ સાથે થઈ હતી. વધુમાં, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રોમાંથી કમાણીના મજબૂત પ્રારંભિક સંકેતોને કારણે વ્યાપક લેવાલીને આધારે તેજીનો મહોલ રચાયો હતો. જો કે, ટ્રમ્પની નીતિઓની આસપાસની અનિશ્ચિતતા ચાલુ રહી છે, રોકાણકારો વધુ સ્પષ્ટતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ફૂડ ઓઇલ ટકા ઘટીને ૦.૮૨ ટકા અને પ્રીટ એફ થઈ ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. ૩,૩૧૮.૯૦ કરોડની ઇકિવિટીઓનું વેચાણ કર્યું હતું. શુક્રવારે બીએસઈ બેન્ચમાર્ક ૪૨૩.૪૯ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા ઘટીને ૭૬,૬૧૯.૩૩ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૦૮.૬૦ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઘટીને ૨૩,૨૩૦.૨૦ પર આવી ગયો હતો.

ટેલિકોમ્યુનિકેશન અને બેન્કેક્સ ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યા હતા અને ઓટો ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો. માર્કેટ કેપમાં રૂ. ૨.૮૦ લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. સોમવારે બીએસઈ સેન્સેક્સ ગત શુક્રવારના બંધથી

૪૫૪.૧૧ પોઈન્ટ્સ (૦.૫૯ ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૨.૮૦ લાખ કરોડ વધીને રૂ. ૪૩૧.૧૯ લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ ૭૬,૬૧૯.૩૩ પૂર્ણતી નીચામાં ૭૬,૫૮૪.૮૪ અને ઉપરમાં ૭૭,૩૧૮.૯૪ સુધી જઈને અંતે ૭૭,૦૭૩.૪૪ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૧૭ સ્કિપ વધી હતી, જ્યારે ૧૩ સ્કિપ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૨૨૮ સ્કિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૨,૫૦૩ સ્ટોક્સ વધ્યા હતા, ૧,૫૫૭ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૧૬૮ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૧૫ સ્ટોક્સ બાવન સમાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૭૫ સ્ટોક બાવન સમાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ ઈન્ડિયાસીસમાં બીએસઈ મિડકેપ ૦.૬૬ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૦.૮૨ ટકા વધ્યા હતા. સ્ટ્રેટ્જી ઈન્ડિયાસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા ઘટ્યો અને બીએસઈ એક્સએમઈ આઈપીઓ ૧.૭૭ ટકા વધ્યો હતો.

સેક્ટરલ ઈન્ડિયાસીસમાં બીએસઈ ઓટો ૦.૫૦ ટકા, કંઝુમર ડિસ્કેશનરી ૦.૨૬ ટકા અને એક્સએમસી ૦.૦૮ ટકા ઘટ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન ૧.૧૮ ટકા, બેન્કેક્સ ૨.૦૩ ટકા, પાવર ૧.૩૯ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૨૪ ટકા, યુટિલિટી ૧.૧૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૯૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૩ ટકા, મેટલ ૦.૭૭ ટકા, હેલ્થકેર ૦.૭૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭૨ ટકા, રિયલ્ટી ૦.૫૭ ટકા, કોમોડિટી ૦.૫૭ ટકા, એનર્જી ૦.૫૩ ટકા, કંઝુમર ડ્યુરબલ્સ ૦.૪૯ ટકા, ટેક ૦.૪૧ ટકા, ફોક્સ આઈટી ૦.૩૬ ટકા, સર્વિસીસ ૦.૩૪ ટકા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૧૮ ટકા વધ્યા હતા.

સેક્ટરલ ઈન્ડિયાસીસમાં બીએસઈ ઓટો ૦.૫૦ ટકા, કંઝુમર ડિસ્કેશનરી ૦.૨૬ ટકા અને એક્સએમસી ૦.૦૮ ટકા ઘટ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન ૧.૧૮ ટકા, બેન્કેક્સ ૨.૦૩ ટકા, પાવર ૧.૩૯ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૨૪ ટકા, યુટિલિટી ૧.૧૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૯૬ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૮૩ ટકા, મેટલ ૦.૭૭ ટકા, હેલ્થકેર ૦.૭૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭૨ ટકા, રિયલ્ટી ૦.૫૭ ટકા, કોમોડિટી ૦.૫૭ ટકા, એનર્જી ૦.૫૩ ટકા, કંઝુમર ડ્યુરબલ્સ ૦.૪૯ ટકા, ટેક ૦.૪૧ ટકા, ફોક્સ આઈટી ૦.૩૬ ટકા, સર્વિસીસ ૦.૩૪ ટકા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૦.૧૮ ટકા વધ્યા હતા.

**PUBLIC NOTICE** પબ્લિક નોટીસ

## ડોલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

## વર્તમાન ખાંડ મોસમમાં ૧૦ લાખ ટન ખાંડની નિકાસ છૂટ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડોલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ફૂડોલના વાધદામાં નરમાઈ સાથે સ્થાનિક ઈકિવિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સાધારણ પાંચ પૈસાના સુધારા સાથે ૮૬.૫૫ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આગામી દિવસોમાં સ્થાનિક તેમ જ વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતા ડોલર સામે રૂપિયો ૮૬.૨૦થી ૮૬.૮૦ આસપાસની રેન્જમાં અચડાતો રહે તેવી શક્યતા ફોરેક્સ ટ્રેડરો વચ્ચે વધી રહી છે. ૬૦ના બંધ સામે સુધારાતરફી વલણ સાથે ૮૬.૪૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૬.૫૭ અને ઉપરમાં ૮૬.૪૬ની રેન્જમાં રહીને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૬.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ફૂડોલના વાધદામાં ગઈકાલે રાત્રે જોવા મળેલા ઘટાડાને કારણે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું મિરે એસેટ્સ શેરબાના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં ડોલરમાં જોવા મળી રહેલી મજબૂતાઈ અને સ્થાનિક સ્ટરે ડોલરમાં આયાતકારોની માગને ધ્યાનમાં લેતાં ડોલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં ૮૬.૪૦થી ૮૬.૭૫ની આસપાસની સપાટીએ રૂપિયો જોવા મળી શકે છે તેમ છતાં જો ફૂડોલના ભાવમાં વધુ ઘટાડો થાય અને સ્થાનિક ઈકિવિટી માર્કેટમાં સુધારો જળવાઈ રહે તો રૂપિયાને ટેકો મળશે. દરમિયાન આજે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૧૭ ટકા ઘટીને ૧૦૮.૧૬ આસપાસ અને બ્રેન્ટ ફૂડોલના વાધદામાં ભાવ ૦.૫૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૩૯ આસપાસ ક્વાંટે થઈ રહ્યા હતા.

હાજર ખાંડમાં ક્વિન્ટલે ₹ ૩૦થી ઉચ્ચનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) નવી મુંબઈ: ગત ઓક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ માટે સરકારે ૧૦ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હોવાનું આજે અનાજ ખાતાના પ્રધાન પ્રદેહ જોશીએ આજે એક્સ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ખાંડ મોસમમાં સ્થાનિકમાં પુરવઠાની ચિંતાને ધ્યાનમાં લેતા નિકાસ છૂટ નહોતી આપવામાં આવી. પ્રાપ્ત ઓક્ટાકીય માહિતી અનુસાર નિકાસ માટે આંધ્ર પ્રદેશને ૫૮૪૧ ટન, બિહારને ૨૦,૨૯૭ ટન, છત્તીસગઢને ૩૪૨૩ ટન, ગુજરાતને ૩૧,૯૯૪ ટન, હરિયાણાને ૨૨,૨૧૦ ટન, કર્ણાટકને ૧,૭૪,૯૮૦ ટન, મધ્યપ્રદેશને ૧૮,૪૦૪ ટન, મહારાષ્ટ્રને ૭,૭૪,૯૯૬ ટન, ઓરિસ્સાને ૮૮૬ ટન, પંજાબને ૧૭,૨૦૦ ટન, રાજસ્થાનને ૨૮૪ ટન, તમિલનાડુને ૩૪,૨૩૬ ટન, તેલંગણાને ૭૮૪૨ ટન, ઉત્તર પ્રદેશને ૨,૭૪,૧૮૪ ટન અને ઉત્તરાખંડને ૧૩,૨૨૩ ટન ખાંડની નિકાસનો ક્વાંટા ફાળવવામાં આવ્યો છે. આમ નિકાસ છૂટની જાહેરાત સાથે આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર કિંવન્ટલે રૂ. ૧૫થી ૨૫ના ઉછાળા સાથે રૂ.

૩૫૪૦થી ૩૫૯૦માં થયાના અહેવાલ હતા. આમ મથકો પર તેજીનું વલણ તેમ જ સ્થાનિક સ્ટરે સાર્વજનિક સ્ટરેથી માળ જળવાઈ રહેતાં આજે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં કિંવન્ટલે રૂ. ૩૦થી ૩૨નો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં કિંવન્ટલે રૂ. ૩૦થી ૪૦નો ઉછાળો આવ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ કિંવન્ટલે રૂ. ૭૦ ઉછાળી આવ્યા હતા. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ટ્રિટલ સ્ટરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી કિંવન્ટલે રૂ. ૭૨ અને ઉપલા મથાળેથી રૂ. ૩૦ વધીને રૂ. ૩૬૯૨થી ૩૭૮૨માં થયા હતા. જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી કિંવન્ટલે રૂ. ૩૦ અને ઉપલા મથાળેથી રૂ. ૪૦ વધીને રૂ. ૩૭૫૨થી ૩૮૯૨માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિંવન્ટલે રૂ. ૭૦નો સુધારો આવ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર કિંવન્ટલે રૂ. ૩૬૮૦થી ૩૭૪૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર કિંવન્ટલે રૂ. ૩૭૫૦થી ૩૭૮૦માં થયાના અહેવાલ હતા.

## સોનામાં ₹ ૧૦૬ની આગેફૂચ, ચાંદીમાં ₹ ૬૨૦ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રાંધ્યું હતું. જોકે, બજાર વર્તુળોની નજર આજે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના હોલો અખત્યાર કર્યા બાદના વક્તવ્ય પર સ્થિર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૫થી ૧૦૬ની આગેફૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં વૈશ્વિક બજાર પાછળ સ્ટોકિસ્ટોની વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬૨૦નો ઘટાડો જોવા મળતાં એકંદરે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. આજે સ્થાનિકમાં ૯૯૯ ટય ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જવેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૨૦ના ઘટાડા સાથે રૂ. ૮૦,૨૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ૯૯૫ ટય સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૫ વધીને રૂ. ૭૯,૦૨૭ અને ૯૯૯ ટય સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૦૬ વધીને રૂ. ૭૯,૩૪૫ના મથાળે રહ્યા હતા. એકંદરે આજે ભાવમાં આગેફૂચ રહેતાં સ્ટોકિસ્ટોનો ઉપરાંત જવેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્ટરની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું

સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના આજના વક્તવ્યમાં કુવાવા અને ફેરલ રિઝર્વની ભવિષ્યની નીતિઓ અંગે કોઈ સ્પષ્ટતા મળે તેવા આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા સપ્તાહના બંધ સામે ૦.૨ ટકા વધીને ઓસદીઠ રૂ. ૨૭૦૭.૩૩ ડોલર અને વાધદામાં ભાવ ઓસદીઠ રૂ. ૨૭૪૭.૮૦ની સપાટીએ સાંકડી વધઘટે ટેકલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઓસદીઠ ૭૦.૨૧ ડોલર આસપાસ ક્વાંટે થઈ રહ્યાના અહેવાલ હતા. જો ટ્રમ્પના આજના વક્તવ્યમાં વેપાર અને વેરાની નીતિ અંગે જો નરમાઈનું વલણ જોવા મળશે તો બજારમાં કુવાવાવૃદ્ધિલક્ષી ચિંતાઓ હળવી થશે અને ડોલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની ચિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વોટરે જણાવ્યું હતું. સામાન્યપણે વધતા કુવાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ નીકળતી હોય છે, પરંતુ કુવાવાના સંજોગોમાં અમેરિકી ટ્રેઝરીની ચિલ્ડમાં વધારો સોનામાં માગ રૂંધી રહ્યો છે. જોકે, હાલના તકકે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓ કુવાવાલક્ષી દબાણ વધારે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે અને વધતા કુવાવાના સંજોગોમાં ફેરલ રિઝર્વની વ્યાજદરમાં કપાતની શક્યતાઓ નબળી પડતા સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના આજના વક્તવ્યમાં કુવાવા અને ફેરલ રિઝર્વની ભવિષ્યની નીતિઓ અંગે કોઈ સ્પષ્ટતા મળે તેવા આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા સપ્તાહના બંધ સામે ૦.૨ ટકા વધીને ઓસદીઠ રૂ. ૨૭૦૭.૩૩ ડોલર અને વાધદામાં ભાવ ઓસદીઠ રૂ. ૨૭૪૭.૮૦ની સપાટીએ સાંકડી વધઘટે ટેકલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઓસદીઠ ૭૦.૨૧ ડોલર આસપાસ ક્વાંટે થઈ રહ્યાના અહેવાલ હતા. જો ટ્રમ્પના આજના વક્તવ્યમાં વેપાર અને વેરાની નીતિ અંગે જો નરમાઈનું વલણ જોવા મળશે તો બજારમાં કુવાવાવૃદ્ધિલક્ષી ચિંતાઓ હળવી થશે અને ડોલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની ચિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં સોનામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વોટરે જણાવ્યું હતું. સામાન્યપણે વધતા કુવાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ નીકળતી હોય છે, પરંતુ કુવાવાના સંજોગોમાં અમેરિકી ટ્રેઝરીની ચિલ્ડમાં વધારો સોનામાં માગ રૂંધી રહ્યો છે. જોકે, હાલના તકકે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની વેપાર-વેરાની નીતિઓ કુવાવાલક્ષી દબાણ વધારે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે અને વધતા કુવાવાના સંજોગોમાં ફેરલ રિઝર્વની વ્યાજદરમાં કપાતની શક્યતાઓ નબળી પડતા સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

**BRIHANMUMBAI MAHANAGARPALIKA**



# ફોરમ વર્લ્ડવાઈડ પ્રસ્તુત કરે છે અમેરિકા 2025

2008 થી અમેરિકા ગ્રુપ ટુરો ના ક્ષેત્રે બહોળો અનુભવ સાથે 2023 થી મહારાજ સાથે ની ગ્રુપ ટુરો ના ખરાં પાયોનિયર... 2024 માં 21 ગ્રુપ ટુરો નુ સફળતા પૂર્વક આયોજન કરીને ફરી એકવાર 2025 માટે વચનબદ્ધ !!

**FORAM VIRAL SHAH સાથે ફરો AMERICA ની MOST LUXORIOUS TOUR**



## SABKO PATA HAI, FORAM KE SANG MAZAA HAI!

### અમેરિકા ફક્ત ફોરમ શાહ સાથે જ કેમ ?

- ★ ટુર માં અમારા પોતાના રાજસ્થાની મહારાજ ની સુવિધાઓ આપવા ની ઐતિહાસિક ઉપલબ્ધી. ઓક્ટોબર 2022 થી પોતાના રસોડા સાથે ની ટુરો નુ સફળતાપૂર્વક સંચાલન કરનાર એક માત્ર પાયોનિયર.
- ★ "ફોરમ શાહ" (OWNER) ની હાજરી અને શરૂઆત થી અંત સુધી માર્ગદર્શન, સાથે સાથે પોતાના વર્ષોના અનુભવી IN-HOUSE ગુજરાતી ટુર મેનેજર અને રાજસ્થાની મહારાજ ની સુવિધાઓ
- ★ ઘર ઘર માં લોકપ્રિય એવા ફોરમ શાહ ના કુશળ માર્ગદર્શન હેઠળ 20 વર્ષો ના અનુભવ સાથે. અમેરિકા માં મહારાજ સાથે ની સુવિધાઓ નો ઇતિહાસ રચનાર એ જ ફોરમ વર્લ્ડવાઈડ
- ★ 2018 થી ન્યુ યોર્ક "ટાઇમ સ્ક્વેર" પર 3 રાત્રી નો યાદગાર મુકામ આપનાર પાયોનિયર (WORTH USD 1200)
- ★ 2019 થી મેમોથ લેક્સ માં ગ્લેશિયર ની સામે જ બેસ્ટ હોટેલ, ગુલાબી ઠંડા લોકેશન માં રાત્રી મુકામ આપનાર પાયોનિયર
- ★ વિશ્વ ના સૌથી મોટા 'સ્વામી નારાયણ મંદિર' ની મુલાકાત ફક્ત ફોરમ ની ટુર માં સંભવ
- ★ NIAGARA FALLS માં જેટ બોટ રાઈડ (બાળકો થી મોટા માટે જિંદગીભરનો અનુભવ) (WORTH USD 100)
- ★ સમગ્ર ટુર દરમિયાન UNLIMITED WATER DURING BUS JOURNEY
- ★ ઇન્ટર્નલ ફ્લાઈટ્સ ટુર કોસ્ટ માં સમાવેશ (PER PERSON 2 BAGS X 23 KGS = 46KGS)
- ★ PHILADELPHIA UNESCO WORLD HERITAGE ની સીટી ટુર WITH INDEPENDENCE HALL, ROCKY STEPS, LIBERTY BELL
- ★ લેક તાહો જેવા સુંદર ડેસ્ટીનેશન પ્રસ્તુત કરનાર પાયોનિયર
- ★ STRATOSPHERE TOWER ડે વ્યૂ (ફક્ત ફોરમ સાથે)
- ★ LURAY CAVERNS સાથે VINTAGE CAR MUSEUM અને SHENANDOAH HERITAGE VILLAGE ની યાદગાર મુલાકાત જે ફક્ત ફોરમ વર્લ્ડવાઈડ સાથે જ સંભવ (પાયોનિયર)
- ★ એક સાથે 100 પ્રવાસીઓ ને સફળતાપૂર્વક ફરાવી, યાદગાર ટુરો નું આયોજન કરવા ની ક્ષમતા અને બહોળો અનુભવ
- ★ મોનો કાઉન્ટી વિસ્તાર પર યાદગાર સીનીક ડ્રાઇવ .. મનમોહક મોનો લેક - VISTA POINT ની મુલાકાત
- ★ ઓર્લેન્ડો માં મુખ્ય થીમ પાર્ક નો સમાવેશ અને 1 DRIVE પર 4 રાત્રી નો મુકામ (MAIN TOURIST STREET)
- ★ કેલિફોર્નિયા નુ કેપિટલ "સેક્રામેન્ટો" ની મુલાકાત (ફક્ત ફોરમ સાથે) - OLD SACRAMENTO WATER FRONT WITH TRAIN STATION, GOLDEN BRIDGE AND CAPITOL BUILDING
- ★ A/C કોચ ની મુસાફરી સાથે કરવું NIAGARA FALLS ની લોકલ સાઈટ સીઇં (ના કે ચાલી ને)
- ★ TAX-FREE SHOPPING માટે NEW JERSEY MILLS ની મુલાકાત ફક્ત ફોરમ સાથે
- ★ GRAND CANYON BY ROAD સાથે GLASS WALK
- ★ ફક્ત બે 3 STAR હોટેલ.. બાકી બધી જ 4 STAR હોટેલ (OFFICIALLY CERTIFIED)
- ★ લાસ વેગાસ ના નવા આકર્ષણ 'THE SPHERE ની ALL INCLUSIVE' મુલાકાત.. જેમા POST CARD FROM EARTH SHOW, INTERACTION WITH ROBOTICS એન્ટ્રેન્સ રિક્કિટ સાથે ફોટોગ્રાફી (DAY & NIGHT) પણ

### ખાસ નોંદ

વર્ષો થી "ચાલશે-ફાવશે" વાળી ટીપીકલ પેકેજ ટુરો થી ખુબજ અલગ, એવી અમારી અલૌકિક કાર્યશૈલી સાથે.. આજે મોડર્ન પ્રવાસીઓ ના બદલાયેલ ટેસ્ટ અનુરૂપ, દર વર્ષે કંઈક અલગ, ઉત્કૃષ્ટ અને ઉમદા આપવા ની અમારી ક્રાંતિકારી લાવનાઓ, અને પ્રવાસીઓ ના વિશ્વાસે ખરા ઉતરી અમે લગાતાર સફળતા ના શિખરો પામેલ છે ..

20 વર્ષો ના અનુભવ સાથે, ફક્ત 6 વર્ષ માં "ફોરમ શાહ" અને ફોરમ વર્લ્ડવાઈડ આજે, ઘર ઘર માં લોકપ્રિય છે, આ મુકામે પહોંચવા લોકો ને 30-40 વર્ષો લાગી જતા હોય છે, આ પ્રેમ અને વિશ્વાસ બદલ આપ સર્વ નો ખુબ ખુબ આભાર

અન્યો માટે અસંભવ અને અશક્ય એવી પોતાના મહારાજ જેવી સુવિધાઓ શરૂ કરનાર એકમાત્ર પાયોનિયર

પરંપરાગત મેનુ સાથે સાથે ફાસ્ટ ફુડ- ઇટાલિયન- મેક્સિકન- પીઝા પાસ્તા જેવા મલ્ટી ક્યુઝીન મેનુ જમાડનાર એક માત્ર ટુર ઓપરેટર બનેલ છીએ

વર્ષોથી TRAVEL માર્કેટમાં ચાલતી TOP EXPERT TRAVEL કંપની FORAM WORLDWIDE સાથે કરો AMERICA ની ટુર, એ પણ OWNER ફોરમ શાહ સાથે

### ખરેખર પૈસા વસુલ ટુરી #CHALOFORAMKESANG

**બુક કરો 31ST JANUARY પહેલા  
અને મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ**

21N \$7800  
22D \$7020  
/PER PERSON



HOT SELLING

**GRAND AMERICA**  
21N | 22D  
LOS ANGELES | SAN FRANCISCO  
SACRAMENTO | LAKE TAHOE  
MAMMOTH LAKES | DEATH VALLEY  
LAS VEGAS | ORLANDO | NIAGARA  
WASHINGTON DC | VIRGINIA  
(LURRAY) PHILADELPHIA | NEW YORK

APR - 22,29 | MAY - 6,13,20,27 | JUN - 3,17  
JULY - 1,22 | AUG - 12 | SEPT - 2,23 | OCT - 14,28 | NOV - 4



HOT SELLING

**GLIMPSE AMERICA**  
17N | 18D  
NIAGARA | WASHINGTON DC |  
VIRGINIA PHILADELPHIA  
NEW YORK | LOS ANGELES | SAN  
FRANCISCO SACRAMENTO | LAKE  
TAHOE MAMMOTH LAKES | DEATH  
VALLEY | LAS VEGAS

MAY - 6,13,20,27 | JUN - 3,10,17 | JULY - 1,15 | AUG - 5,26  
SEPT - 16 | OCT - 7,28 | NOV - 11,18



HOT SELLING

**EAST COAST**  
07N | 08D  
NIAGARA | WASHINGTON DC  
VIRGINIA (LURRAY) |  
PHILADELPHIA NEW YORK

MAY - 6,13,20,27 | JUN - 3,10,17 | JULY - 1,15 | AUG - 5,26  
SEPT - 16 | OCT - 7,28 | NOV - 11,18



HOT SELLING

**WEST COAST**  
10N | 11D  
LOS ANGELES | SAN  
FRANCISCO SACRAMENTO |  
LAKE TAHOE MAMMOTH  
LAKES | DEATH VALLEY  
LAS VEGAS

APR - 22,29 | MAY - 6,13,20,27 | JUN - 3,17  
JULY - 1,22 | AUG - 12 | SEPT - 2,23 | OCT - 14,28 | NOV - 4



HOT SELLING

**EAST + ORLANDO**  
11N | 12D  
ORLANDO | NIAGARA  
WASHINGTON DC  
VIRGINIA (LURRAY) |  
PHILADELPHIA NEW YORK

MAY - 2,9,16,23,30 | JUN - 6,13,27 | JULY - 11 | AUG - 1,22  
SEPT - 12 | OCT - 3,24 | NOV - 7,14



HOT SELLING

**WEST + ORLANDO**  
14N | 15D  
LOS ANGELES | SAN  
FRANCISCO SACRAMENTO |  
LAKE TAHOE MAMMOTH  
LAKES | DEATH VALLEY  
LAS VEGAS | ORLANDO

APR - 22,29 | MAY - 6,13,20,27 | JUN - 3,17  
JULY - 1,22 | AUG - 12 | SEPT - 2,23 | OCT - 14,28 | NOV - 4



**BOOK NOW**

FORAM +91 9324366095

DHRUV +91 8169369686

DINESH +91 8591728602

SAHIL +91 9619693790

JAY +91 9167008678

VINAY +91 8104578855

### OTHER 2025 SECTORS

AUSTRALIA | NEW ZEALAND | CANADA | SOUTH AMERICA  
SCANDINAVIA | EUROPE | JAPAN | FAR EAST | GREECE | UK SCOTLAND  
TURKEY | BAKU | DUBAI | VIETNAM | SOUTH AFRICA | EGYPT